

વર्ष : 11 • अंक : 4
જુલાઈ-ઓગસ્ટ 2021
સર્ટિફિકેટ : 64



કર ભલા હોણ ભલા
- છગનભા



સર્વ વિશ્વવિદ્યાલય-વૃત્ત

કડી સર્વ વિશ્વવિદ્યાલય, ગાંધીનગરનું વૃત્તપત્ર

સંપાદક : મહિભાઈ પ્રજાપતિ

માત્ર સંસ્થાનીય
પ્રસાર માટે




“આપણો આદર્શ તો એ હોય કે આજે દુનિયામાં મોટામાં મોટું ને સારામાં સારું પુસ્તકલાય બનાવી શકીએ. ઈંચર એવી શક્તિ આપી રહેશે... પુસ્તકલાયનો દિવસે દિવસે વિકાસ થતો જાય એવું કરજો. એક બે માણસ ઘણો વખત આપનારા હશે તો સારું થશે. ગ્રંથપાલ તો તો વેપારીને ન રાખજો જે ફક્ત પુસ્તકોને આચવી શકે. પણ એવો રાખજો કે જે પુસ્તકોને સમજે, તેની પસંદગી કરી શકે. એવો કોઈ સ્વર્ય સેવક ન મળો તો વધારે રૂપિયા આપજો... પુસ્તકલાયની સમિતિ બચાવર કરજો, એમાં વિદ્ધાનોને રાખજો. તો પુસ્તકલાયને જીવનું રાખવામાં મદદ થશે. સમિતિમાં વ્યવહારબુદ્ધિના માણસો જ હોવા જોઈએ એવો વિચાર ન રાખશો. પુસ્તકલાય કેવું જોઈએ, એને કેમ ઓપ ચરી શકે એ તો વિદ્ધાનો જ સમજે.”

મહાત્મા ગાંધી (ગાંધીજીનો અક્ષરદઢે, ભાગ-૫૬, પૃ. ૧૬)



“પુસ્તકો દ્વારા પ્રત્યક્ષ વ્યક્તિની દરમ્યાનગીરી વગર આપણે જ્ઞાન, સંસ્કારિતા, આનંદ અને પ્રેરણા મેળવીએ છીએ, છતાં ગ્રંથપાલ વગરનું પુસ્તકલાય મડદા જેવું છે. ગ્રંથપાલ અસંખ્ય ગ્રંથકારો વરચે અને પ્રજા વરચે આધ્યાત્મિક સંબંધ બાંધી આપનાર ગોર છે. ગોરનો મૂળ અર્થ જો ગુરુ હોય તો એ ગુરુ છે. પણ ગુરુ કરતાં વધારે એ દિલેચ્છુ મિત્ર છે, સ્નેહી છે, સુહદય છે. શું ચાહવું ને શું પસંદ કરવું એ શીખવનારને જો આપણે કળાધર કહેતા હોઈએ તો ગ્રંથપાલ કળાધર પણ છે. એનો નિર્હેતુક પ્રેમ આખી પ્રજાને જ્ઞાનસમૃદ્ધ, સંસ્કારી અને દીનસેવક બનાવવા દિનરાત મથે છે. ખૂબ પસંદગીપૂર્વક ઉત્તમ ગ્રંથસંગ્રહ અને ઉત્તમ ગ્રંથપાલની યોજના થઈ હોય તો પ્રજા જોતજોતામાં ચડે. જૂનો જમાનો આજે હોય તો વોકો ગ્રંથપાલને મિત્રવર્ય તરીકે સંબોધત.”

કાકસાહેબ કાલેલકર (કાલેલકર ગ્રંથાવલિ, ભાગ ૪, પૃ. ૪૮૩)



કોરોના મહામારીમાંથી માનવજીતને ઉગાવવા માટે સમર્પિત બની રહી સેવાઓ આપનારાં મૂઢી ઊંચેરાં વ્યક્તિત્વો અને સંસ્થાઓને બિરદાવીને આભારની લાગણી વ્યક્ત કરવા તેમજ ઓફિસજન સમૃદ્ધ અને હરિયાળું કેમ્પસ બની રહે તે હેતુસર સર્વ વિદ્યાલય, કરીના કેમ્પસમાં ૨૦૦૧ જેટલા છોડવાઓ મંડળના ચેરમેન શ્રી વલ્લભભાઈ પટેલ અને અન્ય પદાધિકારીશ્રીઓના સાંનિધ્યમાં સર્વ વિદ્યાલય પરિવાર દ્વારા રોપવામાં આવ્યા તે પ્રસંગનાં દ્રશ્યો.



એલ.ડિ.આર.પી. આઈ. ટી. ઓન્ડ આર. ગાંધીનગરનાં પૂર્વ-વિદ્યાર્થીની કૃજ્ઞા ટાંક (૨૦૧૫-૧૬થી ૨૦૧૮-૧૯) દ્વારા યુએસએની કેલિઝોર્નિઅસ્ટેટ યુનિવર્સિટીમાંથી એમ.ઇ. (કમ્પ્યુટર સાયન્સ)ની ડિગ્રી મેળવ્યા બાદ એમેજોન કંપનીની 'સ્ટુડન્ટ્સ એમ્બેસેડર' તરીકેની પરીક્ષા પાસ કરતાં કંપનીએ તેને સોફ્ટવેર ડેવલપર એન્જિનિયર તરીકે વાર્ષિક રૂપિયા એક કરોડથી અધિક (\$ ૧૪૪૦૦૦) પગારથી નિમણૂક આપી છે. આ ઉપરાંત કંપનીએ \$ ૮૬૦૦૦ની કિમતના શેર પણ આપ્યા છે. અભિનંદન.

માત્ર સંસ્થાકીય પ્રસાર માટે

कर भला होगा भला

- છુગનભા



सर्व विश्वविद्यालय-वृत्त

ਕਦੀ ਸਰਵ ਵਿਸ਼ਵਿਦਾਲਯ, ਗਾਂਧੀਨਗਰਨੁੰ ਵੁਟਾਪਤ
ਵਰ્਷ : ੧੧, ਅੰਕ : ੪, ਜੁਲਾਈ-ਓਗਸਟ ੨੦੨੧; ਸਾਲਾਂ ਅੰਕ : ੬੪



અનુક્રમ

संपादकीय

ઉપેક્ષિત ગ્રંથપાલો અને ગ્રંથાલયો

તાજેતરના દિવસોમાં રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા ગુજરાતના ૫ જિલ્લા - અમદાવાદ, વડોદરા, રાજકોટ, મહેસૂણા અને જૂનાગઢ-ઓનાં જિલ્લા ગ્રંથાલયોને સ્માર્ટ ગ્રંથાલયોમાં પરિવર્તિત કરવાની અને પ્રયેક્ટને રૂપિયા એક-એક કરોડ કણવી આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ સમાચાર સૌ ગ્રંથાલય-પ્રેમીઓ, શિક્ષણ-પ્રેમીઓ, સમાજહિતચિંતકો વગેરે માટે હરખ ઉપજાવે તેવા છે. આ દસ્તિપૂત્ર જાહેરાત માટે ગુજરાત સરકાર આપણાં અભિમંદનની અવિકારી બની રહે છે. પરંતુ આ સંદર્ભે દુઃખદ બાબત તો એ છે કે આ પાંચેય જિલ્લા ગ્રંથાલયોમાં 'જિલ્લા ગ્રંથપાલ' ની જગ્યા જ ખાવી છે. અલબત્ત, કોઈને ચાર્જ સાંપવામાં આવ્યો હશે. કોણ કરશે સ્માર્ટ ગ્રંથાલય ? આજે કેટલાંય સરકારી ગ્રંથાલયોનું ચાર્જ આધારિત સંચાલન કરવામાં આવી રહ્યું છે. આપણે આશા રાખીએ કે આ Mission અને Visonને અગ્રતાકમ આપીને રાજ્યનાં બધાં જ જિલ્લા - તાલુકા - ગ્રામ્ય ગ્રંથાલયોમાં આવશ્યક મહેકમની ભરતી કરીને સ્માર્ટ ગ્રંથાલયોમાં પરિવર્તિત કરવામાં આવે અને આ સાથે જ આપણે સરકારને આગ્રહભરી વિનંતી કરીએ કે 'ગુજરાતી ભાષા-સાહિત્ય'ના એક વિશેષ ગ્રંથાલય Institute of State Importance-ની સ્થાપના કરવામાં આવે. આ માંગણી એટલા માટે કે આજે ગુજરાતમાં એક પણ ગ્રંથાલય એવું નથી કે જેમાં ગુજરાતી ભાષામાં ઈ. સ. ૧૭૮૮માં મુદ્રિત થયેલ પ્રથમ પુસ્તક મોબિલ બહેરામ કૃત 'ખુરે અવસ્તા'થી શરૂ કરી આજિન સુધી પ્રકાશિત થયેલાં સંઘળાં પુસ્તકો અથવા મહત્વપૂર્ણ બધાં જ પુસ્તકો સંગૃહીત હોય ! ગુજરાતી ભાષા - સાહિત્યનાં મહત્તમ પુસ્તકો ધરાવતા 'ગુજરાત વિદ્યાપીઠ

‘ગ્રંથાલય’ કે ‘ગુજરાતી સાહિત્ય પરિપદ’ના ગ્રંથાલયમાં પણ કુલ મુદ્રિત થયેલાં ગુજરાતી પુસ્તકોનાં ૭૦% જેટલાં પુસ્તકો હોવાની સંભાવના છે. આ પૈકીનાં કેટલાંક આદિમુદ્રિત ગ્રંથોનાં કેટલાં પાન ગાયબ થયેલાં હશે તે પણ એક પ્રશ્ન ખરો જ ! આ સૂચિત ગ્રંથાલયના વ્યાપ અને કાર્યહોજના સંબંધી વિગતે ચર્ચા માટે જૂઓ આ લખનાર કૃત ‘ગુજરાતમાં સર્વોપયોગી એવું એક ગ્રંથાલય હોય ‘સર્વ વિશ્વવિદ્યાલય વૃત્ત, વર્ષ ૮, અંક-૧, જાન્યુઆરી-ફેબ્રુઆરી, ૨૦૧૮ પૃ. ૧-૭.

હોવાની ભાગે જ જરૂરિયાત રહે છે કે સ્વસ્થ, સમરસ અને શાનસમૃદ્ધ સમાજનિર્માણ માટે વિવિધ પ્રકારનાં ગ્રંથાલયોની ભૂમિકા પાયાની ઈટ સમાન અનિવાર્ય છે. ગ્રંથાલયો તો વિશ્વની સંસ્કૃતિઓનાં સંગમતીર્થી તેમજ સંવર્ધન અને સંરક્ષણ કેન્દ્રો છે. દેશ-વિદેશના શિક્ષણવિદી અને શિક્ષણપંચો - Commissionનો વગેરે અનેકાનેકોએ પોતપોતાના ગ્રંથો/અહેવાલોમાં સાર્વજનિક ગ્રંથાલયોને ‘જનસમાજનું વિશ્વ વિદ્યાલય’, ‘પાવરહાઉસ-શક્તિપત્રિજ્ઞાન’ વગેરે તેમજ શૈક્ષણિક ગ્રંથાલયોને શિક્ષણ સંસ્થાઓનાં હઠય સમાન ગણાવેલ છે. કોઈરી કમિશન (૧૯૬૬) તો સ્પષ્ટ ચેતવણી આપતાં પોતાના અહેવાલમાં નોંધ કરેલ શબ્દો ‘No new university, college or department should be set up without taking into account its Library needs in terms of staff, books, journals, space etc. Nothing could be more damaging to a growing department than to neglect its Library or to give it a low priority. On the contrary, the Library should be an important centre of attraction on the college or university campus’ આંખ ઉઘાડનાર બની રહે છે. આમ છતાં, આજની આપણી કોણેજો અને યુનિવર્સિટીઓમાં ગ્રંથાલયો તો છે, પરંતુ ઘણાં ખરાં આ ગ્રંથાલયો ગ્રંથપાલ વિઠોણાં છે. સહાયક વિવસાયિક કર્મચારીઓનું પ્રમાણ પણ આપર્યાત્ત છે. પરિણામે નથી અપેક્ષિત સુનિયોજિત વ્યવસ્થાતંત્ર ગોઈવાઈ શકાતું કે નથી સંતોષકારક સેવાઓ પૂરી પાડી શકતી. ગ્રંથપાલ વગરનું ગ્રંથાલય અર્થહીન બની રહે છે.

આજનાં ગ્રંથાલયો અધ્યતન Information Communication Technologyના વિનિયોગને કારણે ‘Libraries without walls’ અર્થાતું વાચકને પોતાના ઇચ્છિત સ્થળે અને સમયે તેને જરૂરી વાચનસામગ્રી/

માહિતી પૂરી પાડવા આવશ્યક હોઈ સજ્જ બની રહ્યાં છે. ગ્રંથાલયોની આ અસાધારણ અને કલ્યાનાતીત સજ્જતા પાછળ ગ્રંથાલય વિવસાયિકોનાં દાખ્યુપૂત પુરુષાર્થ અને અડગ ધ્યેયનિષ્ઠા તેના પાયામાં રહ્યાં છે તે સ્મરણીય બની રહેવું જોઈએ. આજના ગ્રંથપાલો કસ્ટોડિયન નહીં, પરંતુ શાનસમૃદ્ધ અને પ્રતિબદ્ધ સેવાપરાયણ બની રહેતાં ઉપભોક્તાઓ અને ગ્રંથાલયો વચ્ચેની કડી સમાન છે અર્થાતું તેમનામાં શાનની તૃષ્ણા પણ જન્માવે છે તેમજ તેમની જરૂરિયાતને યથાર્થ રીતે પ્રસન્નચિત્તે સંતોષે પણ છે. શાનના વિતરણ દ્વારા સાંસ્કૃતિક વાતાવરણ ઊભું કરવામાં અને રાષ્ટ્રવિકાસમાં ગ્રંથપાલની ભૂમિકા મહત્વપૂર્ણ ગણાઈ છે. ગ્રંથપાલ સવાયો શિક્ષક ગણાયો છે. માત્ર ગ્રંથસંગ્રહથી ગ્રંથાલયની વિભાવના સાકાર ન જ થાય. આ માટે આવશ્યક બની રહે છે દાખ્યુપૂત ગ્રંથાલયી અને વ્યવસ્થાતંત્રની. આ સંદર્ભે મહત્વાં ગાંધીની શીખ ધ્યાનાર્થ બની રહે છે. તેમજે ૧૯૮૮માં શેઠ મા. જે. પુસ્તકાલયની શિલારોપણવિધિ કરતાં પ્રસંગોચિત ઉદ્ભોધનમાં આપેલ શીખ : “ગ્રંથપાલ કોઈ વેપારીને ન રાખજો કે પુસ્તકોને ફક્ત સાચીએ શકે પણ એવો રાખજો કે જે પુસ્તકોને સમજ શકે, તેની પસંદગી કરી શકે એવો કોઈ સ્વયંસેવક ન મળે તો વધારે રૂપિયા આપજો.” આ સાથે જ પ્રબુદ્ધ ચિંતક કાકસાહેબ કાલેલકરે ગ્રંથપાલનાં કાર્યોની સરાહના કરતાં અને ગ્રંથાલયમાં તેની અનિવાર્ય ઉપસ્થિતિ વિશે નોંધા મંત્રય : “પુસ્તકો દ્વારા પ્રત્યક્ષ વિકિતની દરમાનગીરી વગર આપણે શાન, સંસ્કારિતા, આનંદ અને પ્રેરણા મેળવીએ છીએ, છતાં ગ્રંથપાલ વગરનું પુસ્તકાલય મડદા જેવું છે. ગ્રંથપાલ અસંખ્ય ગ્રંથકારો વચ્ચે અને પ્રજા વચ્ચે આધ્યાત્મિક સંબંધ બાંધી આપનાર ગોર છે. ગોરનો મૂળ અર્થ જો ગુરુ હોય તો એ ગુરુ છે પણ ગુરુ કરતાં વધારે એ હિતેચ્છ મિત્ર છે, સ્નેહી છે, સુહૃદ છે. શું ચાહવું ને શું પસંદ કરવું એ શીખવાનારને જો આપણે કળાધર કહેતા હોઈએ તો ગ્રંથપાલ કળાધર પણ છે. એનો નિર્હુતુક પ્રેમ આજી પ્રજાને શાનસમૃદ્ધ, સંસ્કારી અને દીનસેવક બનાવવા હિનરાત મથે છે. ખૂબ પસંદગીપૂર્વક ઉત્તમ ગ્રંથસંગ્રહ અને ઉત્તમ ગ્રંથપાલની યોજના થઈ હોય તો પ્રજા જોતજોતામાં ચડે, જૂનો જમાનો આજે હોય તો લોકો ગ્રંથપાલને મિત્રવર્ષ તરફે સંબોધિત” (કાલેલકર ગ્રંથાવિ, ભાગ-૪, પૃ. ૪૮૩). સુચિત્તનીય બની રહે છે.

આજની પરાપૂર્વથી પ્રચલિત પરીક્ષાકેન્દ્રી શિક્ષણપ્રણાલીમાં વિદ્યાર્થી કેટલો બધો એકાંગી થતો જાય

છે તે વિશે આપણે સૌ જાણીએ છીએ, અનુભવીએ છીએ અને શિક્ષિત પણ છીએ. આજના આપણા વિદ્યાર્થીઓ Note Cultureથી ગ્રસિત છે તેમને Book Culture - Library oriented કરવા માટે - એક જ્ઞાનસમૃદ્ધ વિદ્યાર્થી/નાગરિકના ઘડતર માટે સમૃદ્ધ અને જીવત સર્વજનિક તેમજ શૈક્ષણિક ગ્રંથાલયો અને તેની સાથે તેના પ્રાણસમાન કાર્યકુશળ, પ્રતિબદ્ધ અને સેવાપરાયણ ગ્રંથાલયો અનિવાર્ય છે. આપણા જાણીતા શિક્ષણવિદું અને હેમચન્દ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના પૂર્વકુલપતિ ડૉ. દાઉદભાઈ ધાંચીએ ‘ઉચ્ચશિક્ષણ કેત્રની જે તકો અને તાકીદ તરફ યુનેસ્કો અને વિશ્વ બેંક દુનિયા સમસ્તનું જે ધ્યાન દોર્યું છે તેની ગંભીરતા અને આવશ્યકતાઓ જોતાં ગ્રંથાલય - શિક્ષણ પ્રવર્તકની. ૧૦ ભૂમિકાઓ ચીધી આપી છે : 1. A Facilitator, 2. A Learning Therapist, 3. A Reading Clinician, 4. A Resource Manager, 5. A Catalyst, 6. A Social Networker, 7. A Techology Savy Professional, 8. A Consultant of Developmental Process, 9. A Co-ordinatior of Current Trends in Education, and 10. A Resource Person for Facility’. જે સંબંધિતો એ ધ્યાન દેવી રહી

આમ છતાં, દુઃખ તો એ વાતનું છે કે આપણા નીતિ-નિર્ધારકેને ગ્રંથાલય - ગ્રંથાલની સુદૃઢ સેવાઓની નિસરણી ઉચ્ચતમ સ્થિરિનાં શિખરો સર કરવામાં ઉપકારક બની રહી હોવા છતાંય શિક્ષણ સંસ્થાઓમાં સુનિયોજિત ગ્રંથાલય સેવાઓ માટે ગ્રંથપાલની અનિવાર્ય આવશ્યકતાને નજર-અંદાજ કરતા જોવા મળે છે. સંભવ છે કે રાજ્ય દ્વારા નિર્ધારિત ગાડીલાઈન્સ - પોલિસી આડે આવતી હોય ! જો આમ જ હોય તો, આવશ્યકતાનુસાર બંધારણમાં પણ ફેરફાર થઈ શકતા હોય તો, રાજ્યના બહુઆધારી અને સ્થાયી વિકાસ માટે, જ્ઞાન આધારિત સમાજના નિર્માણ માટે - વિકાસ માટે - અનિવાર્ય એવાં ગ્રંથાલયોના કરોડરજજી સમાન ગ્રંથપાલોની નિયુક્તિ માટે પુનઃવિચારણા હાથ ધરી ન શકાય ? આ સાથે જ કરુણતા તો એ છે કે જે સમાજ - શિક્ષકો, અધ્યાપકો, સંશોધકો, વિદ્યાર્થીઓ અને પ્રજાજનો - ની સેવાઓ માટે ગ્રંથાલય વ્યવસાયિકોની માંગ છે તેમના તરફથી તો કોઈ પ્રતિસાદ જ સાંભળવા મળતો નથી અર્થાત્ અમારે સુદૃઢ અને સુનિયોજિત ગ્રંથાલય સેવાઓની જરૂરિયાત છે, સમૃદ્ધ ગ્રંથાલયો અને ગ્રંથપાલની આવશ્યકતા છે, અમુક વર્ષોથી અમારા ગ્રંથાલયમાં

ગ્રંથપાલ નથી કે ગ્રંથાલય સેવાઓ સારી રીતે પૂરી પાડવામાં આવતી નથી તે વિશે કોઈ હરફ પણ ઉચ્ચારતું નથી. સૌ અનાસકત ! અહીં ગ્રંથાલય પ્રશિક્ષણાર્થીઓની વ્યવસાય માટે માત્ર માગણી નથી, પરંતુ તેના પાયામાં સમૃદ્ધ અને સુનિયોજિત ગ્રંથાલયો થકી જ્ઞાનસમૃદ્ધ સમાજનિર્માણની જંખના પણ સંનિહિત છે. આ એટલા માટે કે તેમના પ્રશિક્ષણની ગળથૂથીમાં ગ્રંથાલય-સેવાના સંસ્કારોનું સિંચન કરવામાં આવ્યું /આવી રહ્યું છે. અમારી આ સંવેદના સંબંધિતો ક્યારે હૈયે ધરશે ?

ગ્રંથપાલોની ભરતીની સમસ્યા સંદર્ભે યુવા, ઉત્સાહી અને કર્મદ ગ્રંથાલયોઓ સર્વશ્રી ડૉ. મહેશ સોલંકી, ડૉ. ભરત ચૌધરી, શ્રી ઉદ્યન કલાલ વગેરે સૌ ગ્રંથાલય વ્યવસાયિકો/પ્રશિક્ષિતોના કેટલાંક વર્ષોથી વિનયશીલ પ્રયાસો - સંબંધિત મંત્રીશ્રીઓ, અધિકારીશ્રીઓ, સમૂહ માધ્યમોના અધિકારીઓ / તંત્રીશ્રીઓ વગેરેને મળીને પોતાની વાત સમજાવવી - અભિનંદની બની રહે છે. આપણે ઈચ્છીએ કે આપણી આ વાત સત્તાધીશો દ્વારા હૈયે ધરવામાં આવે અને આનુંગિક કાર્યવાહી વથાશીધ હાથ ધરવામાં આવે

આવો, આપણે સૌ પ્રવર્તમાન સમયમાં ગુજરાતમાં વિવિધ પ્રકારનાં ગ્રંથાલયોમાં ગ્રંથપાલોની વર્ષોથી ખાલી પડી રહેલી જગ્યાઓની વિગતો સમૂહમાધ્યમોમાં પ્રગટ થતી રહે છે તેના વાસ્તવનું દર્શાન કરીને રાજ્યમાં ગ્રંથાલય સેવાઓ સુદૃઢ કરવા ચિંતન કરીએ :

શિક્ષણિક ગ્રંથાલયો અને ગ્રંથપાલો :

● ગુજરાત સરકાર દ્વારા અનુધાનિત ૮૦% જેટલી કોલેજોમાં ગ્રંથપાલની જગ્યાઓ ખાલી છે, અર્થાત્ ૨૫૦ જેટલી જગ્યાઓ ખાલી છે. પ્રાય: વર્ષ ૧૯૮૮થી રાજ્ય સરકાર દ્વારા અનુધાનિત કોલેજોમાં ગ્રંથપાલની ભરતી માટે મંજૂરી આપવાનું બંધ કરવામાં આવ્યું છે. ગ્રંથપાલોના અભાવે સંબંધિત કોલેજોના વિદ્યાર્થીઓ અને અધ્યાપકોના જ્ઞાનસંપાદનમાં થઈ રહેલા નુકસાનની અને ગ્રંથાલયોના અવ્યવસ્થાપનની કલ્પના પણ થઈ શકશે ખરી ? આટલાં વર્ષો વ્યર્થ જ વહી ગયાં ને !

આ પૈકીનાં ઘણાં ખરાં કોલેજ ગ્રંથાલયો રૂપોદ્ધ - ૫૦૦૦૦ કે તેથી અધિક પુસ્તકોનો સંગ્રહ ધરાવે છે. આ બધાં ગ્રંથાલયોના સુચારુ સંચાલન માટે સહાયક વ્યવસાયિક કર્મચારીઓ તથા વર્ગ-૪ ના કર્મચારીઓની નિમણૂક માટે કોઈ જ નીતિનિયમો નથી, તેથી સહાયક વ્યવસાયિક સ્થાને

માટે ફોર્મ્યુલા ઘડી કાઢીને અમલીકૃત કરવી જરૂરી બની રહે છે. આ એટલા માટે જરૂરી બની રહે છે કે આ બધાં ગ્રંથાલયો કવચિત અપવાદ બાદ કરતાં વન મેન શો સમાન છે વિદ્યાર્થીઓની સંખ્યા પણ ઘડી મોટી વળી, પોતાની મૂળભૂત ફરજો ઉપરાંત કોલેજની વહીવિશ્વી કામગીરી સંબંધી નાની-મોટી ફરજોની ફરજિયાત સાંપણી ખરી. અરે ! કેટલીક યુનિવર્સિટીઓમાં પણ યુનિવર્સિટી લાઈબ્રેરિયન કે આસિસ્ટન્ટ લાઈબ્રેરિયનને પણ યુનિવર્સિટી દ્વારા એકાધિક સમિતિઓના સભ્ય કે ખાસ હોદ્દો આપીને વધારાની સેવાઓમાં જ વ્યસ્ત રાખવામાં આવતો હોય છે.

આ વાસ્તવિક સ્થિતિમાં કોઈ ગ્રંથપાલ પોતાની ઈનોવેટિવ સેવાઓની કે વૈચારિક ચેતનાની સુવાસ કે અસ્તિત્વની આગવી ઓળખ કે અનિવાર્ય આવશ્યક જરૂરિયાત કરી રીતે પ્રસ્થાપિત કરી શકે ? પરિણામે ગ્રંથપાલો અને ગ્રંથાલયોની essential need વિલાતી જાય છે

* ખાનગી કોલેજો પૈકી કેટલા ટકા કોલેજોમાં ગ્રંથપાલની નિયુક્તિ કરવામાં આવી હોય અને કેટલાને યુજીસી/રાજ્ય સરકાર દ્વારા નિયત પગારધોરણ આપવામાં આવતું હોય તે સંશોધનનો વિષય બની રહે છે. શિક્ષણ અને સમાજ સેવાને વેરેલાં કેટલાંક સારાં ટ્રસ્ટોનો અપવાદ બાદ કરતાં લોકમુખે વહેતી વાતો અનુસાર ખાનગી કોલેજો દ્વારા કોલેજ ગ્રંથપાલોની નિયુક્તિ આશરે રૂ ૧૦,૦૦૦ આસપાસથી શરૂ કરવામાં આવે છે, જ્યારે અધ્યાપકો માટે આવો મોટો બેદભાવ રાખવામાં આવતો નથી. આ બંને સંવર્ગ માટે એક સમાન પગારધોરણ હોવા છતાં આ માનસિકતા પ્રવર્ત્તી રહી છે.

*ગુજરાતમાં ૭૦થી અધિક યુનિવર્સિટીઓ, જેમકે અનુદાનિત, ડિમ્ડ, ખાનગી, કેન્દ્રીય વગેરે પ્રકારની કાર્યરત છે. આ પૈકી રાજ્ય સરકાર દ્વારા અનુદાનિત પરંપરાગત ૧૦ યુનિવર્સિટીઓ પૈકી ફક્ત ૨ યુનિવર્સિટીઓ – એમ એસ યુનિવર્સિટી, વડોદરા અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગ્રંથપાલની જગ્યાઓ રેઝ્યુલર ધોરણે ભરાયેલી છે. આ સંદર્ભે ઉદાહરણ તરીકે જોઈએ તો વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં આ જગ્યા પ્રાય : બે દશકથી ખાલી છે, કચ્છ યુનિવર્સિટીમાં તેના સ્થાપનાકાળ વર્ષ ૨૦૦૩ થી, ગુજરાત યુનિવર્સિટીમાં વર્ષ ૨૦૦૮થી, હેમચન્દ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં વર્ષ ૨૦૦૯થી, સરદાર પટેલ યુનિવર્સિટીમાં વર્ષ ૨૦૧૦થી ગ્રંથપાલની જગ્યા ખાલી છે – આ તો થોડાંક ઉદાહરણો છે. ભક્ત કવિ નરસિંહ મેહતા, ગુરુ ગોવિંદ વગેરે

જેવી કાર્યરત નવી યુનિવર્સિટીઓમાં ગ્રંથપાલની નિયુક્તિ કરવામાં આવી નથી ત્યાં આવશ્યક ગ્રંથાલય સેવાઓ કઈ રીતે પૂરી પાડવામાં આવતી હોય ? એક અન્ય ઉદાહરણ જોઈએ : કચ્છ યુનિવર્સિટીનું નવનિર્મિત વિશાળ ગ્રંથાલય ભવન દર્શનીય છે, પરંતુ આ ગ્રંથાલયમાં ગ્રંથપાલ તેમજ અન્ય કોઈ કર્મચારીની યુનિવર્સિટીના સ્થાપનાકાળ(૨૦૦૩)થી આજદિન સુધી રેઝ્યુલર ધોરણે ભરતી કરવામાં આવી નથી – યુનિવર્સિટી દ્વારા ઉચ્ચક પગારથી હંગામી ધોરણે નિયુક્ત કર્મચારીઓ આશાસ્પદ બની રહી સેવાઓ આપી રહ્યા છે.

એક મોટી વિસંગતતાતો એ છે કે રાજ્યની અનુદાનિત યુનિવર્સિટીઓ પૈકી એક માત્ર એમ એસ યુનિવર્સિટીના યુનિવર્સિટીના ગ્રંથપાલને યુજીસી પગાર ધોરણ – પ્રોફેસર સમક્ષ હોદ્દો અને પગાર ધોરણ આપવામાં આવે છે, જ્યારે રાજ્યની અન્ય યુનિવર્સિટીઓના યુનિવર્સિટી ગ્રંથપાલો માટે રાજ્યનું પગારધોરણ લાગુ પાડવામાં આવે છે, જે ઘણું નિભન્તમ છે. ભરતી માટે યુજીસી નિર્ધારિત લાયકાત નિયત કરવામાં આવેલી છે. જ્યારે કોલેજોના ગ્રંથપાલોને યુજીસી પગારધોરણ આપવામાં આવે છે, પરિણામસ્વરૂપે સભ્યાન્તરે કોલેજ ગ્રંથપાલો પ્રોફેસર સમક્ષ પગાર મેળવે છે, જ્યારે યુનિવર્સિટી ગ્રંથપાલો તેનાથી ઘણું ઓછું વેતન મેળવે છે. આસ્થ્યાર્થ તો એ છે કે યુજીસી દ્વારા અધ્યાપકો ઉપરાંત યુનિવર્સિટીના શારીરિક શિક્ષણ નિયામક અને યુનિવર્સિટી લાઈબ્રેરિયન માટે યુનિવર્સિટી પ્રોફેસર સમક્ષ પગાર ધોરણ નિર્ધારિત કર્યું હોવા છતાં, રાજ્ય સરકાર દ્વારા ત્રણક વર્ષ પૂર્વ શારીરિક શિક્ષણના નિયામકો માટે યુજીસી પગાર ધોરણ સ્વીકારી લીધું, જ્યારે યુનિવર્સિટી લાઈબ્રેરિયનો માટે તેનો સ્વીકાર ન કર્યો. આ એક વિડમ્બના જ ગણવી રહી !

આ બધી યુનિવર્સિટીઓમાં યુનિવર્સિટી ગ્રંથપાલ ઉપરાંત સહાયક વ્યવસાયિક કર્મચારીઓ જેમકે મદદનીશ ગ્રંથપાલ, પ્રોફેશનલ આસિસ્ટન્ટ, ટેકનિકલ આસિસ્ટન્ટ વગેરે તેમજ જિન વ્યવસાયિક કર્મચારીઓની જગ્યાઓ પણ મોટા પ્રમાણમાં ખાલી છે. આ સંદર્ભે ખાસ ધ્યાનાર્હ બાબત તો એ છે કે સહાયક વ્યવસાયિક કર્મચારીઓનું પ્રમાણ નક્કી કરતી કોઈ ચોકક્સ ફોર્મ્યુલા કે નીતિનિયમો પણ નિર્ધારિત કરવામાં આવેલા નથી, પરિણામે વિવિધ યુનિવર્સિટીઓનાં ગ્રંથપાલોમાં વ્યવસાયિક કર્મચારીઓની સંખ્યા અને હોદ્દાના નામકરણમાં ભારે વિસંગતતા પ્રવર્ત્તી રહી છે. ઉ. દા. તરીકે ગુજરાત યુનિવર્સિટી અને રાજ્યની અન્ય યુનિવર્સિટીઓ, જેમ કે, સરદાર પટેલ યુનિવર્સિટી, હે.

૭. ગુ. યુનિવર્સિટી વગેરેના આસિસ્ટન્ટ લાઈબ્રેરિયનનું પગારધોરણ એક સમાન નથી. ભારે મોટી વિસંગતતા છે, જ્યારે લાયકાત એક સમાન છે.

આ જ રીતે રાજ્યની અનુદાનિત યુનિવર્સિટીઓનાં ગ્રંથાલયો માટે અનુદાન ફણવવા સંબંધી કોઈ ચોક્કસ નીતિનિયમો નથી. ચિંતાજનક બાબત તો એ છે કે નવી શરૂ કરવામાં આવેલી યુનિવર્સિટીના ગ્રંથાલય માટે ખાસ પ્રોત્સાહક વિશેષ અનુદાન ફણવવાના સ્થાને યુનિવર્સિટી ગ્રંથપાલ કે ગ્રંથાલય ભવન નથી કે થોડાંક ડિપાર્ટમેન્ટ્સ છે વગેરે કારણોસર શરૂઆતમાં સામાન્ય રકમ ફણવવામાં આવે છે. ત્યાર બાદના બજેટમાં આ રકમને અનુદાન નક્કી કરવાનો આધાર તરીકે સ્વીકારીને તેમાં પ્રતિ વર્ષ આશરે ૧૦% જેટલો વધારો કરવામાં આવતાં નવી યુનિવર્સિટીઓના ગ્રંથાલયોને ભારે શોષાંનું પડી રહ્યું છે. આમ, નવી અને અગાઉ સ્થાપિત યુનિવર્સિટીઓનાં ગ્રંથાલયોમાં વાચનસામગ્રી, ઉપલબ્ધ સગવડો અને ગ્રંથાલય સેવાઓમાં ભારે વિસંગતતા બની રહી છે – એક મોટી ખાઈ ઊભરી આવી છે. જે તે યુનિવર્સિટી વિસ્તારના વિવાદીઓ અને અધ્યાપકોના હિતને ધ્યાને લઈને આ સમસ્યા હલ કરવી જરૂરી બની રહે છે. આ એક ગંભીર પ્રશ્ન છે

* કવચિત અપવાદ બાદ કરતાં ખાનગી યુનિવર્સિટીઓ દ્વારા કેન્દ્રિય ગ્રંથાલયો શરૂ કરવામાં આવતાં ન હોવાથી ગ્રંથપાલની ભરતીનો છેદ જ ઉડાડી ઢેવામાં આવ્યો છે. આશ્વર્ય તો એ છે કે આ પૈકી સારી યુનિવર્સિટીઓ તરીકે ફણવવામાં આવતી નિરમા, પીડીપીયુ વગેરે ખાનગી યુનિવર્સિટીઓમાં પણ કેન્દ્રિય ગ્રંથાલયો નથી. શું ખાનગી યુનિવર્સિટીઓને કેન્દ્રિય ગ્રંથાલયની આવશ્યકતામાંથી મુક્તિ આપવામાં આવી હોય કે આંખ આડા કાન !

* સરકારી કોલેજો, જેમ કે સમી, હારીજ, બહુચરાજી, સાંતલપુર વગેરે કોલેજોની સ્થાપના કરવામાં આવી ત્યારથી જ ગ્રંથપાલની ભરતી કરવામાં આવી નથી. સાંતલપુરની કોલેજમાં તો ગ્રંથપાલનું મહેકમ જ મંજૂર કરવામાં આવ્યું નથી, તેથી ભરતીનો પ્રશ્ન જ પેદા થતો નથી એક અંદાજ મુજબ રાજ્યની ૧૧૦ જેટલી સરકારી કોલેજો પૈકી ઘણી કોલેજોમાં ગ્રંથપાલની જગ્યાઓ ખાલી છે.

* ૫૬૦૦+ માધ્યમિક / ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ગ્રંથપાલની જગ્યાઓ ઉપર ભરતી કરવામાં આવી નથી. શાળા ગ્રંથાલયો અને શાળા ગ્રંથપાલો તો બાળકોને વાચનરસ વિકસાવવા માટેનાં ધરુવાડિયાં છે તે

કહેવાની જરૂર જરી ? આમ છતાં શાળા ગ્રંથપાલોની ભરતીમાં સંદર્ભ ઉપેક્ષા કરવામાં આવી રહી છે જાણવામાં આવ્યું છે કે કોઈ શાળામાં શિક્ષક ફાજિલ પડે તો તેની નિમણૂક શાળા ગ્રંથપાલની જગ્યા ઉપર કરવામાં આવે છે. ગ્રંથાલય પ્રશિક્ષણ મેળવ્યા વગરની વ્યક્તિની શાળા ગ્રંથપાલ તરીકેની નિમણૂક કરી રીતે યોગ્ય ગણાય ? આવી નિમણૂકોથી શિક્ષણનું શું ભલુ થશે ?

સાર્વજનિક ગ્રંથાલયો અને ગ્રંથપાલો :

* સરકારી ગ્રંથાલયો, જેમકે તાલુકા, જિલ્લા અને રાજ્ય મધ્યસ્થ ગ્રંથાલયોમાં વિવિધજસ્તરના ગ્રંથાલય વ્યવસ્થાયિકોની ૧૦૦ જેટલી જગ્યાઓ ખાલી છે

* રાજ્ય ગ્રંથાલય નિયામકની જગ્યા તા. ૧ જૂન, ૨૦૧૨થી ખાલી છે

* રાજ્યના ઉત્ત જિલ્લાઓ પૈકી ૭ જિલ્લાઓમાં જિલ્લા ગ્રંથાલયો અને પછી તાલુકાઓમાં તાલુકા ગ્રંથાલયો સ્થાપવામાં આવ્યાં નથી. કાર્યરત જિલ્લા અને તાલુકા ગ્રંથાલયો પૈકી ફક્ત ૨૦ જિલ્લા ગ્રંથાલયો અને ૪૨ તાલુકા ગ્રંથાલયો પોતાની માલિકીનાં ભવનોમાં કાર્યરત છે

* ગુજરાતમાં ૧૮૬૧૮ ગામડાં છે. આ પૈકી ફક્ત ૨૫૬૦ ગ્રામ્ય ગ્રંથાલયોઓને રાજ્ય સરકાર દ્વારા પ્રતિ ગ્રંથાલય દીઠ ફક્ત જી ૧૫૦૦૦ જેટલું અનુદાન આપવામાં આવે છે. આ અનુદાનમાંથી ગ્રંથપાલ તરીકે સેવા આપનારે માસિક માનદેવતન, સફાઈ કર્મચારી, લાઈટબીલ વગેરેનો ખર્ચ બાદ કરતાં કેટલી રકમ બચશે ? અનુદાન મેળવતાં ગ્રંથાલયોની સંખ્યા ઉપરથી પ્રતિફિકિત થાય છે કે ૧૬૦૫૮ ગામડાઓમાં ગ્રંથાલયો નથી અથવા અનુદાનપાત્ર નથી. આ ગામડાંઓને અનુદાનનો લાભ કેમ નહીં ? આ સંદર્ભે ચિંતાકારક એક પ્રશ્ન એ છે કે પ્રાપ્ત માહિતી અનુસાર વર્ષ ૧૮૬૬૬માં ઉચ્ચર ગ્રામ ગ્રંથાલયો અનુદાન મેળવતાં હતાં, જ્યારે વર્ષ ૨૦૨૧ માં આ સંખ્યા ઘટીને ૨૫૬૦ થઈ. શું બાકીનાં ગ્રંથાલયો બંધ થઈ ગયાં કે અનુદાનની પાત્રતા ગુમાવી કે અનુદાનની રકમનો અભાવ કે અન્ય કોઈ પ્રશ્નો જવાબદાર છે ?

હકીકતમાં ગામદીઠ સરકારી ગ્રંથાલયની સ્થાપના કરવી જોઈએ અને તેના ગ્રંથપાલોને સરકારી પ્રાથમિક શાળાના શિક્ષક સમક્ક્ષ પગાર-ધોરણ આપવું જોઈએ. ગામ ત્યાં શાળા અને ગ્રંથાલય મેન્ડેટરી બની રહેવાં જોઈએ. આ ગ્રંથપાલ સક્ષમ ગ્રંથાલય સેવાઓ પૂરી પાડવા ઉપરાંત ગામની માહિતી જરૂરિયાતો પૂરી પાડવામાં તેમજ

ખેડૂતલક્ષી સરકારી યોજનાઓ અને અન્ય આનુષેંગિક યોજનાઓની જાણકારી તેના લાભાર્થીઓને પહોંચાડવા માટે KEY RESOURCE PERSON બની રહેશે - જે તે ગામનો સવાયો ગ્રામસેવક બની રહેશે. આ ગ્રામગ્રંથાલયો પ્રજાના સંસ્કાર ઘડતર કરવા ઉપરાંત સ્થાનિક લોકોને રોજગારી માટે માર્ગદર્શનન પૂરું પાડવા તેમજ વિવિધ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે માર્ગદર્શન તેમજ સુગુણિશીલ સાહિત્ય પૂરું પાડવાની મહત્ત્વપૂર્ણ કામગીરી કરીને સૌ માટે ઉપકારક બની રહેશે. આ ગ્રામ ગ્રંથાલય ખરા અર્થમાં ગામનું કિયાશીલ શાનકેન્દ્ર બની રહેશે. આ પગલું ખૂબ જ લાભદાયી અને દૂરંદેશિતાશીલ બની રહેશે

* રાજ્ય સરકાર દ્વારા વિવિધ સ્તરનાં ગ્રંથાલયો, જેમકે, વિશિષ્ટ, શહેર ગ્રંથાલય, નગર કક્ષા ગ્રંથાલય, જાહેર શાખા ગ્રંથાલય, મહિલા ગ્રંથાલય, બાળ ગ્રંથાલય વગેરેને અનુદાન પેટે જે રકમ ચુકવવામાં આવે છે તેમાંથી આ ગ્રંથાલયોના ગ્રંથપાલોને પ્રાથમિક શિક્ષક સમાન પગારની વાત તો દૂર રહી પણ સરકારના વર્ગ-૪ ના કર્મચારી જેટલો પગાર પણ ચૂકવી શકતો નથી. આ બધાં ગ્રંથાલયો દાન ઉપર નભી રહ્યાં છે, પરિણામસ્વરૂપે આ ગ્રંથાલયોની સેવાઓ પણ મર્યાદિત બની રહી છે

આ કક્ષાનાં અનુદાનિત ગ્રંથાલયો પૈકી કેટલાંક ગ્રંથાલયો શતાબ્દી વટાવી ચૂકેલાં હોવાની સાથે વાચનસામગ્રીનો સમૃદ્ધ બજાનો ધરાવે છે. કેટલાંક ગ્રંથાલયો તો ૫૦૦૦૦થી એક લાખ કે તેનાથી અધિક પુસ્તકોનો સંગ્રહ ધરાવે છે. પરિણામે તેમનો ઉપભોક્તા વર્ગ પણ સંખ્યાની દસ્તિએ મોટો, પ્રબુદ્ધ અને વૈવિધ્યશીલ રહેતો હોવાથી ગ્રંથપાલ ઉપરાંત સહાયક કર્મચારીઓની ઉપસ્થિતિ અનિવાર્ય બની રહેતી હોઈ પ્રાપ્ત અનુદાન પગારખર્ય (અને તે પણ સરેરાશ વર્ગ-૪ના કર્મચારી જેટલું આપવામાં આવતું હોય કે કેમ ?) અને અન્ય નિભાવખર્ય પેટે જ વપરાઈ જાય છે.

રાજ્ય સરકારે ગ્રંથાલય સેવાને આવશ્યક સેવા તરીકે સૈદ્ધાન્તિક સ્વીકાર કરવો જોઈએ અને ગુજરાતના પ્રત્યેક ગામ, નગર, શહેર વગેરેમાં કાર્યરત ગ્રંથાલયો / નવાં ગ્રંથાલયો શરૂ કરીને તેમજ તેમના સ્તર અનુસાર મહેકમ અને પગારધોરણ નકરી કરીને માધ્યમિક/ઉચ્ચ માધ્યમિક તથા કોલેજના વિવિધ પ્રકારના સ્થાન માટે પગારના ૧૦૦% અનુદાન આપવામાં આવે છે તે મુજબ વિવિધ પ્રકારના ગ્રંથાલયોમાં અનુદાન આપવું જોઈએ. ખાસ કરીને ગ્રામ્

ગ્રંથાલયોને તો રાજ્યના ગ્રંથાલય ખાતાના રીધા અંકુશ હેઠળ સરકારી ગ્રંથાલય તરીકે સ્થાપીને સરકારી પ્રાથમિક શાળાના શિક્ષક સમકક્ષ પગાર ધોરણથી ગ્રંથપાલની નિયુક્તિ કરવી જોઈએ. અનુદાનિત ગ્રંથાલયોના સ્થાયી અને સુધ્યાંત્રિત વિકાસ માટે કર્મચારીઓના પગારના ૧૦૦% અનુદાન ઉપરાંત પ્રતિવર્ષ વિકાસ અનુદાન ફાળવવું જોઈએ આપણે અમેરિકા અને યુરોપની ગ્રંથાલય સેવાઓની પ્રશંસા કરીએ છીએ, પરંતુ ઘરાઓંગણે તેવી સેવાઓ ઉભી કરવા માટે તેના વ્યવસ્થાપનને એક આદર્શ તરીકે સ્વીકારીને તેનો અમલ કરતા નથી

* સાર્વજનિક ગ્રંથાલયોના સક્ષમ અને દસ્તિપૂત્ર વિકાસ માટે રાજ્યમાં ‘સાર્વજનિક ગ્રંથાલય ધારો’ આવશ્યક જ નહીં, પરંતુ અનિવાર્ય બની રહે છે. આ સંદર્ભે સ્પષ્ટતા કરવી રહી કે છેક ૧૯૬૫ થી શરૂ થયેલી આ વિચારણા વર્ષ ૨૦૦૧માં ગુજરાત વિધાનસભાએ આ ધારો પસાર કરીને પૂર્ણ તો કરી, પરંતુ આશ્રયકારક બાબત એ છે કે આ ધારાની કાયદાકીય જોગવાઈ આજિન સુધી નિયત ન થઈ શકતાં આ ધારો અમલમાં આવ્યો નથી. શું આ બાબત પણ ઐતિહાસિક રેકર્ડ થશે ! રાજ્યમાં ગ્રંથાલય પ્રવૃત્તિના સાત્ત્યપૂર્ણ વિકાસ માટે ‘શીડ કી હુણી’ સમાન આ ધારાના અમલમાં આટલી ઉદાસીનતા ગ્રંથાલય સેવાઓના પ્રચાર-પ્રસાર અને ગ્રંથપાલોની ભરતી સંદર્ભે ઘણું કહી જાય છે.

આપણા પ્રબુદ્ધ સમાજચિંતક મો પ્રવીશ પટેલે તેમના પુસ્તક વિશ્વ આધુનિક કેવી રીતે બન્યું ? (૨૦૨૧માં યુરોપ/અમેરિકાના દેશો અને આપણી વચ્ચે વિકાસની ખાઈ કેમ વધતી ગઈ તે બાબતે ગહન ચિંતન કરતાં ‘કઈ બાબતોમાં ભારતે પચ્ચિમ પાસેથી શીખવાની જરૂર છે’ તે તારવી આપતાં કેટલાંક અન્ય તારણોની સાથે નોંધ્યું છે “આપણી વિદ્યાસંસ્થાઓમાં સમાજના જુદા જુદા પ્રશ્નો અંગે ખુલ્લા મનથી મૌલિક અને બારીક ચિંતન કરવાની ક્ષમતા વધી તેવી ઉદારમતવાદી (liberal) કેળવણીને મહત્વ આપવું પડશે” આ હેતુ સિદ્ધ કરવા માટે અર્થાત્ શાન આધારિત સમાજનિર્મિત માટે વિવિધ સ્તરની ઉચ્ચગુણવત્તાશીલ શિક્ષાણ સંસ્થાઓ કે જે તેજસ્વી અધ્યાપકોથી હરીભરી ચાખવાની સાથે તેના અનિવાર્ય અંગ તરીકે સમૃદ્ધ, કિયાશીલ અને ઊર્જવાન ગ્રંથાલયો અને ગ્રંથપાલોથી સંપન્ન હોવાં આવશ્યક છે.


- મહિબ્બાઈ પ્રજાપતિ

શ્રી દ્વાર્જિતિ

**મૂઢી ઉંચેરા કર્મશીલ અને સહદ્યી શિક્ષક –
ગૃહપતિ સ્વ. ગણેશભાઈ કા. પટેલ**

આપણા આર્થગ્રંથ ‘શ્રીમદ્ભગવદ્ગીતા’ના બીજરૂપ મંત્ર ‘કર્મઝ્યેવાવિકારસે મા ફ્લેષુ કદાચન’ ને સાચા અર્થમાં આત્મસાત કરીને તેને જીવનવ્યવહારમાં કિયાન્વિત કરતાં સર્વ વિદ્યાલયનાં શિક્ષકત્વ, ગૃહપતિત્વ તથા આચાર્યત્વને મૂઢી ઊંચેરાં દીપાવનાર અને આ સાથે જ ‘ધરતી’ના સમાજહિતેષી, નિર્ભક અને જાગૃતુક તંત્રી તરીકે સ્વસ્થ સમાજઘડતરમાં યોગદાન આપનાર શ્રી ગણેશભાઈ કાનજીભાઈ પટેલનું અમદાવાદમાં તા ૧૦ જુલાઈ, ૨૦૨૧ના રોજ અવસાન થતાં સર્વ વિદ્યાલય પરિવાર દુઃખાંલાગણી અનુભવે છે. પરમાત્મા સહદ્યગતના આત્માને શાશ્વત શાંતિ અર્પે અને શોકસંતપ્ત પરિવારજનોને દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી સર્વ વિદ્યાલય કેળવણી મંડળ, કડી-ગાંધીનગરના ચેરમેન અને કડી સર્વ વિશ્વવિદ્યાલય, ગાંધીનગરના પ્રેસિડેન્ટ શ્રી વલ્લભભાઈ એમ. પટેલ અને આ સાથે સમગ્ર સર્વ વિદ્યાલય પરિવારની પ્રાર્થના.

સ્વ. ગણેશભાઈએ પોતાના વતન દેણપમાંથી પ્રાથમિક શિક્ષણ અને ત્યાર બાદ વિસનગરની નૂતન સર્વ વિદ્યાલયમાંથી મોટ્રિક સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. એક તેજસ્વી વિદ્યાર્થી હોવાના નાતે ઉચ્ચશિક્ષણ મેળવવાની તીવ્ર ઈચ્છા હોવા છતાં કુંભબની આર્થિક સ્થિતિ સારી ન હોવાના કારણે ઉનાવા (તા જિ ગાંધીનગર)માં પ્રાથમિક શિક્ષક તરીકે પોતાની વ્યવસાયિક કારકિર્દિનો પ્રારંભ કર્યો હતો. વધુ અભ્યાસની જિજ્ઞાસા બળવત્તર બની રહેતાં એક્સ્ટર્નલ વિદ્યાર્થી તરીકે ગુજરાત યુનિવર્સિટીમાંથી ઠન્ટરની પરીક્ષા પાસ કરી. આ ઉપરાંત એસ ટી સી ની પરીક્ષા ઉતીર્ણ કરતાં ડાંગરવાની માધ્યમિક શાળા ‘સર્વોદય વિદ્યાલય’માં શિક્ષક તરીકે જોડાયા. અહીંની નોકરી દરમિયાન બી. એ. પણ થયા અહીં પ્રાય: સાડા ત્રણ વર્ષ સુધી સેવાઓ આપ્યા બાદ ઉત્તર ગુજરાતના સુખ્યાત કેળવણીધામ ‘સર્વ વિદ્યાલય’, કરીમાં



શિક્ષક તરીકે તા ૧૫ જૂન, ૧૯૫૮ના રોજ જોડાયા અને અહીંથી જ તા ૩૧ મે, ૧૯૮૭ ના રોજ વયોગ્યિત સેવાનિવૃત્ત થયા હતા. શિક્ષક તરીકેની મૂળભૂત ફરજો ઉપરાંત તેમણે સતત ૨૫ વર્ષ સુધી શાળાના ૫૦૦થી અધિક છાત્રોની સંખ્યા ધરાવતા છાત્રાલયના ગૃહપતિ તરીકે પણ સેવાઓ આપી હતી. તેમના અહીંના કાર્યકાળની વિશિષ્ટ અને ઉદાહરણસ્વરૂપ ઉપલબ્ધ એ કે તેમની સેવાઓથી પ્રભાવિત થતાં સંસ્થા દ્વારા તેમને બી. એડ. માટે ચાલુ પગારે તેથ્યૂટ કરતાં તેમણે આ ડિગ્રી પ્રથમ વર્ગ સાથે મેળવી હતી. આ ઉપરાંત કારકિર્દિના અંતિમ દશકમાં મંડળ દ્વારા તેમની નિમણ્ણૂક દ્વિતીય આચાર્ય – ‘હેડમાસ્ટર’ પટે કરવામાં આવી હતી. નિવૃત્તિ બાદ પ્રારંભમાં ૧૯૮૭-૮૮ સુધી સર્વ વિદ્યાલય કેમ્પસ, કરીના અને બાદમાં ગાંધીનગરના કરી કેમ્પસ (૧૯૮૫-૮૬)ના ‘કેમ્પસ ડાયરેક્ટર’ તરીકે નિયુક્તિ કરવામાં આવતાં તેમણે આ હોદ્દા ઉપર પ્રશસ્ય સેવાઓ આપી હતી. એક મૂલ્યનિષ્ઠ શિક્ષક તરીકે તેમની આગણી વિશેષતા એ રહી હતી કે તેઓશ્રી એક સારા વાયક હતા, પરિણામે છાત્રાલયમાં સાચં પ્રાર્થના સમયેનાં તેમનાં ‘વક્તવ્યો’ અને લેખનમાં તોરોતાજળી અને વિચારશીલતાનાં સહજમાં દર્શન થતાં. તેમણે એક શિક્ષક અને ગૃહપતિ તરીકે છાત્રાલયને શિક્ષણના ધરવાદ્યા તરીકે ખરા અર્થમાં આત્મસાત કરતાં છાત્રાલયના વિદ્યાર્થીઓના જીવનઘડતરમાં તેમની નોંધપાત્ર ભૂમિકા રહી છે. આ સંદર્ભે ઉત્સેખ કરવો રહ્યો કે પ્રભર કેળવણીવિદ પ્ર. નિવેદીને છાત્રાલય વિશેના ગણેશભાઈના લેખોની મુક્તકંક્રિ પ્રશંસા કરતાં શ્રી ગણેશભાઈને લખેલા પત્રમાં જ્ઞાન્યું છે કે : “છાત્રાલયના પ્રશ્નો અંગે આપની સૂજ ઊડી છે તે જોઈને ઘણો આનંદ થાય છે... આપની જાણકારી અને તે અંગેની આપની દસ્તિનો લાભ ગુજરાતના શિક્ષકોને મળે એ ઘણું જ આવકારદાયક છે.”

એક સહદ્યી અને કર્તવ્યનિષ્ઠ શિક્ષક, વત્સલ ગૃહપતિ, વહીવટીય સૂજ બૂજ સાચેના આચારવાન આચાર્ય

/ કેમ્પસ ડાયરેક્ટર અને પોતાના બૃહં કુંભના એક જવાબદી સભ્ય તરીકેની તેમની કાર્યજ્ઞતિ અને સેવાઓની સુવાસની પ્રતીતિ તેમને શિક્ષણવિદો પ્ર નિરેદી, અનામી, ડૉ. મફન્તલાલ પટેલ વગેરેએ લખેલા પત્રો, તેમણે સ્વયં નિખાલસત્તા સાથે લખેલ આત્મવૃત્ત ‘અતીતના ઓવારેથી’, તેમના સાથીઓ, સ્નેહીજનો, વિદ્યાર્થીઓ વગેરેએ તેમની સાથેના સુમધુર સંસ્મરણો વાગોળ્યા છે તે વગેરેના માધ્યમથી થાય છે. પ્રવર્તમાન કેમ્પસ ડાયરેક્ટર ડૉ. સોમભાઈ પટેલ તેમને શ્રદ્ધાંજલિ અર્પતાં નોંધ્યું છે કે “સર્વ વિદ્યાલયની ક્રિતિ ચોમેર ફેલાવવામાં શિક્ષક તરીકે તેમનું મોઢું યોગદાન હતું.” આપણા સર્વ વિદ્યાલય કેળવણી મંડળના ચેરમેન અને કડી સર્વ વિશ્વવિદ્યાલયના પ્રેસિડેન્ટ શ્રી વલ્લભભાઈ પટેલ કે જેઓશ્રી સ્વ ગણેશભાઈના વિદ્યાર્થી રહી ચૂક્યા છે તેમણે અહોભાવપૂર્વક નોંધ્યું છે : “આજનું મારું અંગેજ ભાષાનું જ્ઞાન તેમના શિક્ષણને આભારી છે. અતિશયોક્તિ વગર જ્ઞાનું છું કે જેમ ‘રસગુલાં’ કે ‘ગુલાબજીબુનું નામ સાંભળતાં મનમાં પાણી વળે તેવું તેમનું વર્ગખંડમાં તેમનું આગમન અમે અનુભવતા અને વળી ખાસ નોંધપાત્ર બાબત એ કે પૂસાહેલ તેમના તાસમાં આ બને મીઠાઈઓનો અચૂક ઉલ્લેખ કરે અને કરે જ ! તેમની યાદદાસ્ત પણ અદ્ભુત ! તેઓશ્રી કોઈ એક વિષયના શિક્ષક સુધી મર્યાદિત ન બની રહેતાં વિદ્યાર્થી ઘડતરમાં ભારે રસ-નુચિ ધરાવતા.” તેમના પ્રાચાર્ય રહી ચૂકેલા જાણકાત્તા કેળવણીવિદ્ધ અને રાષ્ટ્રપતિ પુરસ્કૃત શ્રી મનુભાઈ પટેલ તેમને ‘અણિશુદ્ધ અધ્યાપક, કર્તૃવનિષ્ઠ ગૃહપતિ અને ધાત્રોના વિકાસ માટે સતત મધ્યતા રહેતા વિદ્યાપુરુષ’ તરીકે ઓળખાવ્યા છે. ખાસ તો શ્રી ગણેશભાઈના ભત્રીજાઓ વગેરે કે જેઓ કિરીમાં તેમના વેર રહીને પોતાની ડેક્કર, એન્જિનિયર વગેરે તરીકેની ઉજ્જવળ કારકિર્દી ઘડી શક્યા છે તેનું શ્રેય આ શ્રદ્ધેય દંપતીને આપવાની સાથે તેમનાં ધર્મપત્ની શ્રીમતી હીરાબહેનને પોતાની બીજી મા તરીકે ઓળખાવતાં જોવા મળ્યાં છે. અરે ! ખુદ ગણેશભાઈએ આ સંદર્ભે ગર્વ અનુભવતાં નોંધ્યું છે કે “માતૃવત પ્રેમ આપીને એ બધાંનાં કાકી મટીને ‘મા’ બન્યાં પરાર્થે હંમેશાં એમની આંખમાં આંસુ ઊભરાતાં.”

એક કર્મઠ અને સહદ્ય શિક્ષક તથા ગૃહપતિ ઉપરાંત ‘ધરતી’ માસિકના સતત ૧૩ વર્ષ સુધી પ્રતિબદ્ધ તંત્રી તરીકે તેમણે આપેલી સેવાઓની સુવાસની-વૈચારિક ચેતનાની પ્રતીતિ તેમના ગ્રંથ ‘કર્મઝ્યેવાધિકારસે’ (૨૦૧૭)ના માધ્યમથી થાય છે પ્રસ્તુત ગ્રંથમાં સંવિશેષતઃ

સમાજજીવન અને શિક્ષણને કેન્દ્રમાં રાખીને ‘ધરતી’ ઉપરાંત ‘ઉદાત શિક્ષણ’, ‘ગતિશીલ શિક્ષણ’, ‘નૂતન શિક્ષણ’, ‘સર્વપ્રિય’, ‘ઉમિયા જ્યોત’ વગેરે સામયિકોમાં તેમના પ્રગત થયેલા શતાધીક લેખોના માધ્યમથી થાય છે. આ બધાં સામયિકોમાં વખતોવખત પ્રગત થયેલા શતાધીક લેખો પૈકી પસંદગીના ૭૦થી અધિક લેખોનું સંકળન-સંપાદન ઉપર્યુક્ત ગ્રંથમાં તેમનાં પુત્રી ડૉ. ગીતાબહેન પટેલ દ્વારા કરવામાં આવ્યું છે. જેમાં તેમનાં એક કેળવણીવિદ અને સમાજમાં ઘર કરી ગેલી કુરેઢિઓ સામે નિર્મભ વિદ્રોહ કરનાર અને સમયનાં વહેણો સાથે સમાજને કલ્યાણ-પથ તરફ દિશાનિર્દેશ કરનાર અદના સમાજહિતચિંતક સમાજસેવકનાં દર્શન થાય છે. આ બધા લેખોમાં સ્વસ્થ ચિત્તે ડેક્ઝિયું કરતાં શિક્ષણ અને સમાજજીવનના વ્યાપક ફ્લક ઉદા. તરીકે વિદ્યાર્થીઓએ શું વાંચવું, શિક્ષણનું વ્યાપારીકરણ, શિક્ષકની સજજતા, ગૃહપતિત્વ, ધાત્રાવય, વ્યક્તિતત્ત્વવિકાસ, વ્યસનમુંજિત, સમાજમાં ઘર કરી ગેલા કુરિવાજો અને નવા પ્રવેશી રહેલ કુરિવાજો, જેમ કે, ‘જીવતચર્ચા’, રીત સેરેમની વગેરે દ્વારા વૈભવનાં વરવાં પ્રદર્શનો, ભૂષણત્યા, ગૃહિણીતાલીમ, નારીગૌરવ, પરિવારમાં દાદા-દાદી અને દીકરીનું સ્થાન, અનામતપ્રથા, રાજકારણ વગેરે અનેકવિધ વિષયો ઉપર કરેલું નવપ્રસ્થાનકારક બેડાણ ધ્યાનાર્હ બની રહે છે. આ બધા પ્રશ્નોની મૂળગામી ચર્ચા કરવાની સાથે સાથે લેખકે તેના સમુચ્ચિત ઉકેલો પણ દર્શાવી આપ્યા છે. આપણી ઘટતી જતી વાંચનવૃત્તિથી વ્યાખ્યિત થઈ તેમણે નોંધેલ શર્દૂ, ‘જ્યારે ધોળ દિવસે ભરબજોરે ચોપડીઓની હુકાન લૂંટાશે ત્યારે ગુજરાતમાં એક નવી કાન્તિનાં મંડાણ થશે’ સાકાર થાય તેવું આપણે ઈચ્છીએ. પ્રસંગોપાત્ર સમાજજીવનના સંબંધિત પક્ષો તેમજ રાજકારણીઓને રોકડું પરાયાવી દેતા જોવા મળે છે, જેમ કે, “આપણા આ હલકા અને લુચ્યા તેમજ શરમહીન રાજકારણીઓએ જળોની જેમ દેશની ગરીબ જનતાનું લોહી ચૂસ્યું છે. લોકશાહી માત્ર મત આપવા પૂરતી રહી છે” વગેરે દ્રષ્ટવ્ય બની રહે છે. સાહિત્યક સંસ્પર્શ ધરાવતા આ લેખોમાં સૂક્ષ્મતરનો સમ મમળાવવા જેવાં કેટલાંક વિધાનો, જેમ કે, ‘દુઃખનું ટંકણું જીવનમૂર્તિને સારો ઘાટ આપે છે’ (૨૬), ‘પુરુષાર્થીન અને પ્રારબ્ધવાદી બનાવે તેવી ભક્તિ શા કામની ?’ (૮૭), ‘શિક્ષક જ શિક્ષણનું સર્વોત્તમ જીવંત સાધન છે’ (૬૪), ‘પુરુષાર્થ અને પ્રારબ્ધ વચ્ચે કોઈ જઘડો નથી. બને એકબીજાનાં પૂરક છે’ (૩૧૭), ‘મંત્રી સત્તાસ્વામી, જ્યારે તંત્રી વિચારસ્વામી’ (૨૨૬), ‘ધાત્રાવય એ જીવનની

પ્રયોગશાળા અને તાલીમ શાળા છે' (૧૬૪) 'કર્મ' એ જીવનની ઈમારતનો પાયો છે' (૭૪) વગેરે અત્ર-તત્ત્વ ગૂંઘાયેલાં જોવા મળે છે, જે લેખકના ગહન વાંચન ચિંતનનાં ધોતક બની રહે છે. સ્વ. ગણેશભાઈના આ વિચારો શિક્ષણ અને સમાજ-સેવા ક્ષેત્રે કાર્યરત યુવાનોને સ્વસ્થ વેચારિક ચેતના જગાડનાર અનુભવની ખાણકૃપ તथા સમાજઘડતરનો ભૌમિકો પુરવાર થાય તેમજ સમાજનિર્માણના કાર્યમાં પ્રવૃત્ત કરવા ઉદ્દીપક બની રહે તેટલા સત્ત્વશીલ છે. જાઇતા સર્જક મોહનલાલ પટેલે આ ગ્રંથને 'એક સમાજોપયોગી સંદર્ભ ગ્રંથ' ઓળખાવીને નોંધ્યું છે કે "લેખકે સારાયે સમાજને એના કોઈ પણ રૂપને વણસ્પર્શી રાખ્યા સિવાય આ ગ્રંથમાં ઉત્તાર્થો છે. સમાજની શુભ રીતિનીતિને સમભાવથી બિરદાવી છે અને કુસ્તિત રૂઢિ-રિવાજોને ઓસિડ (તેજાબ) રૂપ આકરા શબ્દોમાં ખબર લઈ નાખી છે. આ ગ્રંથમાં વિષય - વૈવિધ્ય છે એટલું જ નહીં, એમાં લેખોની માવજત અને પ્રસ્તુતિ પણ કલાત્મક છે જે આ ગ્રંથ અને તેના ગ્રંથકારનાં સત્ત્વ અને તત્ત્વને ઉજાગર કરી આપે છે." આ ઉપરાંત સંપાદિકા ડૉ. ગીતા પટેલ આ ગ્રંથના વિષયવસ્તુને ધ્યાન લઈને આ ગ્રંથ 'સમાજ માટે પ્રથપદર્શક બનશે' તેવો સેવેલ આશાવાદ

પ્રસ્તુત બની રહે છે. આપણો આભારી છીએ ડૉ. ગીતાબહેનના કે જેમણે પોતાના પિતાના વિચારપૂત લેખો આપણને સુલભ કરાવી આયા.

આવા ગરવા સ્વ. ગણેશભાઈના વતનનું ગામ દેણાપ, તા વિસનગર, જ્યાં તેમનો જન્મ તા રૂપ ફેબ્રૂઆરી, ૧૯૩૫ના રોજ થથો હતો. પિતા કાનજીભાઈ પટેલ અને માતા રાઈબહેન. તેમના પત્નીનું નામ શ્રીમતી લીરાબહેન પટેલ (અવસાન તા ૨ મે, ૨૦૧૫), તેમના પરિવારમાં તેમના નાનાયે પ્રતિભાસંપન્ન સંતાનો નેશનલ સ્કોલર છે. પુત્રો ડૉ. સુરેશભાઈ પટેલ (મો. ૮૮૨૫૫૮૩૮ ૩૮૬), સ્થિરિલ એન્જિનિયર શ્રી હિવ્યાંગ પટેલ (મો. ૮૮૭૮૫૧૫૪૫૫) અને એક પુત્રી ડૉ. ગીતા પટેલ (મો. ૮૩૭૬૧૭૫૧૫૦) અમદાવાદમાં સ્થાયી થયાં છે

આજે ગણેશભાઈ આપણી વચ્ચે સદ્દે નથી, પરંતુ તેમનો વિચારવારસો તેમજ એક કર્યાંગી વત્તસલ શિક્ષક - ગૃહપતિ તરીકેની તેમની રીતિ-નીતિ આપણા માટે પ્રેરક બની રહેશે. મૂઢી ઊંચો સર્વ વિદ્યાલયી સ્વ. ગણેશભાઈને શત્રુ શત્રુ વંદન.

મહિભાઈ પ્રજાપતિ

(અનુસંધાન પૃષ્ઠ ૧૨નું ચાલુ)

હકીકત એ છે કે શાન-વિજ્ઞાનનો સમુદ્ર એટલો વિશ્લાણ અને ગહન છે કે, સંપૂર્ણ જ્ઞાની કોઈ હોઈ શકે જ નહીં. વળી બીજી ભૂલ આપણે એ કરીએ છીએ કે, એક ક્ષેત્રમાં જે સિદ્ધ હોય એમને આપણે સર્વક્ષેત્રના નિષ્ણાત માનીએ છીએ. ખાસ કરીને ધર્મગુરુઓની અવૈજ્ઞાનિક વાતોમાં અંધભક્તો કદી શંકા કરતા નથી! પરિણામે આજે કમ્પ્યુટરયુગમાં પણ અંધશ્રદ્ધાનાં ધોડાપૂર જોવા મળે છે.

તો કરી શું ?

સત્યની શોધ કરનારે કઈ બાબતો ધ્યાનમાં લેવી જોઈએ ? એ વિશે વિશ્વવિદ્યાત ફ્રિલસ્ટૂફ ડૉ. રાધાકૃષ્ણનુના વિચારો માર્ગદર્શક બની શકે છે. તેઓ કહે છે :

Believe only after careful observation

and analysis, when you find that it agrees with reason and conducive to the good and benefit of one and all. Then accept it and live up to it : કાળજીપૂર્વક નિરીક્ષણ અને વિશ્લેષણ કર્યાં બાદ જ માનશો. જ્યારે તમને લાગે કે તે બુદ્ધિ અને તર્ક સાથે સુસંગત છે તથા વક્તિ તેમજ સમાચિ માટે લાભદાયક અને શ્રેયસ્કર છે તો જ એનો સ્વીકાર કરો, ન એને જીવનમંત્ર બનાવો. અસ્તુ.

૧, ઉદ્યનગર સ્કોલાયટી,
પ્રશાંત સિનેમા પાસે, મહેસાણા-૩૮૪૦૦૨,
મો. ૮૮૮૮૦૮૬૩૩

સર્વ વિદ્યાલય કેળવણી મંડળ, ક્રી.ગાંધીનગર અને કડવા પાટીદાર કેળવણી ઉત્તેજક મંડળ : ઈતિહાસની ખટારીએથી : મને સાંભરે રે

અધ્યાત્મિક ડી. પટેલ

મનુષ્યપર્વતની પુણ્યપર્વત પત્ર પુષ્ટ ફલં તોયમુની શીરે ભક્તિભાવપૂર્વક સુવર્ણજીવંતી જ્ઞાણમાં ૩. ૨૫૧) અને રૂપિયા બસો એકાવન નોંધાવતાં આનંદ અનુભુતું છું. જોકે આશ્રમમાં ન વિદ્યાલયમાં હું ૧૮૮૨-૮૩ અને એક જ વર્ષ માટે રહ્યો-ભાયો છું, પણ મારા જીવનઘડતરમાં અને રાષ્ટ્રીય વિચારોના મારે વિશેના સિંચનમાં એ એક વર્જે ઘણો નિર્ણયિક ભાગ જજવેલો છે. એથી તો આશ્રમને શાળા તથા તેના વહીવક્તવ્યને શિક્ષકો ઉપર ગાયકવાડ સરકારની ભીસ આવી તેવા કસોઈના સમયમાં પણ માતૃસંસ્થાનું નામ ન આવે તે શીરે અમે કેટલાક વિદ્યાર્થીઓ મીઠાના સત્યાગ્રહના દિવસો દરમિયાન ગામડે ગામડે પ્રચાર-સાહિત્ય વહેંચવા અને સભાઓ બરી રાષ્ટ્રગીતો ને ભાગણો દ્વારા પ્રચાર કરવા દિવસોના દિવસો ભમતા. એ જુવાળમાં ભૂખ-તરસ કે યાઢ-તડકો પણ અમને લાગતાં નહિ! છેવટે અમારામાંના ચારેક જણ ભોગયીથી પકડાઈ ગયેલા અને સ્વ. જુગલભાઈના ભાઈ મહીપતભાઈ તથા હું વીરમગામથી હોળીને દિવસે પડાયેલા. બધાને વીરમગામ કચેરીની ડાચી જેલમાં ભેગા કરેલા. મને યાદ છે રેશનપરની લોક-અપમાં સર્વપ્રથમ અમને બનેને પૂરેલા ત્યારે અમારો જવાબ લેવા હોળીને દિવસે રાતે એક વાગે અમને છૂટક છૂટક પોલીસ ઇન્સ્પેક્ટરની આગળ બેચોનેટસજજ બંદૂકવાળા પોલીસ વર્દ ગયેલા. સૌથી પહેલો મને કાઢેલો. ઇન્સ્પેક્ટર જે કમરામાં હતા તેની બહાર દરવાજે બંને બાંધુજો થોડે થોડો. અંતરે ગોડવેલ બંદૂકધારી દસ પોલીસની હાર વચ્ચે થઈને મને ઇન્સ્પેક્ટર પાસે લઈ ગયેલ. ધાંધકમારી ને પૂરતો માનસિક ત્રાસ આપી સંસ્થાનું નામ કઢવાના તેઓએ પ્રશ્ન કર્યો. એકબે વાર તો બયોને છાતીએ અડાડી મારી નાખવાની પ્રયત્નપૂર્વકની બીક પણ બતાવી. છતાં મારી એ વખતની હિંમત ઉપર અને દેશ માટે જાજો ફનાગારી વહેરવાની તમના માટે મને આજે પણ આશ્રમ ને ગૌરવ થાય છે અને અમારી ઉમર એ વખતે કેટલી? માંડ તેર-ચૌદ વરસની. આટલી ઉમરે આટલું ગજું છગનભાના છાત્રાલયવાસ અને વિદ્યાલયના સંસ્કારસિંચનનું જ પરિણામ! એ દિવસોથી હાથે કાંતી તેમાંથી વણાયેલી ખાદી પહેરવાનો નેડો લાગેલો તે હજુ પણ અંશત: ચાલુ છે.

પોલીસના અનેક પ્રયત્ન છતાં અમારા બેમાંથી કોઈએ સંસ્થાનું નામ નહિ દીધેલ. લોક-અપની કોટીમાં એ અંગે

અમે બનેએ પાકો ને પૂરો નિર્ણય કરી લીધેલ. પોલીસોએ અમને સ્ટેશનના લોક-અપમાં નણોક દિવસ રાજ્યા તે દરમિયાન, આ નિર્ણય તોડાવવા અનેક પ્રયત્નો કર્યા, છોરી મૂકવાની લાલચ પણ આપી છતાં જમાદારો, શૈક્ષિકારો ને ઇન્સ્પેક્ટરનું કંઈ ચાલેલું નિહિ. છેવટે અમને વીરમગામ કચેરીની કાચી જેલમાં લઈ જવામાં આવ્યા જ્યાં શ્રી કલ્યાણભાઈ વગેરે બીજા ચારેક જણાનો ભેટો થયો. એ પછી અમારો કેસ ત્યાંની કચેરીમાં ચાલ્યો. કોઠમડી કે ગોઠમડી કરીને મેજિસ્ટ્રેટ હતા. અમે બધા સગીર ઉમરના હતા છતાં છ છ માસની કેદ - સખ્ત કેદ ફટકારી અમને સાબરમતી જેલમાં એક વહેલી સવારની ગાડીમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા. મારો-અમારો આ બહુ શુકનવંતો ને ભાગશાળી દિવસ હતો. મને પોતાને સાબરમતી જેલમાં જવાનાં ઘણા દિવસોનાં સ્વખ હતાં તે પૂરાં થતાં જેટલો આનંદ થયેલો તેટલો આનંદ હજુ બીજે કોઈ પ્રસંગે થયો નથી! ૧૯૪૨ની કાંતિમાં વડોદરાની સેન્ટ્રલ જેલમાં ફરી વાર પુરાવાનો પ્રસંગ સાંપદેલો પણ તેથે પેલા જેટલો આનંદનુભવ નહોંતો થયો. હસતે મોઢે સેવણાએ જેલ ગમન કરવું ને દેશદાનાં કાર્યો કરવાં તે કિનિવાસ દરમિયાન મળેલા ભાવનાભથાને પ્રતાપે જ ! એ વખતની મારી તેયારી કેટલી બધી ? સાબરમતી જેલમાં ગયા પછી એક દિવસે મારા મોટાભાઈ દડ ભરવા આવ્યા. એમ કે દડ બરીને છોડાવી દઉ. જેલરની રૂબરૂ મને બોલાવવામાં આવ્યો. મેં દડ બરીને છૂટવાની ચોખીની ના પારી દીધી અને આનંદપૂર્વક વર્ષિક પરિક્ષાના આગલા દિવસ સુધી જેલમાં રહ્યો. સગીર ઉમરના છીકરાઓને લાંબી સજા કરી શકાય નહિ એવા કોઈ મુદ્દા ઉપર અમદાવાદના કોઈ રાષ્ટ્રીય વકીલ-મંડળના અને કરીની સંસ્થાના સહિયારા પ્રયત્નથી અમે છૂટેલા. પણ એ એક અનેરો લાગવો હતો.

કલાપીના શબ્દોમાં કહીએ તો -

“હજુલી બાબાં સ્મરણ કરવું, એય છે એક લહાવો;
માઝેલાંનું સ્મરણ કરવું, એય છે એક લહાવો.”

તા. ૧૪-૧-૭૦, ઉત્તરાયશ

શિક્ષણ મહાવિદ્યાલય, ગુજરાત વિદ્યાપીઠ
(સૌજન્ય : ‘મુવર્ણજીવંતી : સર્વ વિદ્યાલય કેળવણી મંડળની સુવર્ણજીવંતી નિમિત્ત પ્રગટ થતું સાખ્તાહિક’ વર્ષ ૧, અંક ૨૦ તા. ૫ ફેબ્રુઆરી, ૧૯૭૦)

સત્યની શોધમાં અવરોધક પરિષણો

તુલસીભાઈ પટેલ

શિક્ષણના અનેક ઉદેશો છે. એ પૈકી સૌથી મહત્વપૂર્ણ ઉદેશ સત્યની શોધ છે. ગાંધીજીનું સમગ્ર જીવન સત્યની શોધયાત્રા હતું. એમની આત્મકથાનું શીર્ષક 'સત્યના પ્રયોગો' ખૂબ સ્થુક છે.

સત્ય પામનું એ આપણા જીવનનું સર્વોપરી લક્ષ્ય હોવું ઘટે. પરંતુ સત્ય-શોધની યાત્રા સરળ નથી. લક્ષ્ય જેટલું ઊંચું, યાત્રા એટલી જ વિકટ હોવાની. વળી આ યાત્રાના માર્ગમાં અનેક પ્રકારના અવરોધો છે. આ અવરોધોને બરાબર સમજવામાં ન આવે તો આપણે યાત્રાપથ પરથી ભટકી જઈએ, પરિણામે ક્યારેક વિપરીત દિશામાં ચાલવા લાગીએ. મંજિલથી વધુ દૂર જઈએ. એમાં મોટી કરુણતા એ છે કે "ભટકી ગયા છીએ." એવું શાન ન હોવાને કારણે પથિક એવા ભમમાં રહે છે કે પોતે સત્યને મારગ ચાલી રહ્યો છે ! ગાડી રિવર્સ નિયરમાં હોય ને ચાલુ કરીએ તો શું પરિણામ આવે ?

સત્યની શોધમાં કયા કયા અવરોધો છે, જે વિશે સાવધાન રહેવું જોઈએ? કેટલાક મહત્વપૂર્ણ અવરોધો વિશે ચર્ચા કરવાનો અહીં ઉપક્રમ છે.

Don't believe in anything simply because you have heard it : તમે માત્ર સાંભળ્યું છે, એટલા પરથી એને સાચું માનશો નહીં.

સત્યની શોધના માર્ગમાં આ સૌથી મોટે અવરોધ છે. આપણી માન્યતાઓનો મુખ્ય આધાર કયો છે ? આપણે પોતે કશું જાણતા નથી, ત્યારે બીજા પર આધાર ચાખતા હોઈએ છીએ. કોઈ કશું કહે અને આપણે સ્વીકારી લઈએ છીએ. આપણે તપાસ કરતા નથી કે જે સાંભળ્યું એમાં કેટલું તથ્ય છે ? ખાસ કરીને કાચા કાનના માણસો, બીજાની વાત પર વગર વિચાર્યે વિચાસ મૂકી દેતા હોય છે. પરિણામે ક્યારેક ખોટી વાતને પણ સાચી માની લેવામાં આવે છે. આપણાને ન ગમતી વ્યક્તિ વિશે આપણે નિદા-કૂથલી કરીએ છીએ. કોઈ વાર ઠરાદાપૂર્વક આપણે ખોટી વાતો વહેતી કરીએ છીએ. એમાં આપણા વિરોધીને બદનામ કરવાનો આશય હોય છે. સાંભળનાર વ્યક્તિ એના પર

વિચાસ મૂકે છે, ખોટી વાતને સાચી માની લે છે. પરિણામે નિર્દોષ વ્યક્તિ બદનામ થાય છે. આપણે જાડીએ છીએ કે આ રીતે ઘણી વાર સજજન વ્યક્તિઓનું ચારિત્ર હનન થતું હોય છે. ક્યારેક પાછળથી સત્ય હકીકત જાણવા મળતી હોય છે, પરંતુ એ પહેલાં નિરપરાધ યા નિષ્ળંક વ્યક્તિને ઘણો અન્યાય, ઘણું નુકસાન થઈ ચૂક્યું હોય છે. કબીરજી સાચું કહે છે :

એક ને કહી, દૂસરે ને માની ।

કહે કબીર દોનોં અજ્ઞાની ॥

ઘણી વાર ખોટી વાતો વહેતી કરનાર માણસનો ઈરાદો બરાબ હોતો નથી. પરંતુ કબીરજી કહે છે તે પ્રમાણે એ પોતે જ અજ્ઞાની હોય છે! આપણા સમાજનું બહુ મોટું દૂષણ કાનભંભેરણી છે, પરંતુ વક્તા અને શ્રોતા બંને ભૂમિત યા અજ્ઞાની હોય ત્યારે કોઈ ઉપાય બચતો નથી !

Don't believe in anything simply because it has been handed down for many generations : અનેક પેઢીઓથી ચાલતું આવે છે, એટલા માત્રથી સાચું માનશો નહીં.

મોટા ભાગની માન્યતાઓ આપણાને વારસામાં યા પરંપરામાં પ્રાપ્ત થતી હોય છે. અલબજ્ટ, પરંપરાનું મહત્વ છે. આદિકાળથી આજ સુધીની પ્રગતિ મોટા ભાગે પરંપરા દ્વારા સિદ્ધ થઈ છે. પરંપરાપ્રાપ્ત શાનમાં નવી પેઢી થોડુંક ઉમેરે છે, ને આગમી પેઢીને આપે છે. આમ શાનયાત્રા પેઢી દર પેઢી આગળ વધતી રહે છે.

પરંતુ પરંપરા જ્યારે સમય-પરિવર્તનને સ્વીકારતી નથી, ત્યારે નકારાત્મક બની જાય છે. પરંપરાપ્રેમીઓને આ વાત સમજાતી નથી, ને જૂનું પકડી રાખે છે, ત્યારે કુપ્રથાઓ અસ્તિત્વમાં આવતી હોય છે. કાકસાહેબ કાલેલકરે એવું કહ્યું છે કે, ધીતિહાસ એ ખાતર છે, ખાદી નથી. આ વાત પરંપરા પ્રેમીઓ સમજતા નથી. તેઓ નૂતન તથ્યો પ્રતિ એલજી યા અસહિષ્ણુતા દાખલે છે. ખાસ કરીને ધર્મ અને સંસ્કૃતિના ક્ષેત્રે આ વલશ ખાસ જોવામાં આવે છે, પરંતુ તેથી અંધવિચાસ પેદા થતા હોય છે. મહાકવિ કાલિદાસે

સરસ કહ્યું છે : ‘પુરાણમ् ઇતિ ન સાધુ સર્વમ् ।’ પુરાતન હંમેશાં સાચું જ હોય એવું નથી, તો નૂતન સદા ખોટું હોય એમ પણ નહીં. વળી એથી ઉલટું, એટલે કે પુરાતન બધું ખોટું અને નૂતન બધું જ સાચું : એ પણ બરાબર ન ગણાય. સાર એ છે કે ક્રિકેપૂર્વક સત્ત્વાસત્ત્વની શોધ કરવી પડે.

Don't believe in anything simply because it is spoken and rumoured by many : અનેક વ્યક્તિઓ દ્વારા વારંવાર કહેવામાં આવ્યું છે અને અફ્કવાઓ ફેલાવવામાં આવી છે, એટલા માત્રથી સાચું માની લેશો નહીં.

આપણે ભલે બુદ્ધિશાળી કહેવાતા હોઈએ, પરંતુ મોટા ભાગના માણસો ઘેટાના ટોળાં જેવા હોય છે. બહુજનસમાજ જે દિશામાં જઈ રહ્યો હોય, એમાં તેઓ પોતે ભળી જતા હોય છે. તેઓ એટલું પણ વિચારતા નથી કે ટોળું ક્યાં જઈ રહ્યું છે ? આપણે એમને કહીએ કે તમે ખોટા છો : તો તેઓ સામો સવાલ કરવાના કે, શું બધા ખોટા ને તમે એકલા જ સાચા ? હવે આનો શો જવાબ હોઈ શકે ? બહુમતીના આધારે ભલે લોકશાહી ચાલતી હોય, પરંતુ બહુમતીના આધારે સત્ત્વ-અસત્ત્વનો નિર્ણય ન થઈ શકે. બહુમતી જો બે વત્તા બે બરાબર પાંચ કહેતી હોય, તો એ સાચું માની લેવું ? બહુમતી અસ્વૃષ્ટયતામાં માનતી હોય કે સતીપ્રથા યા પશુભલિમાં માનતી હોય, તો આપણે શું એને સાચી માનવી ? આ તો “વા વાયુ ને નણિયું ખસ્યું.” જેવી વાત છે. બહુમતી રજનું ગજ કરતી હોય છે. તથ્યોને વિઝૃત કરતી હોય છે. વળી કરુણતા એ છે કે એ સૌના પર હાવી થઈ જતી હોય છે ! મનોવિજ્ઞાન સાચું કહે છે કે Mob has no mind. અર્થાતું ટોળાને અક્કલ હોતી નથી. બહુમતી દ્વારા અફ્કવાઓને વેગ મળે છે. બહુમતી કહે કે ગણપતિ દૂધ પીએ છે, એટલે મારે શું સાચું માની લેવું ? બહુમતીના કારણો અફ્કવાઓ ઝડપથી ફેલાતી હોય છે. સાચું કહ્યું છે કે : સત્ત્વને પગ હોય છે, જ્યારે અફ્કવાને પાંખો હોય છે ! બીજું, એકની એક વાત વારંવાર કહેવામાં આવે ત્યારે પણ લોકો સાચું માની લેતા હોય છે. પેલા બ્રાહ્મણ પાસેથી ત્રણ ઠગ બકરી પડાવી ગયા જેવી વાત છે. મનોવિજ્ઞાનમાં ગોબેલ્સ પ્રચારની વાત આવે છે. રાજકારણીઓ ચુંટુણીપ્રચારમાં આ પ્રચારકળાનો આશરો લેતા હોય છે. એક જૂઢ, સો વાર કહેવાથી સત્ત્વ બની જાય છે ! પરંતુ ખરેખર સત્ત્વ બની જાય છે ખરું ? સત્ત્વના શોધકે વિચારવું ઘટે.

Don't believe in anything simply

beacuse it is written in holy scriptures : પવિત્ર ધર્મગ્રંથોમાં લખવામાં આવ્યું છે એટલા માત્રથી અને સાચું માની લેશો નહીં.

ધર્મગ્રંથોની આપણા પર એટલી બધી ગાડ અસર છે કે, એમાં લખેલી વાતો આપણે આંખ મીચીને માની લઈએ છીએ. તર્કશાસ્ત્રમાં એને ગ્રંથ-પ્રમાણ કહેવામાં આવે છે. ગ્રંથોમાં લખવામાં આવેલ તમામ બાબતો સંપૂર્ણ સત્ત્વ હોય એવું માની લેવાનું ? શા માટે ? ઘણી વાતો કાલગ્રસ્ત (out of date) હોય છે, જે માની શકાય નહીં. આપણે ઘણી વાર દલીલ કરીએ છીએ કે, આ તો વેદમાં લખ્યું છે, કુરાનમાં લખ્યું છે, બાઇબલમાં લખ્યું છે વગરે. ધર્મગ્રંથોની વાતો બુદ્ધિનાં દ્વારા બંધ રાખીને માની લેવાથી ધાર્મિક અંધશક્તા ફેલાય છે. વિંબના એ છે કે કમ્પ્યુટરયુગમાં અંધશક્તા યા ધાર્મિક કંઈરતા ઘટવાને બદલે વધતી જાય છે. ગાંધીજીના અંતેવાસી સ્વ. કિશોરલાલ મશરૂવાળાએ ‘સમૂહી કાંતિ’ નામના પોતાના ગ્રંથમાં ધર્મમાં ચાલતી અંધમાન્યતાઓનું બારીક વિશ્લેષણ કરીને અસલી સત્ત્વ પર પ્રકાશ પાથરો છે. કોઈક ચિંતકે સરસ વાત કરી છે કે, જો વેદમાં એવું લખ્યું હોય કે બરફ ગરમ હોય છે. તોપણ એ માનવું નહીં.

Don't believe in anything merely on the authority of teachers, elders or wise men : શિક્ષકે, વડીલે કે કષિત ડાખા માણસે કહ્યું છે, માટે માની લેશો નહીં.

જેવી રીતે ધર્મગ્રંથોને પ્રમાણ તરીકે રજૂ કરવામાં આવે છે એવી રીતે, મોટા કહેવાતા માણસોને પણ પ્રમાણ તરીકે પ્રસ્તુત કરવામાં આવતા હોય છે, જેને તર્કશાસ્ત્રમાં ‘આપ્ત પ્રમાણ’ કહેવામાં આવે છે. આપ્તજન સદા સાચા જ હોય એવું કોણો કહ્યું ? પરંતુ ગુરુ, માતા પિતા, આચાર્યને માન તો આપો, ઉપરાંત એ જે કહે એને સાચું પણ માનો. ગુરુ, વડીલ કે ધર્મપુરુષ જે કહે એમાં શંકા નહીં કરવાની ગીતાજીમાં પણ કહ્યું : સંશ્યાત્મા વિનશ્યતિ । શંકાશીલ આત્માનો વિનાશ થાય છે. એનો સંદર્ભ જે હોય તે. પરંતુ સત્ત્વશોધનાનો પાયો જ સંદેહ છે. આચાર્ય રજનીશ કહેતા માનો નહીં, જાનો । પરંતુ મોટા ભાગના લોકો જાણવા માટેના બૌદ્ધિક પરિશ્રમથી ભાગે છે, ને એમની સામે જે કંઈ રજૂ થાય છે, તે વગર વિચાર્ય માની લેતા હોય છે. આમ આપણે લૌકિક માન્યતાઓનો ભોગ બનીએ છીએ. શિક્ષક, વડીલ કે ગુરુજનોને આપણે સર્વક્ષ માનીને ચાલીએ છીએ, પરંતુ

(અનુસંધાન પૃષ્ઠ ૮ પર)

અદ્ભુત પરિવારના સુખ્ખાએયમ્ ચંદ્રશેખર

(Subrahmanyan Chandrasekhar)

વિક્લિબાઈ અં. પટેલ

પ્રસ્તાવના

તારાઓ જન્મે છે, જીવાન બને છે, ઘરડા થાય છે અને પ્રાજીઓ અને માનવોની જેમ મૃત્યુ પણ પામે છે. તારાઓનું આયુષ્મ માણસોના આયુષ્ણીની સરખામણીમાં ખૂબ જ લાંબું છે. કરોડો અને અબજો વર્ષ પછી પણ આખરે તેમની જિંદગીનો અંત આવે જ છે. સામાન્ય રીતે એકવડા બાંધાના માણસો તંદુરસ્ત રીતે દીર્ઘાયુ ભોગવે, તેમ સૂર્યના જીવા દ્વયવાળા એકવડા બાંધાના તારાઓ તંદુરસ્ત રીતે ઘણું લાંબું જીવે છે. વધારે પડતા દ્વયવાળા માણસોને કોઈ ને કોઈ પ્રકારનો રોગ હોય અને તેમની જિંદગીનો અંત પણ સુખદાયી રીતે આવતો નથી તે જ રીતે વધારે પડતા દ્વયવાળા તારાઓનો અંત પણ કરુણ રીતે આવે છે. તંદુરસ્ત લાંબું જીવનારા તારાઓનો અંત શેત વામન (White Dwarf) બનીને આવે છે, જ્યારે વધારે પડતા દ્વયવાળા તારાઓનો અંત ન્યૂટ્રોન તારો કે શ્યામ પોલાડ (Black Hole) બનીને આવે છે.

નોબેલ પ્રાઇઝ (Nobel Prize)

ઓક્ટોબર ૧૦, ૧૯૮૮ના રોજ સવારના છ વાગે સ્નાન કરીને બહાર આવ્યા અને ફૈનની ઘંટડી રણકી. આટલો વહેલો ખોટો ફૈન હશે તેમ માનીને ઉપાડ્યો. સામેના છેઠેથી પૂછવામાં આવ્યું, “સ્ટોકહોમથી (Stockholm, Switzerland) જાહેર કરવામાં આવેલા સમાચાર તમે સાંભળ્યા છે?” આ ભાઈએ જવાબ આપ્યો, “ના, મેં કોઈ સમાચાર સાંભળ્યા નથી.” સામેના ભાઈએ જણાવ્યું કે તમને નોબેલ પ્રાઇઝ મળ્યું છે. આ ફૈન ઉપાડનાર ગ્રો. ચંદ્રશેખર હતા. એ જ્યારે ઓગાંડિશ વર્ણના હતા ત્યારે મુંબઈથી લંડન જવા માટે દીયાલિયન સ્વીમર લોયડ ટ્રિસ્ટિનો (Loyd Triestino)માં જુલાઈ ૩૧, ૧૯૭૦માં બેઠા. જેને પુસ્તકો ગમતાં હોય અને સંશોધનનો રસ હોય તેના માટે તોફાન વગરની સ્વીમરની મુસાફરીઓ ખૂબ જ અનકૂળ વાતાવરણ પૂરું પાડે છે. આ મુસાફરી દરમિયાન ચંદ્રશેખરે નીચેનું પરિણામ મેળવ્યું :

જો તારાનું દ્રવ્ય ૧.૪૨ સૂર્યના દ્રવ્યથી ઓછું હશે તો તારાનો આખરી અંત ‘સફેદ વામન’ તારો બનીને આવશે. જ્યારે તારાનું દ્રવ્ય ૧.૪૨ સૂર્યના દ્રવ્યથી વધારે હશે, ત્યારે તે તારાનો અંત સફેદ વામનના બદલે બીજું કંઈક હશે.

જ્યારે આ પરિણામ જાન્યુઆરી ૧૧, ૧૯૮૮ના રોજ રોયલ એસ્ટ્રોનોમિકલ સોસાયટીની (Royal Astronomical Society) મિટિંગમાં ચંદ્રશેખરે રજૂ કર્યું ત્યારે તે સમયના ખૂબ જ આગળ પડતા અને જાણીતા ખોળબૌતિકશાસ્ત્રી એડિંગનટને (Eddington) ખૂબ જ વીકા કરી અને એ મિટિંગમાં ચંદ્રશેખરની હવા કાઢી નાખેલી, પણ આખરે સત્યનો વિજય થયો અને નોબેલ પ્રાઇઝ વહેલનારી કમિટીએ ખરેખર ખૂબ જ યોગ્ય માણસને નોબેલ પ્રાઇઝ આપ્યું. જન્મદિવસની આથી મોટી ભેટ કરી હોઈ શકે ?

નોબેલ પ્રાઇઝ સ્વીકારતાં ચંદ્રશેખરે કવિવર રવીન્દ્રનાથ ટાગોરની નીચેની પંક્તિએ ગાયેલી :

“Where the mind is without fear
and the head is held high;
Where knowledge is free;
into that heaven of freedom,
let my country awake.”

“જ્યાં મન ભય વગરનું છે
અને જ્યાં મસ્તક ઊંચે છે;
જ્યાં જ્ઞાન મજૂત છે;
એવા સ્વતંત્રતાના સ્વર્ગમાં
મારા દેશને જગાડ.”

જિંદગીની કારકિર્દીની પરાકાણાએ પણ ચંદ્રશેખરનું મન ભારતમાં જ છે. એવું કહેવાય છે કે ભારત સિવાય કોઈ જગ્યાએ તેમનું મન ન ચોટનું. આમ છતાંથે વડાપ્રધાન જવાહરલાલ નહેઠું, વડાપ્રધાન ઈન્ડિયા ગંધી અને ભૌતિકશાસ્ત્રી હોમી ભાભાએ જે તે સમયે લાભદાયી અને

પ્રતિષ્ઠાવાળાં પદોની દરખાસ્તો ચંદ્રશેખરને આપેલી, પણ ચંદ્રશેખર ભારત પાછા ન આવ્યા.

તેઓને અંદરઅંદરના ઝડપાઓમાં તેમની શક્તિનો વય કરવા માગતા ન હતા. તેમને પ્રાથમિક વિષયોને વારંવાર ભાષાવવાનું ન ગમતું. સંશોધન માટે તેમના વિષયમાં ચર્ચા કરનાર ભારતમાં કોઈ ન હતું. ચંદ્રશેખર તેમની હાથ નીચે સંશોધન કરવા ભારતીય વિદ્યાર્થીઓને આવકારતા અને તેમને ભારત પાછા ફરવવામાં મદદ કરતા અને સારી નોકરીઓ મેળવવામાં પણ મદદ કરતા.

એમની ભારત માટેની લાગણી એમના પ્રણેતા રામાનુજનનો પાસપોર્ટના માપનો ઝીઠો મેળવવા કરેલો પ્રયાસ દર્શાવે છે. આ એક ભારતને આપેલી લેટ છે. આ ઉપરાંત રામાનુજનનાં વિધવા પત્નીને શોધી કાઢીને તેમને સારી રીતે રહેવા માટે સરકાર તરફથી પેન્શન અપાવવા માટેનો પ્રયત્ન તેમની લાગણી દર્શાવે છે.

ચેન્નાઈમાં ‘રામાનુજન ઇન્સ્ટિટ્યુટ ઓફ મેથેમેટિક્સ’ તેમના જૂના સહાધ્યાવી અલાગાપા ચેહિયારની મદદથી સ્થાપ્ય. ચેહિયારના નિધન પછી આ ઇન્સ્ટિટ્યુટને આર્થિક તકલીફી પડવા માંથી. તેને અસ્તિત્વમાં રાખવા માટે નહેરુને ચંદ્રશેખરે તકલીફી જણાવી અને સરકારની સમયસરની મદદ આવતાં આ ઇન્સ્ટિટ્યુટ બંધ ન કરવું પડ્યું.

બાળપણ અને કુટુંબ :

ચંદ્રશેખરના અમેરિકન ભિન્નો અને સહકાર્યકરો તેમને ટૂંકમાં ચંદ્ર તરીકે ઓળખે છે. આથી આપણે પણ ‘ચંદ્ર’ તરીકે ઓળખીશું. ચંદ્રાનું કુટુંબ વિદ્વાનોનું કુટુંબ છે. વિજ્ઞાનના ક્ષેત્રે તેમના કાકા સર સી. વી. રામનને પણ નોભેલ પ્રાઈઝ મળેલું. તેમના પિતા ચંદ્રશેખર સુભ્રાષ્ટયમ્ (રં. સુ.) પણ બિટિશારાજની ઇન્ડિયન રેલવેના ચીફ ઓફિચર બનેલા અને તેમનાં માતા સીતાલક્ષ્મી (Sitalaxmi) એ પ્રાથમિક શિક્ષણ જ પૂરું કરેલું, પણ તામિલ ભાષાનાં પુસ્તકો ખૂબ જ વાંચતાં અને તામિલ ભાષાના સમાચારપત્રો માટે લેખો પણ લખતાં. તેમના પિતા રેલવેમાં નોકરી કરતા હોઈને વારંવાર બદલીઓ થતી. ચંદ્રાનો જન્મ લાહોર કે જે હાલ પાકિસ્તાનમાં આવેલું છે ત્યાં ઓક્ટોબર ૧૯, ૧૯૧૦ના રોજ થયેલો. તેઓ તેમના કુટુંબમાં પહેલા પુત્ર હોઈને દક્ષિણાંત્રી પ્રથા પ્રમાણે તેમના દાદા આર. ચંદ્રશેખર અધ્યરના નામ ઉપરથી નામ ચંદ્રશેખર પાડ્યું. તેમના દાદા આર. ચંદ્રશેખર અધ્યર કોલેજમાં પ્રોફેસર હતા. ચંદ્રાને બે મોટી બહેનો, ત્રણ નાની

બહેનો અને ચાર નાના ભાઈઓ હતા જેની વિગતો આકૃતિમાં દર્શાવી છે.

ભૌતિકશાસ્ત્રમાં ચંદ્રશેખર કુટુંબે ખૂબ જ અગત્યનો ફાળો આપ્યો છે અને તે કુટુંબમાંથી બે જણ સર સી. વી. રામન અને તેમના ભત્રીજા સુભ્રાષ્ટયમ્ ચંદ્રશેખરને નોભેલ પ્રાઈઝ પણ મળેલાં.

થાનજાવુરની (Thanjavur) નજીકના વૈગાલુથુર(Vaigaluthur) ગામમાં પીથર શેષાદ્રી (Pethar Seshadry) ૧૭૩૦ અને ૧૮૦૦ વર્ષે રહેતા હતા. તેમના પુત્ર અય્યામુથિયાન (Ayyamuthian) પચ્ચિમના દરિયાકિનારે મલબાર ધનોપાર્જન માટે ગયેલા અને આવીને માનગુડિ (Mangudi) અને પોરસકુડિ (Poraskudi) વર્ષે જેતીવાડીને લાયક ૨૦૦ એકર જમીન ખરીયી. આ પણ ઘણા બધા આવ્યા. તેમાં રામનાથે જોયું કે બિટિશારોની નવી કેળવણીની પદ્ધતિથી પ્રગતિ અને સમૃદ્ધ આવશો. આથી તેમના દશ વર્ષના પુત્ર ચંદ્રશેખરને તેમના ગામથી પંદર કિલોમીટર દૂર કુભકોણમ્ય (Kumbhakonam)ની હાઈસ્ક્વુલમાં ભણવા મૂક્યા અને ત્યાં બીજું ઘર શરૂ કર્યું. જેની જવાબદારી તેમનાં સાસુની બાને સૌંપી. ખાવાનું અનાજ તેમજ જોઈતી સામગ્રી ગાડામાં ભરીને આપી આવતા. ચંદ્રશેખરે ૧૮૮૧માં મેટ્રિકની પરીક્ષા પાસ કરી. ચંદ્રશેખર B.A.ની ડિગ્રી માટે મદાસ કિચ્ચિયાન કોલેજમાં જોડાયા. તેમજે અંગ્રેજી, ગણિત અને તમિલ વિષયો રાજેલા. તમિલમાં નાપાસ થયા. તેમણે કુભકોણમ્ય નજીક થિરુવાદમેરુથુર (Thiruvadameruthur)ની માધ્યમિક શાળામાં ભણવવાનું શરૂ કર્યું. નિયમો બદલાતાં તમિલના બદલે ભૌતિકશાસ્ત્ર રાખીને ૧૮૮૨માં B. A. થયા. વિઝાગાપતમની (Vizagapatam) એ. વિ. એન. કોલેજમાં ભણવવાનું શરૂ કર્યું. તેમને ત્રણ બાળકો પણ હતાં. સૌથી મોટો પુત્ર ચ. સુ.ને તેમનાં માતાપિતાની જોડે મૂક્યાને તેમનાં પત્ની, સી. વી. રામન અને પુત્રી મંગલમ્યને લઈને નોકરીની જગ્યાએ જવા નીકળ્યા. રેલવેની શરૂઆત હતી. ધારવા કરતાં ઘણો વધારે સમય દ્રેન લીધો.

પ્રો. ચંદ્રશેખર વિદ્યાર્થીઓને કિકેટ, ફૂટબોલ, દોડવાનું વગેરે શીખવતા અને વિદ્યાર્થીઓને રમતગમતમાં ભાગ લેતાં કરતા. એમનાં પોતાનાં બાળકોને રમતગમતમાં ભાગ લેતા કરી ન શક્યા. તેમને પોતાને વાયોલિન વગડતાં સરસ આવડતું, પણ તેમનાં બાળકોએ શરૂઆતમાં રસ ન બતાવેલો. પુસ્તકાલયમાંથી વિજ્ઞાનાં પુસ્તકો લાવતા,

રામન વાંચે રાજતા જ્યારે ચં. સુ. સાહિત્યને લગતાં અંગ્રેજ પુસ્તકો વાંચે રાજતા.

બાર વર્ષની વધે રામન હાઈસ્ક્યુલમાંથી ગ્રેજ્યુએટ થયા. રામનના પિતાજી જે કોલેજમાં ભણાવતી હતી ત્યાં રામન Intermediate સુધી ભિડ્યા. એમના પિતાજીએ તેમના M.Sc.ના અભ્યાસકમ માટે લાવેલાં પુસ્તકો પણ રામને પોતાની મેળે વાંચવાનો પ્રયત્ન કરેલો. રામને Intermediate ડિસેમ્બર ૧૯૦૨માં પૂરું કરીને જાચ્યુઆરી ૧૯૦૩થી મદ્રાસની પ્રખ્યાત પ્રેસિડન્સી (Presidency) કોલેજમાં જોડાયા. રામના મોટાભાઈ ચં. સુ. એક વર્ષ અગ્રાઉ પ્રેસિડન્સી કોલેજમાં જોડાયેલા. B.A. થયા પછી સિવિલ એન્જિનિયરિંગમાં દ્યાખવ થવા માટે ટેસ્ટની તૈયારી કરવા તેમના પિતાજી જોડે વિઝગાપટમ આવ્યા. રામન મોટ પ્રાયોગિક ભૌતિકશાસ્ત્રી (Experimental Physicist) બનવાનાં સ્વખાં જોતા હતા. ચં. સુ.એ ઘરમાં જોયું તો તેમના પિતાએ જમીન ગીરો મૂકીને બંને ભાઈઓની જનોઈવિધિ કરાવેલી અને એક બહેનનાં લગ્ન કરાવેલાં. ફક્ત છ એકર જમીન જ તેમના પિતાજાના નામે રહેલી. આ જોઈને ચં. સુ.ની આંખો ખૂલી ગઈ. રામનને પણ તેમણે પ્રોફેસર થવાનાં સ્વખાં મૂકી દઈને પૈસા કમાવવાનો વિચાર કરવા કષ્ટું. તેમણે પણ સિવિલ એન્જિનિયર થવાનું માંડી વાળીને Financial Service Examination આપવાનો વિચાર કર્યો. ચં. સુ. હોશિયાર વિદ્યાર્થી હતા. તેમણે Superior Accounts Examinationમાં પ્રથમ વર્ષ મેળવેલ હોઈને બ્રિટિશ સરકારની નોકરીમાં Deputy Accountant તરીકે બ્રિટિશ રેલવેમાં જોડાયા. આ નોકરી તેમને આખા ભારતમાં જુહી જુહી જગ્યાએ લઈ ગઈ. રામનની કારકિર્દી આથીય ઉજ્જવળ છે. ફક્ત અગિયાર વર્ષની વધે હાઈસ્ક્યુલમાંથી ગ્રેજ્યુએટ થયા. ૧૫ વર્ષે B.A. અને ૧૭ વર્ષે M. A. થયા. Finance Departmentની All India Competitive Examination લીધી. અને આ પરીક્ષામાં તેમનો સર્વશ્રેષ્ઠ સ્કોર હતો. ફક્ત અઢાર વર્ષની વધે Assistant Accountant General બન્યા.

બંને ભાઈઓ ૧૯૦૭માં સરકારી નોકરીમાં જોડાયા અને બંનેને કલકત્તામાં મૂક્યા. બંને ભાઈઓ સાથે રહેતા. ચં. સુ.ની બદલી લાહોર (હાલ પાકિસ્તાનમાં છે) નોર્થર્ન રેલવેના (Northern Railway) આસિસ્ટન્ટ ઓડિટર જનરલ (Assistant Auditor General) તરીકે થઈ. ચંદ્રાનો જન્મ ઓક્ટોબર ૧૮, ૧૮૧૦ના રોજ લાહોરમાં થયો. જ્યારે ચંદ્રા છ વર્ષના હતા ત્યારે ચં. સુ.ની બદલી લાહોરથી લખનૌ થઈ. બે વર્ષ પછી ચં. સુ.ની બદલી ડેઢ્યુટી

એકાઉન્ટન્ટ જનરલ (Deputy Accountant General) તરીકે મદ્રાસ (હાલના ચેનાઈ) થઈ. ચેનાઈમાં આકૃતિ-રમાં બતાવ્યા પ્રમાણે તેમણે મકાન બાંધ્યું. તેનું નામ ‘ચંદ્રવિલા’ ચંદ્રવિલા માયલાપોર (Mylapore) જ્યાં વિદ્વાનો, લેખકો, વકીલો, સંગીતકારો અને નૃત્યકારો રહે છે ત્યાં આવેલું છે. ૧૯૨૪માં ચંદ્રવિલામાં રહેવા આવ્યા. બે માણનું અને રસોડા અને જમવાના ભાગ સાથે નવ રમનું મકાન છે. ચંદ્રાની રૂમ બીજે માળ હતી. જેમાંથી નાળિયેરીનાં વુન્દો (Grove) જોઈ શકતાં. આ મકાન એક એકર જમીનમાં હતું. આજુબાજુમાં છૂટાછવાયાં મકાનો હતાં. એક મકાન ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનાનું હતું. બીજું મકાન ડો. ડોરેસ્વામીની. વિધવા પત્ની. સાવિની ડોરેસ્વામીનું હતું. તેમની પુત્રી લલિતા ચંદ્રાની સાથે ભૌતિકશાસ્ત્ર ભણતાં હતાં અને પછી ચંદ્રા સાથે લગ્ન થયેલાં. તેમના ત્યાં રસોઈથો, માળી અને બીજા બે ઘરકામમાં મદદ કરનારા પડી હતા.

ચંદ્રાનું ઘરમાં પણ ભણવવાનું શિસ્તવાળું હતું. તેમના માતા તેમને તામિલ શીખવતાં. તેમના પિતા ઓફિસે જતા પહેલાં ચંદ્રાને અંગ્રેજ અને અંકગણિત શીખવતાં. બાપોરના ચંદ્રાનાં માતા ચંદ્રા બરાબર લેશન કરે છે કે નહીં તેની તપાસ રાજતાં. અંગ્રેજ ભણવાનું ચંદ્રાને ગમતું અને ગણિત તો જાણે લોહીમાં હોય. આપેલા દાખલાઓ કરતાં વધારે દાખલાઓ કરતા. ચંદ્રા આગળ આગળ પણ વાંચતા. જ્યારે સાંજે ઘેર આવીને તેમના પિતાજી લેસન જોવે ત્યારે આપેલાં કરતાં ઘણું વધારે કામ કર્યું હોય. શરૂઆતમાં તેમના પિતાજી દંગ થઈ જતા, પણ પછી ખ્યાલ આવી ગયો કે ચંદ્રા ખૂબ જ હોશિયાર બાળક છે. ચંદ્રા અગિયાર વર્ષના થયા ત્યારે ચેનાઈની સારામાં સારી હિન્દુ હાઈસ્ક્યુલ, ટ્રિપ્લિકેનમાં (Hindu High School Triplicane) મૂક્યા. ચંદ્રાને સીધા જ ત્રીજા ધોરણમાં લેવામાં આવ્યા. ચંદ્રાએ જે ફારે તે અને જ્યારે ગમે ત્યારે જ ઘેર અભ્યાસ કર્યો હતો. શરૂઆતમાં ઈતિહાસ, ભૂગોળ અને સામાન્ય વિજ્ઞાન ભણવાં ન ગમતાં પણ સમય જતાં આ બધા વિષયોથી ટેવાઈ ગયા. રજાઓ દરમિયાન ભૂમિતિ, બીજગણિત ભણવાં ગમતાં. આ પછી તો હાઈસ્ક્યુલનાં છેલ્લાં વર્ષોમાં ઉનાળામાં જાતે જ કલનગણિત, સામાન્ય વિકલ સમીકરણો (Ordinary differential equations) અભ્યાસ કર્યો.

જ્યારે ચંદ્રા પંદર વર્ષના થયા ત્યારે ચેનાઈની પ્રખ્યાત જૂની અને જાણીતી પ્રેસિડન્સી કોલેજમાં પ્રથમ વર્ષના (Frashman) વિદ્યાર્થી તરીકે જોડાયા. ચંદ્રા દશ-

વર્ષથી નાના હતા ત્યારે છાપામાં એક સમાચાર શીનિવાસ રામાનુજન સંબંધી પ્રગટ થયા હતા. તેમનાં માતાએ સમાચારમાં જ્ઞાનેલું કે, “રામાનુજન મોટા ગણિતશાસ્ત્રી હતા અને બ્રિટનમાં મોટા ગણિતશાસ્ત્રીઓ જોડે કામ કરીને ભારત પાણી આવ્યા હતા અને બે દિવસ પહેલાં તેમનું નિધન થયું હતું.” તેમના કાકા સી. વી. રામન તેમના પિતાને કહેતા હતા કે રામાનુજન સૌથી પહેલા ભારતીય રોયલ સોસાયટીના સભ્ય તરીકે ચૂંટાયા હતા. સી. વી. રામનનું નામ પણ સૂચવાયેલું. ચંદ્રાએ રામનુજન વિશે ઘણું સાંભળેલું હોવાથી ગણિત વિષય સાથે B. A. થવાનો વિચાર કરેલો. ચંદ્રાના પિતાને ગણિતશાસ્ત્રી તરીકે ઉચ્ચ ભવિષ્ય ન દેખાતાં, ભૌતિકશાસ્ત્ર સૂચિયું. ચંદ્રા ભૌતિકશાસ્ત્ર સાથે B.A.ની ડિગ્રી માટે તૈયાર પણ થયા.

ઘરમાં તેમનાં બા સવારના નાહીં-ધોઈને પંડિત નારેસાશાસ્ત્રીનું વાલ્ફીડિ રામાયણનું તમિલ ભાષાંતર બધાં બાળકોને ભેગાં કરીને વાંચી સંભળાવતાં. ચં.સુ. દેખાવડા અને મજબૂત હતા. ધેર દક્ષિણ ભારતનો પોશાક લૂંગી અને પહેરણ પહેરતા. જ્યારે કામ માટે પાટલૂન (Trouser), પહેરણ (Shirt), વાઈ અને જોકેટ પહેરતા. તદ્વારાંત મદાસીની ખાસ પાંખડી બંને ભાઈઓ પહેરતા. બ્રિટિશરાજમાં વિજ્ઞાન અને શિક્ષણકોન્ટ્રમાં મદાસી પાંખડીવાળા ઘણા બધા હતા. જો નેકટાઈ, પહેરણ, પેન્ટ અને જોકેટ પદ્ધતિમની સંસ્કૃતિનું નિશાન ગણીએ, તો પાંખડી જૂની સંસ્કૃતિની યાદ ગણાય.

ચંદ્રાનાં કોલેજનાં પહેલાં બે વર્ષ ૧૯૨૪-૧૯૨૭ સારી રીતે ગયાં. ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, અંગ્રેજ અને સંસ્કૃત આ વર્ષો દરમયાન ભાયા. ચંદ્રાને ઘણા બધા વિષયોમાં તેમના વર્ગમાં સૌથી સારો ગ્રેડ મળતો. અંગ્રેજનાં પણ ઘણાં બધાં જાણીતાં પુસ્તકો તેમજે વાંચ્યાં છે અને એમના ભાઈઓને પણ વાંચી સંભળાવ્યાં છે. પૂરતો સમય ન હોઈને સંસ્કૃત માટે તેમને મદદ લેવી પડેલી. B. A. (Hons) માટે સ્કૂલ શરૂ થતાં ગણિતના અને ભૌતિકશાસ્ત્રના વર્ગોમાં જવા માંડયા. ૧૯૨૭ની ઉનાળાની રજાઓમાં આરનોલ્ડ સોમરફેલ્ડનું (Arnold Sommerfeld) પુસ્તક, “એટમિક સ્ટ્રક્ચર એન્ડ સ્પેક્ટ્રલ લાઈન્સ (Atomic Structure and Spectral lines)” વાંચ્યું. દરરોજ કોલેજની લાઈબ્રેરીમાં જઈને માસિકો જેવાં કે નેચર (Natur) અને ફિલોસોફિકલ (Philosophical) વાંચતા. ૧૯૨૮માં તેમના કાકા સી. વી. રામનને ભૌતિકશાસ્ત્રનું નોબેલ પ્રાઇઝ મળ્યું. તેઓ પ્રથમ ભારતીય વૈજ્ઞાનિક હતા. જેમને આવું ઈનામ મળ્યું હોય. ચંદ્રા ICS

થઈને મોટી સરકારી નોકરીમાં જોડાય તેવી ચંદ્રાના પિતાની ઈચ્છા હતી, પણ હવે તો ચંદ્રાની મોટા વૈજ્ઞાનિક બનવાની ઈચ્છા ખૂબ જ પ્રબળ બની. તેમના કાકાના રસ્તે ચાલવાની ઉત્કટ ઈચ્છા થઈ. રામન બેંગલોર જતાં મદાસ તેમના મોટાભાઈને ત્યાં રોકાયેલા. ચંદ્રા તેમને મળ્યા. ઉનાળાની રજાઓમાં રામનની સાથે કલકત્તા ગયા. રામનની એસોસિએશન ફોર ધી કલિવેશન ઓફ સાયન્સ (Association for the cultivation of Science) જ્યાં ‘રામન અસર’ શોધાયેલી ત્યાં કામ કરવાનું શરૂ કર્યું. રામને તેમના ભત્રીજાને પ્રાયોગિક ભૌતિકશાસ્ત્ર ભષી આકર્ષવા માટે તેમની હાથ નીચે કામ કરનારને ચંદ્રાને બધું સારી રીતે સમજાવવા કહેલું. ચંદ્રા તેમના કાકાને ત્યાં રહેતા. બંને જણ સાથે ચાલવા જતા ત્યારે રામન તેમની શોધની બધી જ વાતો ચંદ્રાને જ્ઞાનવાટા. ચંદ્રાની કોઈ સાધન તૂટી ગયું અને ચંદ્રાને પ્રાયોગિક ભૌતિકશાસ્ત્રમાં રસ ન હોઈને ચંદ્રાનો પ્રાયોગિક ભૌતિકશાસ્ત્ર માટેનો ઉત્સાહ ઘરી ગયો.

રામનના વિદ્યાર્થી ડૉ. કે. એસ. ક્રિશન (K. S. Krishnan) જોડે મિત્રાચારી થઈ જે આજીવન ચાલી. ખૂબ જ જાણીતા જર્મન ગણિતિય ભૌતિકશાસ્ત્રી (Mathematical Physicist) અને પ્રખર શિક્ષક આર્નોલ્ડ સોમરફેલ્ડ પ્રેસિડન્સી કોલેજની મુલાકાતે આવવાના છે તે માહિતી ડૉ. ક્રિશને ચંદ્રાને આપી. ચંદ્રાએ સોમરફેલ્ડનું ભાષણ સાંભળવા યાઈમ કાઢ્યો અને તેમને અનુકૂળ સમયે બીજા દિવસે જ્યાં ઉત્તરેવા તે હોટેલે તેમને મળવા ગયા. ચંદ્રાએ પોતે શું કરી રહ્યા છે અને શું કરવા માગે છે તે પણ જ્ઞાનવ્યું. ચંદ્રાએ તેમનું સ્પેક્ટ્રલ લાઈન્સને લગતું પુસ્તક વાંચ્યું છે તે પણ જ્ઞાનવ્યું. સોમરફેલ્ડ ચંદ્રાને જ્ઞાનવ્યું કે તે તો બધું જૂનું થઈ ગયું. ચંદ્રાએ કવોન્ટમ મીકેનિક્સ વિજ્ઞો વાંચ્યું જોઈએ. ચંદ્રાએ કવોન્ટમ મીકેનિક્સનો બરાબર અભ્યાસ કર્યો અને ‘The Compton Scattering and the New statistics’ના મથાળે નીચે સંશોધન પેપર તૈયાર કરીને ફિલોસોફિકલ મેગેઝિન (Philosophical Magazine)ને મોકલી આપ્યું. થોડાક સુધ્યારાવધારા સાથે પ્રસિદ્ધ થયું. ઓગણીસ વર્ષના બીજા વર્ષના ગ્રેજ્યુઅટ વિદ્યાર્થી માટે ખૂબ જ સરસ ગણાય. જ્યારે ભૌતિકશાસ્ત્રના પ્રોફેસરે કોલેજ એસેન્સીલીમાં આ સમાચાર જાહેર કર્યા, તે જ દિવસથી ચંદ્રા નામાંકિત વ્યક્તિ બન્યા.

કવોન્ટમ થિયરી (Quantum Theory) ઉપર સરસ નિબંધ લખવા માટે પ્રો. આપ્યા રાવે ચંદ્રાને ઠનામમાં એહિનગાટનનું લખેલું પુસ્તક, ‘The Internal Constitution of Stars’ ભેટમાં આપેલું. આ પુસ્તક વાંચતાં ‘સહેદ

વામન' તારાઓ વિશે ચંદ્રાને જાળવા મળ્યું. આ રીતે ચંદ્રાને ખગોળ ભૌતિકશાસ્ત્રમાં રસ પડવા માંડ્યો. અહાબાદ કોંગ્રેસમાં ભારતીય ખગોળશાસ્ત્રી મેઘનાથ સહાને મળવાનું થયું. મેઘનાથ સહા હોશિયાર વિદ્યાર્થીઓનું ગ્રૂપ સંશોધન માટે તૈયાર કરી રહ્યા હતા. મેઘનાથ સહાએ ચંદ્રાને સાંજના જમવા માટે અને તે ગ્રૂપમાં જોડાવા માટે આમંત્રણો આપ્યાં.

જર્નન ભૌતિકશાસ્ત્રી વર્ણ હેસનબર્ગ જે "Uncertainty Principle"ના નિયમ માટે મશાહૂર છે. તે મદ્રાસની મુલાકાતે આવેલા. સાયન્સ સ્ટુડન્ટ એસોસિએશનના (Science Student Association) સેકેટરી તરીકે ચંદ્રા હેસનબર્ગને મદ્રાસની ટ્રૂરિસ્ટ જીવાઓએ ફરવા લઈ ગયેલા. આ બધું પાકે પાયે ચંદ્રાને ખગોળ ભૌતિકશાસ્ત્ર (Astrophysics) ભણી લઈ જતું હતું.

અભ્યાસમાં ચંદ્રાના સારા માર્ક્સ અને સંશોધન પ્રેસિડન્સી કોલેજના અંગેજ આચાર્ય ફાયસનના (Fyson) ધ્યાનમાં આવ્યું. જવાહરલાલ નહેરુએ મદ્રાસની બીચ ઉપર નેશનલ કોંગ્રેસની મિટિંગ બોલાવેલી અને ચંદ્રાએ આ મિટિંગમાં હાજરી આપેલી. આના માટે ડૉ. ફાયસને ચંદ્રાને દંડ કરેલો. આમ છતાંયે ડૉ. ફાયસને ચંદ્રાનું નામ ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયાની બ્રિટનમાં અભ્યાસ કરવા માટે Special scholarship માટે મોકલી આપ્યું. આ સ્કૉલરશિપમાં ટુંકોન્ડ જવા-આવવાનું ભાડું પણ આવી જાય. ચંદ્રા રામાનુઝનને મોટા ગણિતશાસ્ત્રી ગણ્ણતા હોઈ, ચંદ્રાએ રામાનુઝન જ્યાં ગયેલા તે ટ્રિનિટી કોલેજ, કેમ્બ્રિજ પસંદ કરી. ચંદ્રાના કામથી પરિચિત હોઈને પ્રો. ફોવલરે (Fowler) ચંદ્રાના Ph.D.ના ગાઈડ થવાની તૈયારી બતાવી.

ચંદ્રાનાં માતુશ્રીની તબિયત સારી ન હોઈને ચંદ્રા મનમાં જવું કે ન જવું તે નક્કી કરી શકતા ન હતા. ઘણા મિત્રો અને સંબંધીઓ ન જવા માટે કહેતા જ્યારે તેમનાં બાબે કહ્યું, "તે દુનિયા માટે જર્ન્યો છે - મારા માટે નહિ." રામાનુઝનની જેમ ભારતની નામના મેળવી લાવવા માટે ચંદ્રાએ જવું જોઈએ તેમ તેમનાં બા માનતાં હતાં. તદ્વારાંત સી. વી. રામનની મદદ વગર સી. વી. રામન કરતાં વધારે તપ્પી ઉઠે તેમ તેમનાં માતુશ્રી ઠિથ્થતાં.

ભારે હદ્દે ચંદ્રાએ ટુંકોન્ડ જવાનું નક્કી કર્યું. સંબંધીઓનું મોટું ટોળું, ચંદ્રાના શિક્ષકો અને મિત્રો મદ્રાસ સ્ટેશને ચંદ્રાને વિદ્યા આપવા એકઢા થયા. ચેન્નાઈથી મુંબઈ જતી ટ્રેનમાં વિદ્યા લીધી. જુલાઈ ૩૧, ૧૯૭૦ના રોજ ઇટાલિયન દરિયાઈ જહાજ લોયુડ ટ્રિસ્ટિનો (Lloyd Triestino)થી મુંબઈથી ટુંકોન્ડ જવા નીકળ્યા.

ભૂમધ્ય સમુદ્રનું પણી ઊંડાં વાદળી રંગનું લાગતું હોઈને કોઈ પણ પ્રભાવિત થાય. સી. વી. રામન પ્રભાવિત થયેલા અને 'રામન અસર' શોધી શકેલા. ઈતિહાસનું પુનરાવર્તન તેમના ભત્રીજા ચંદ્રા માટે થાય છે. જેને વાંચવું અને સંશોધન કરવું ગમે છે તેને તોફાન વગરની દરિયાઈ મુસાફરી વાતાવરણ આપે છે. જ્યારે ઘણા બધા મુસાફરો નહાતા, ગયાં મારતા, મજાથી સમય વિતાવતા ત્યારે ચંદ્રા તેમના સંશોધનના કામમાં મશાગૂલ જ હતા. કોઈ કોઈ વખત તેક ઉપર તેમનાં પુસ્તકો સાથે તાજી હવા માટે જતા, પણ મોટો વખત તેમની કેબિનમાં બેસીને ગંભીરતાથી સંશોધન કરતા.

ચંદ્રાએ એહેન્ગાટના પુસ્તક, "The Internal Constitution of stars"નો બરાબર અભ્યાસ કરેલો. તારાઓ જુદા જુદા તબક્કામાંથી પસાર થઈને મૃત્યુ પામે છે. તેમની જિંદગીના અંતે, ઘણા તારાઓ "સફેદ વામન (White dwarf)" તારાઓ બને છે. સફેદ વામન તારાઓ ખૂબ જ નાના હોય છે અને તેમની ઉર્જાનું વિર્સફેન અલ્ટ્રાવાયોલેટ તરંગ લંબાઈએ થતું હોઈને દૂરભીની જોતાં આ નાનો તારો સફેદ દેખાય છે. આથી આ તારાને શેત વામન તરીકે ઓળખવામાં આવે છે. વ્યાધ (Sirius)નો જોડીદાર તારો સફેદ વામન તારો છે. (Fowler) ફોવલરના સંશોધન પેપરમાંથી કઈ રીતે સફેદ વામન તારો બને તે વાંચેલું.

તારાઓના અંદરના બંધારણના પ્રશ્નોના જવાબ કવોન્ટમ્બુ ચંત્રશાસ્ત્ર અને સાપેક્ષવાદનાં પરિણામો વાપરીને મળી શકે. દરિયાઈ મુસાફરી દરમિયાન ચંદ્રા તારાઓ કઈ રીતે સફેદ વામન તારાઓ બને છે તેનો જ વિચાર કરતા હતા. મુસાફરી પૂરી થાય તે પહેલાં તેમણે જો તારાનું દવ્ય ૧.૪ સૂર્યના દવ્ય કરતાં ઓણ્ણું દવ્ય હોય તો તે તારો સફેદ વામન તારો બનશે. આ બધું વ્યવસ્થિત લખીને અમેરિકન Astrophysical Journalમાં પ્રસિદ્ધ કરવા મોકલ્યું અને તેમણે સ્વીકારીને પ્રસિદ્ધ પણ કર્યું.

લંડન પહોંચ્યા. તેમના Ph.D.ના ગાઈડ પ્રો. ફોવલર બે મહિના માટે બહાર હોઈને ચંદ્રાને ખૂબ જ અધિરૂપ પક્ષું, પણ આજરે બધું ડેકાઝે પક્ષું. ચંદ્રાએ સંશોધનનું કામ ચાલુ રાખ્યું અને બુકસ્ટોરમાંથી પી. એમ. ડિરાકનું લખેલું, "Principles of Quantum Mechanics" ખરીદી લાવીને પહેલા પાનાથી છેલ્લા પાના સુધી બરાબર વાંચીને તૈયાર કર્યું. ડિરાક, એહેન્ગાટન, રથરફર્ડ (Rutherford) અને લિટલવૂડના વર્ગોમાં જવાનું શરૂ કરી દીધું. ડિરાકનાં ભાષણો સરસ મજાનું સંગીત સાંભળતા હોઈએ તેવાં

અનુભવતા હતા. એકિન્ગાટનનાં ભાષણોમાં કટાક્ષ, મજાક હેય જ. ટ્રિનિટી કોવેજમાં ચંદ્રાનું કામ ખૂબ જ નિયમિત હતું. સવારના સાતથી સાંજના દશ તો ખરા જ, કોઈ કોઈ વખત ઘરની યાદ આવી જતી અને તેમની બાની તબિયતનો વિચાર કરતા. તે સમયે જડપી ફૈનની સગવડ ન હતી. પત્ર લખો અને ટપાલમાં મૂકો. એક મહિને વેર પહોંચો. ઘરની યાદ ન આવે તેટલા માટે સંશોધનમાં રચ્યાપચ્યા રહેતા. ફોવલર ન આવે ત્યાં સુધી ડિરાક જોડે કામ કરતા. ડિરાક શાંત મગજના અને ઓછું બોલનારા હતા જે ચંદ્રાના સ્વભાવને અનુકૂળ હતું. કોઈ કોઈ વખત રવિવારના ડિરાક અને ચંદ્રા બેતરોમાં ચાવવા જતા અને કામ પૂર્ણ જ બોલતા. એસ. ચાવવા અને ચંદ્રા મિત્રો હતા. બંને ટ્રિનિટી કોવેજમાં હતા. એસ. ચાવવાનું આંકડાશાસ્ત્રમાં ખૂબ જ અગત્યનું કામ જાણીતું છે. કોઈ કોઈ વખત બંને ફરવા જતા અને ભાગ્યે જ વાતો કરતા. સંભવત: એસ. ચાવવા અને વિકમભાઈ સારાભાઈ સાહુ થાય. આપણા અરુણભાઈ વૈદી પ્રો. ચાવવાના હાથ નીચે Ph.D. કરેલું.

જ્યારે બે મહિના તેમના થીસિસના સલાહકાર ફોવલરને મળ્યા ત્યારે ચંદ્રાએ સંશોધનમાં ઘણી પ્રવૃત્તિઓ કરેલી. સંશોધનના બે લેખો તૈયાર કર્યા હતા. ચંદ્રાના કામનો પાયો ફોવલરનું કામ છે. ફોવલરના પાયા ઉપર ચંદ્રાનું કામ થયેલું છે, પણ ચંદ્રાનું પરિણામ ઘણું જ જુદું હતું, કારણ કે ચંદ્રાએ સાપેક્ષવાદનો વ્યાપક સિદ્ધાંત અને કવાન્ટમ્યું વંત્રશાસ્ત્રનો ઉપયોગ કરેલો છે. ફોવલર ઉત્સાહ પ્રેરનારા હતા. ફોવલરે ચંદ્રાની ઓળખાણ લંડનની રોયલ એસ્ટ્રોનોમિકલ સોસાયટીના સભ્યો જોડે કરાવી. ચંદ્રાએ રોયલ એસ્ટ્રોનોમિકલ સોસાયટીની મિટિગમાં જવાનું શરૂ કર્યું. તે સમયના ઘણા બધા ખગોળશાસ્ત્રીઓ અને ખગોળ ભૌતિકશાસ્ત્રીઓને મળવાનું થયું. ખાસ તો એકિન્ગાટન (Eddington) અને તેમના વિદ્યાર્થી ઈ. એ. મિલને (E. A. Milne) જોડે મિત્રાચારીના સંબંધ બંધાયા. આ બંને જણ તારાઓની અંદરના બંધારણનો અભ્યાસ કરતા હોઈને તેમની જોડે બધી ચચ્ચાઓ થતી. મિલના કરતાં ચંદ્રાએ જુદા જ પ્રકારનો રસ્તો અપનાવ્યો હતો..

ચંદ્રા સંશોધન અને અભ્યાસમાં મશગૂલ હતા. તેમના પિતાજીને નિયમિત પત્રો લખતા. તેમના પિતાજી પણ નિયમિત પત્રોના જવાબ આપતા અને સૂચનો પણ કરતા. માંસાહાર, ઇંડાં વગેરે ખાવાની સલાહ આપતા પણ ચંદ્રા કોર્નફલેક્સ, બ્રેડ, ચા, દૂધ, માખણ, બટાકાની કાતરી અને ફિલો જ ખાતા. તેમનો ખોરાક કાયમના માટે સાઢો અને શાકાહારી રહ્યો છે, પાપડ, અથાળાં અને મસાલાના ઘરના

પાર્સ્લની રાહ જોતા જ હોય. તેઓ જમવા માટે ઠિન્ડિયન રેસ્ટોરન્ટમાં જમવાના બદલે તે પૈસાથી પુસ્તક ખરીદવામાં માનતા, એક દિવસ તેમનાં માતુશ્રીના નિધનના સમાચાર મળ્યા. આ સમાચારે ચંદ્રાને હચમચાવી મૂક્યા. ખાસ નજીકનું અહીંથી કોઈ ન હોઈને ચંદ્રા માટે આ સમાચાર પચાવવા ખૂબ જ અધરા હતા. આ સ્વીકારે જ છૂટકો હતો અને તેમની Ph.D.ની થીસિસનું કામ પૂરું કરવા તરફ જ ધ્યાન રાખ્યું. યુરોપના ભૌતિકશાસ્ત્રનાં જાણીતાં કેન્દ્રમાં થોડોક વખત કાઢ્યો. ઘણા બધા ભૌતિકશાસ્ત્રીઓને મળ્યા અને મિત્રાચારીના સંબંધો ડેળવ્યા. ૧૭મે, ૧૯૮૩ના રોજ યુરોપથી Ph.D.ની થીસિસ સાથે કેમ્પિંજ પાછા આવ્યા. તેમની તૈયારી કરેલી થીસિસ ફોવલર બરાબર ચેક કરી લેશે તેવું ચંદ્રાએ ધારેલું જ્યારે ફોવલરે જણાવ્યું કે, “મને તમારા કામમાં વિશ્વાસ છે આથી મારે જોવાની જરૂર નથી.” ચંદ્રાએ થીસિસ લઈને રજિસ્ટ્રારની ઓફિસે જઈને આપી. થોડાક દિવસ પછી રજિસ્ટ્રારની ઓફિસે જણાવ્યું કે તેમની મૌખિક પરીક્ષા મંગળવાર, ૨૦ જૂન, ૧૯૮૩ બપોરના બાર વાગે ઓબ્સર્વેટરી (observatory) રૂમમાં થશે અને ચંદ્રાએ એકેડેમીક ગાઉન પહેરીને હાજર રહેલું. એકિન્ગાટન અને ફોવલર પરીક્ષકો રહેશે. જાણો કે ચંદ્રાએ થીસિસના પરિણામે રોયલ એસ્ટ્રોનોમિકલ સોસાયટીની ૧૨ જૂનની મિટિગમાં રજૂ કર્યા હતા અને તેમના જ કામનાં વખાણ લોકોએ કર્યો હતાં.

પણ પરીક્ષા એ પરીક્ષા. ચંદ્રા ઓબ્સર્વેટરી રૂમમાં બપોરના બાર વાગે આવી પહોંચ્યા ત્યારે તેમના સિવાય કોઈ ન હતું. ફોવલર જૂનો ગાઉન પહેરીને થોડાક મોડા આવ્યા. બંને જણ એકિન્ગાટનની રૂમમાં ગયા જ્યાં એકિન્ગાટને ગાઉન પહેરેલો ન હતો. બંને જણાએ ચંદ્રાની પરીક્ષા લીધી. ચાલીશ મિનિટ પછી ફોવલરે ઘદિયાળ ભણી જોયું અને કહ્યું, “મારે મોડું થઈ ગયું છે. હું જાઉ છું.” થોડીક વાર પછી એકિન્ગાટને કહ્યું, “આ બધું જ છે (This is all).” પરીક્ષાનું પરિણામ જાહ્યા વગર ચંદ્રા પણ બાહાર નીકળી ગયા.

ચંદ્રાના માટે મોટો સવાલ હતો કે હવે શું કરવું? બિટનમાં એક વર્ષ રહીને કામ આગળ વધારવું હતું. જ્યારે સ્કોલરશિપનો સમય વધારવા સરકાર તૈયાર ન હતી. ફોવલરની ભલામણ માટે ચંદ્રા તેમને મળ્યા, ત્યારે પરિણામની ખબર પડી. તે પાસ થયેલા. ચંદ્રાએ કઈ રીતે કેમ્પિંજમાં રહેવું તે માટેની સલાહ માગતા હતા. ફોવલરે ફેલોશિપ માટે અરજી કરવા સૂચાવ્યું અને સાથે એમ પણ જણાવ્યું કે ચંદ્રાને ફેલોશિપ મળવાની ખૂબ જ ઓછી

શક્યતા છે. ચંદ્રાની પાસે છ મહિના સુધી ચાલે તેટલા પૈસા હતા. આથી ફેલોશિપ માટે અરજી કરીને છ મહિના એહિનગાનના વિદ્યાર્થી મિલ્ને જે ઓફ્સફર્ડમાં પ્રોફેસર હતા, તેમની જોડે સંશોધનનો વિચાર કર્યો અને મિલ્નેની પરવાનગી પણ લીધી.

ઓફ્સફર્ડના કેમ્પસની નજીક ભાડેથી એક રૂમ લીધી. કેમ્પિઝનું એપાર્ટમેન્ટ ખાલી કરવાનું રહ્યું. સામાન પેક કર્યો. સામાન લઈને રેલવે સ્ટેશન જવા નીકળ્યા. રેલવે સ્ટેશનથી ટ્રેનમાં ઓફ્સફર્ડ જવાય. ભાડાની ગાડીમાં સામાન ભરીને રેલવે સ્ટેશનને જવા નીકળ્યા. રસ્તામાં ટ્રિનિટી કોલેજ આવે. ટ્રિનિટી કોલેજ ગાડી ઉભી રખાવીને બોર્ડ ઉપર ફેલોશિપ કોને મળી છે તે જાણવા જોવા લાગ્યા. તેમને તો ઘણા બધાએ કહેવું કે, “ફેલોશિપ ભૂલી જાઓ.” આથી તેમને તો મળવાની નથી તે પાંકુ હતું. નામ જોતાં જોતાં તેમનું નામ જોયું. તેમને ચાર વર્ષની ફેલોશિપ મળી જેથી ચાર વર્ષ રહેવા જમવાનું હોસ્ટેલમાં અને વાર્ષિક ૫૦૦ પાર્ટન્ડ. ચંદ્ર તો ખુશાખુશાલ થઈ ગયા.

શેત વામન તારાઓ ઉપરનું કામ ચંદ્રાએ પૂરું કર્યું. ઘણા બધા ખગોળશાસ્ત્રીઓ ચંદ્રને આ કામ માટે પ્રોત્સાહન આપત્તા હતા. એમનું આ દિશામાં સૌથી પહેલું કામ જે ધી એસ્ટ્રોફિઝિકલ જર્નલ(The Astrophysical Journal)માં પ્રસિદ્ધ થયેલું તે કામ ફરીથી સુધાર્યું અને ઘણા બધા માટે વાપરી શકાય તે રીતે વિસ્તાર્યું. લંડનમાં મહિનામાં એક વખત મળતી રોયલ એસ્ટ્રોનોમિકલ સોસાયટીની મિટિંગમાં રજૂ કરવાનો વિચાર કર્યો. લંડનમાં આવી મિટિંગ જાન્યુઆરી ૧૧, ૧૮૮૫પના રોજ હતી. આ મિટિંગમાં બ્રિટનના જાણીતા ખગોળશાસ્ત્રીઓ, ખગોળ ભૌતિકશાસ્ત્રીઓ અને બીજા ઘણા હતા. લંડનમાં પિકાડિલ્વી સરકસની નજીક પિકાડિલ્વી રોડ ઉપર બર્લિન્ગન હાઉસ (Burlington House)માં મળતી. બ્રિટિશપ્રથા પ્રમાણે ૪ p.m. ચાનો સમય હતો. બધા એકબીજાને મળતા. ૪.૩૦ વાગે મિટિંગ શરૂ થતી. ચંદ્ર ઉત્સાહમાં હતા અને સાથે સાથે ઉદ્ધિન(Nervous) પણ હતા, કારણ કે આ જ વિષય ઉપર તેમના પછી બ્રિટનના અને વિચારમાં પ્રસિદ્ધ ખગોળશાસ્ત્રી એહિનગાન પણ બોલવાના છે. શું કહેશે, કેવું કહેશે તેની ચિંતા પણ ખરી. જાણીતા અને જૂના જોગીઓ પહેલી બે વાઈનમાં બેસતા. ૪.૩૦ p.m. વાગે મિટિંગ શરૂ થતી. છ વાગ્યા સુધી ચાલતી. ખરેખરી ચર્ચા પણ થતી અને વકતબ્યકળાની પરીક્ષા પણ થતી. ત્રણથી ચાર પેપરો રજૂ થતાં અને દરેકને પંદર મિનિટ મળતી. કોઈ કોઈ વખત ૬૦ સંખ્યા પણ થતી.

ચંદ્રએ ‘સફેદ વામન’ તારાઓ વિશેના ભાષણમાં ગણિતનાં સમીકરણો, ભૌતિકશાસ્ત્ર અને ભાતભાતની ગણતરીઓનો ભરપૂર ઉપયોગ કરેલો. ચંદ્રએ તે વખતે આઈન્સ્ટાઇને તાજે જ શરૂ કરેલો સાપેક્ષવાદ અને ક્વોન્ટમ મીડિન્કસનો ઉપયોગ કરવાનો નીચેનાં કારણોથી વિચાર કર્યો.

ઘણા તારાઓની મધ્યે હાઈપ્રોજનમાંથી હેલિયમમાં અને હેલિયમમાંથી કાર્બનમાં રૂપાંતર થાય છે. સૂર્યના દ્રવ્ય જેટલા દ્રવ્યવાળા તારાઓમાં કાર્બનનું રૂપાંતર કરવાની ઊર્જા ન હોઈને ફક્ત ગુરુત્વાકર્ષણ બળ જ લાગે છે. આથી તારો સંકોચાશે. જો એમ જ ગુરુત્વાકર્ષણ બળ લાગે તો સંકોચાશને બિન્હુ બને, પણ તેમ બનતું નથી. તારાની અંદર ઠાંસી ઠાંસીને આણુના મધ્યભાગો (Nuclei) ભર્યા છે. જેનું એક દીવાસળીની પેટીમાં ભરેલા દ્રવ્યનું વજન એક ટન થાય. ઈલેક્ટ્રોનો ખૂબ જ જડપથી ફર્યા કરે છે અને તેમની જડપ પ્રકાશની ગતિના જેટલી જ થાય. આ બધા ઈલેક્ટ્રોન બેગ મળીને એટલું દુબાં આપશે કે જે તારાના વધારે સંકોચાવવાનો વિરોધ કરશે. આ જાતની દ્રવ્યોની અવરસ્થા તારાની અંદર હોય તો તે ‘Relativistic Degeneracy’ તરીકે ઓળખાય છે. સાપેક્ષવાદ અને ક્વોન્ટમ યોત્રશાસ્ત્રનો ઉપયોગ કરીને બતાવ્યું કે ઓછા દ્રવ્યવાળા તારાનો ઈતિહાસ વધારે દ્રવ્યવાળાના ઈતિહાસ કરતાં જુદો છે. કોઈ ચોક્કસ દ્રવ્ય M છે કે જેનાથી ઓછા દ્રવ્યવાળા તારાઓ તેમની જિંદગીના અંતભાગમાં પૂરેપૂરા ટુકડા તરીકે જો જ્યારે M કરતાં વધારે દ્રવ્યવાળા તારાને પતિત મધ્યભાગ (degenerate care) ન હોઈને કેન્દ્રમાંથી ચોતરફ ઊર્જા ફેલાવશે અને સંકોચાશે અને આ ગણતરી નવા જ પ્રકારના પદ્ધતો કે તારાઓ બનાવશે તેમ સૂચયે છે. (જેને આપણે આપણો ન્યુટ્રોન અને શ્વામ પોલાણ (Black hole) કહીએ છીએ, ચંદ્ર બ્યક્ટર્યુલ્યુન કરીને નીચે આવ્યા પણ આ નવી શોધને જે રીતે તાલીઓના ગડગડાટથી વધાવવી જોઈએ તેવો આવકાર ન મળ્યો).

સભાના પ્રમુખે સર આર્થર એહિનગાનને ‘સાપેક્ષ પતિત (Relativistic Degeneracy)’ ઉપર વ્યાખ્યાન આપવા બોલાવ્યા.

હું અહીંથી જીવતો બધાર જઈ શકીશ કે નહિ, પણ મારા માનવા પ્રમાણે ‘સાપેક્ષ પતિત (Relativistic Degeneracy)’ જેવું કંઈ છે નહિ. ચંદ્રશેખર જે સાપેક્ષવાદનાં સૂત્રો વાપરે છે તે છેલ્લાં પાંચેક વર્ષથી સ્વીકારવામાં આવ્યા છે. આ સૂત્રો એમ બતાવે છે કે જે તારાનું દ્રવ્ય કોઈ ચોક્કસ દ્રવ્ય M કરતાં વધારે હશે તે તારો ક્ષત્રવિનાનાં વાયુ કે

(perfect gas)નો જ રહેશે અને કોઈ દિવસ ઠડો પડશે નાહિએ. તારો કેન્દ્રમાંથી ચારેતરફ ઊર્જા ફેલાવશે અને સંકોચાશે અને આ રીતે બન્યા કરશે અને તારો ફક્ત થોડાક ડિલોમીટરના વ્યાસવાળો રહેશે. આ સમયે ગુરુત્વાકર્ષણબળ મજબૂત બનશે અને તારો કાપ્યમી શાંતિ મેળવશે. હું માનું છું કે તારાને બચાવવા ગણા બધા બનાવો કે અકસ્માતો બનશે, પણ મારે વધારે રક્ષણ જોઈનું હોઈને કહીશ કે કુદરતનો કોઈ નિયમ તારાને આ રીતે બેહૂદી રીતે વર્તતો અટકાવશે.

તાલીઓના ગડગડાટ ચારેતરફ બારાબર સંભળાયા. સાપેક્ષવાદ અને કવોન્ટમ યંત્રશસ્ત્રના સંયોગથી સૂત્રો મેળવેલાં છે. આ સંયોગને હું કાયદેસરનો સંયોગ ગણતો નથી. એહિનાટને ચંદ્રશેખરે રજૂ કરેલા વિચારોને એક પછી એકને તેમની વંગભાષામાં અને ખૂબ જ હળવી ભાષામાં તોડી પાડ્યા. હાજર પ્રેક્ષકો પણ એહિનાટની સાથે જ હતા. હાલમાં તો ચંદ્રશેખરને ટેકો આપે તેવા પુરાવા પણ ન હોઈને એહિનાટનો વિજય થયો. એહિનાટના શબ્દો એ બ્રિટનમાં સાચા જ ગણાય એ લાગણી સાથે તાણીઓના ગડગડાટ સાથે તેમનું વક્તવ્ય પૂરું થયું. સભાના પ્રમુખે પછીના વક્તાની ઓળખાણ કરાવી અને કોઈ પણ જાતની ચર્ચા વગર પછીનો કાર્યક્રમ ચાલુ રાખ્યો.

આ પત્યા પછી હેરી એચ. પ્લેસ્ક્રિટ (Harry H. Plaskett) અને ચંદ્ર સાથે જમ્યા. પ્લેસ્ક્રિટ ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં પ્રોફેસર હતા. ખાસ બોલ્યા ચાલ્યા વગર જમ્યા. ચંદ્રાને એવું લાગ્યું કે પ્લેસ્ક્રિટ એહિનાટન સાચા છી તેમ માનતા. પેઝિનાટન સ્ટેશન પ્લેસ્ક્રિટને મૂકવા ગયા ત્યાં એહિનાટના વિદ્યાર્થી મિલ્ને મળ્યા. તે તો ખૂબ જ ખુશાલ હતા અને તે એમ માનતા કે એહિનાટન સાચા છી. રાને એક વાગે દ્રિગની પહોંચાયા. ખૂબ જ નિરાશ થેવાના. આટલી બધી મહેનત પાડીમાં ગઈ. એહિનાટના અભિપ્રાયના કારણે બ્રિટનમાં કોઈ પણ જાતની નોકરી મેળવવી અધિરી પડશે. આથી ચંદ્રાએ અમેરિકા જવાનો વિચાર કર્યો.

ચંદ્રાએ તેમનું કામ જે રોયલ એસ્ટ્રોનોમિકલ સોસાયરીની મિટિગમાં રજૂ કરેલું તે સમયના સુપ્રસિદ્ધ ભૌતિકશાસ્ત્રીઓ નિલ બોહર (Niels Bohr) પી. એમ. ડિરાક (P. M. Dirac) અને વોલ્ફફંગ પોલિ (Wolfgang Pauli)ને બતાવ્યું પણ કોઈ ભૂલ કાઢી ન શક્યા અને સાથે સાથે એહિનાટના સામે બોલવાની કોઈ હિમત પણ કરી ન શક્યા.

ચંદ્ર સાચા અર્થમાં જીવિ હતા. ઓક્ટોબર

૧૯૮૨માં એહિનાટને સો વર્ષ થતાં હોઈને કેમ્પ્રિજ યુનિવર્સિટીએ તેની ઉજવણી માટે ચંદ્રાને ભાષણ આપવા માટે આમંત્રાયા. ચંદ્રાએ ઉજવણીમાં ભાગ લીધો અને એહિનાટન વિશે પુસ્તક Eddington : The Most Distinguished Astrophysicist of His Time. Cambridge University Press, ૧૯૮૩ પણ લખ્યું.

અમેરિકા : પદોલી વખત

ચંદ્રાને શેપલી (Shapley)નો હાર્વર્ડના આમંત્રણનો પત્ર મળ્યો. ઓછામાં ઓછા ત્રણ મહિના રહેવું પડે અને આનું મહેનતાણું દર મહિને \$ ૫૫૦ મળશે. આની શરૂઆત ડિસેમ્બર, ૧૯૭૫ કે જાન્યુઆરી, ૧૯૭૬થી થઈ શકે. આ માટે ચંદ્રાએ ત૦ નવેમ્બર, ૧૯૭૫પના રોજ લિવરપુલ (Liverpool)થી ઉપડતું જહાજ ‘કુનાર્ડ વ્હાઈટ સ્ટાર બિટનિકા (Cunard White Star Britannica) લીધું. પહેલાં ચાલીસ કલાક દરિયાઈ માંદગી કોઈ વખત અનુભવી ન હોય તેવી હતી. કબરમાંથી જીવતા બહાર નીકળ્યા હોય તેવું લાગ્યું. ૮ ડિસેમ્બર, ૧૯૭૫પના રોજ રવિવારના નવી દુનિયાનાં દર્શન થયાં. જમીનનાં દર્શન કરવા માટે ચંદ્ર અને બીજા ઘણા મુસાફરો જહાજના તૂતક (Deck) ઉપર ધસી આવ્યા. બોસ્ટન બંદરે બાપોરના એક વાગે વહાણમાંથી બહાર નીકળ્યા અને શેપલી ચંદ્રાને લેવા આવેલા. બિટનમાં આવું કોઈ ભાગ્ય જ કરે, અહીં ચંદ્રાને ખૂબ જ આશ્ર્ય થયું. શેપલી ચંદ્રાને સીધા વેદશાળાની નજીક સૂવાની વ્યવસ્થાએ (Digs) લઈ ગયા જ્યાં ચંદ્ર ત્રણ મહિના સૂવાના હતા. શેપલીએ સાંજના ચા-નાસ્તા માટે ચંદ્રાને અને બીજા ઘણા બગોળશાસ્ત્રીઓને આમંત્રણ આપેલાં. દર અઠવાડિયે તારાઓની રચના (Stellar Structure) ઉપર બે ભાષણો આપવાનાં હતાં અને અંતમાં જાહેર પ્રજાને સમજ પડે તેવાં બે ભાષણો આપવાનાં હતાં. બીજા દિવસે શેપલીએ ચંદ્રાને વેદશાળામાં તેમની ઓફિસ બતાવી જ્યાં ચંદ્ર શાંતિથી અભ્યાસ કરી શકે. ચંદ્રાના કહેવા પ્રમાણે ઓફિસ ખરેખર સુંદર હતી. ચંદ્રાની સમજ, તેથારી વગેરેના કારણે તેમનાં ભાષણોથી શેપલી પ્રભાવિત થયા અને ચંદ્રાનું નામ “Society of Fellows” માટે મૂક્યું. જો હાર્વર્ડ આ નામ સ્વીકારે તો ચંદ્ર ત્રણ વર્ષ માટે ‘ફેલો’ બને. રહેવાનું અને જમવાનું યુનિવર્સિટીના ખર્ચ અને વાર્ષિક \$ ૨૭૦૦ મળે અને પોતાને મનગમતા વિષયમાં સંશોધન કરી શકે.

યુનિવર્સિટી ઓફ શિકાગોની વેદશાળા યીર્કીસ (Yerkes) જે વિલિયમ્સ બે, વિસ્કોન્સિન (Will-

iams Bay, Wisconsin)માં આવેલી છે. તેના ડિરેક્ટર ઓટો સ્ત્રુવનું (Otto Struve) વેધશાળા જોવા અને ભાષજો આપવા આવવાનું આમંત્રણ મળ્યું. ખગોળશાસ્ક્રી સાથે ખગોળભૌતિકશાસ્ક્રી હોય તો વિચના ઘણા બધા પ્રશ્નો સમજવામાં સરળતા રહે. આથી ઓટો સ્ત્રુવને ચંદ્રાને તેમની વેધશાળામાં રાખવાનો ખ્યાલ હતો. ચંદ્રાની યીક્રિસ વેધશાળાની મુલાકાત વખતે \$ 3000 વાર્ષિક પગાર સાથે Research Associateની નોકરીની ઓફર આપી. બીજા બે કુઈપર (Kuiper) અને સ્ટ્રોમગ્રેન (Stromgren) પણ જોડાવાના હતા. વાતાવરણ અને સ્થાફ જોઈને ચંદ્રાએ મનોમનથી ત્રણ વર્ષ યીક્રિસ વેધશાળામાં કાઢવાનો વિચાર કર્યો. જ્યારે ચંદ્રાએ હાર્વર્ડની મુલાકાત લીધી ત્યારે ન્યૂયૉર્કની અને વિદ્યાર્થી બેની મુલાકાત સમયે નાયગ્રાના ઘોધના અને વોશિંગન ડિ.સી.ની મુલાકાત લીધી. માર્ચ ૧૮ના રોજ ન્યૂયૉર્કથી બ્રિટન જવા જહાજ ‘બેરેન્ગાર્યા(Berengaria)’થી નીકળ્યા. ૨૫ માર્ચના રોજ બ્રિટન આવી પહોંચ્યા. એઙ્ગનટન, મિલન વગેરેનો અભિપ્રાય ચંદ્રાના ઉજ્જવળ ભવિષ્ય માટે યીક્રિસ વેધશાળાનો હતો. આથી ૧૨ એપ્રિલના રોજ સ્ત્રુવને રિસર્ચ એસોઝિએટની ઓફર સ્વીકારતો પત્ર લખ્યો. બધા ભાઈઓ, બહેનો અને તેમના પિતાજીને મળવાનું મન થઈ ગયું. ભારત જવાનો અને તેમના લગ્નનો વિચાર કરવાનો રહ્યો. ગીનોઆ, ઈટાલીથી (Genoa, Italy) મુંબઈ જવા માટે ૩૧ જુલાઈ, ૧૯૭૬ના રોજની ટિકિટ જહાજ ‘કોન્ટે વીરી’ (Conte Verde)ની અને મુંબઈની ગીનોઆની ટિકિટ ૧૩ ઓક્ટોબર, ૧૯૭૬ના રોજ ‘કોન્ટે વીરી’ની લીધી.

ભારતની ઉક્તી મુલાકાત :

ઇન્દ્રાઈ મુસાફરીમાં ખાસ કોઈ તકલીફ ન પડી. મુંબઈ બંદરે ચંદ્રાના પિતાજી, ચંદ્રાની બહેન રાજીમ અને તેનાં બાળકો ચંદ્રાને લેવા આવ્યાં હતાં. ચંદ્રા થોડોક વખત તેમના પિતાજી જોડે રહ્યા. ત્યાર બાદ ઘરનાં બાડીનાં સહ્યોને મળવા મદાસ જવા નીકળ્યા. લલિતા રામન લેબોરેટરીમાં કામ કરતાં હતાં. તેમને પણ જણાયું. લલિતા પણ બેંગલોરથી મદાસ આવવા નીકળ્યા.

લલિતા (Lalitha) :

ચંદ્રા અને લલિતા ભૌતિકશાસ્ક્રીના ઓનર્સ (Hon.) કલાસમાં સાથે હતાં. લલિતા પહેલી બેન્ચમાં બેસ્તાં અને ચંદ્રા તેમની પાછળ બીજી બેન્ચમાં બેસ્તાં. ચંદ્રાની પ્રયોગપોથીનો લલિતા જરૂર પડ્યે ઉપયોગ કરતાં. બંનેનાં

મકાનો પણ જોડે જોડે છે. ભૌતિકશાસ્ક્રીના ઓનર્સ વિદ્યાર્થીઓની વાર્ષિક પાર્ટી વખતે લલિતાની સાડી ઉપર લગાડવા માટે ચંદ્રાએ સરસ મજાનું સુગંધીદાર ગુલાબ આપેલું.

ચંદ્રાના કુટુંબની જેમ લલિતાના કુટુંબમાં પણ ભાષતરની મોટી કિમત હતી. લલિતાથી બે મોટી બહેનો મેડિસિનનો અભ્યાસ કરીને ડોક્ટર બનેલાં. લલિતા પણ ભૌતિકશાસ્ક્રીમાં M. Sc. થયેલાં. લલિતાની નાની બહેન પણ સંસ્કૃત સાથે M. A. થયેલાં. લલિતાના પિતાજી લશ્કરમાં મેડિકલ ઓફિસર હતા. વિશ્વયુદ્ધ વખતે પરદેશમાં લડવા જરૂર પડેલું. વિશ્વયુદ્ધ પછી તેમને કેપ્ટન બનાવેલા અને તેઓ બેંગલોરમાં રહેતા હતા. એકાદ વર્ષ પછી કેપ્ટન ડોરાઈસ્વામી (Doraiswamy) દાંતના દુખાવા સાથે વેર આવ્યા. બીજા દાંતોમાં આ રોગ પ્રસર્યો. તેમની લીમ્ફેટિક સિસ્ટમ (Lymphatic System) જ ભાંગી પડી અને આના કારણે તેમનું નિધન થયું.

લલિતાનાં માતુશ્રી તેમના પિતાજી અને માતુશ્રી જોડે તેમની ચાર પુત્રીઓ સાથે રહેવા આવ્યાં. લલિતાના દાદા સુબ્રહ્મણ્યમ (Subrahmanyam) અથ્યર (Iyer) સિવિલ એન્જિનિયર હતા. મદાસ સરકારમાં સિવિલ એન્જિનિયર તરીકે નોકરી ન ગમતાં એચિકલ્યર કોલેજમાં એન્જિનિયરિંગના વિષયો ભણવતા. તેમની સૌથી મોટી પુત્રી સુબલક્ષ્મી (Subbalakshmi) નાનપણમાં બાળ વિધવા બનેલાં. જાતે ભણોને શિક્ષિકા બનેલાં અને બાળવિધવાઓને શિક્ષણ આપીને પગ ઉપર ઊભી રહેતી કરેલી. દક્ષિણ ભારતમાં તે ખૂબ જ જાણીતાં હશે. લલિતાનાં માતુશ્રી સાવિત્ર ડોરાઈસ્વામીએ પેસા બચાવીને ચંદ વિવાની નજીકમાં ત્રણ પેઢીઓ સાથે રહી શકે તેવો મોટો બેંગલો ‘શ્રીવિલા’ ખરીદેલ.

ચંદ્રા અને લલિતા બંને જણ મદાસમાં મળ્યાં અને બંનેએ લગ્ન કરવાનો નિર્ણય કર્યો. ચંદ્રાએ તેમના પિતાને તારથી બંનેનો લગ્નનો નિર્ણય જણાવ્યો. બંને જણે ભવિષ્યનો વિચાર કરવા માંડયો. ચંદ્રાએ મદાસમાં તેને ગમતી નોકરી મળવાની ખૂબ જ ઓછી શક્યતા જોઈ. મદાસની સરકારે ચંદ્રોભર જોડે લખાવેલું કે તે અભ્યાસ પૂરો કરીને આવીને ઓછામાં ઓછાં પાંચ વર્ષ નોકરી કરશે. ચંદ્રા ઘણા બધાને મળ્યા પણ કોઈએ ચંદ્રાને લાયક નોકરી ઊભી કરવાનો પ્રયાસ પણ ન કર્યો.

ચંદ્રા અને લલિતાનાં લગ્ન ૧૧ સપેમ્બર, ૧૯૭૬ના રોજ મદાસ નજીક તિરુચાનુરમાં (Tiruchanur) આવેલ તિરુપ્તિના મંદિરમાં થયેલાં. બંને

પદ્ધતિ એકદમ નજીકના કુટુંબીજનો લગ્ન પ્રસંગે હાજર હતા. આ લગ્ન એક જ દિવસની હિંદુવિધિ પ્રમાણે થયેલા. લખિતાના કુટુંબે શ્રીવિલામાં વિધિ માટેની બધી વ્યવસ્થા કરેલી. બીજા દિવસે લખિતાના શ્રીવિલામાં મિત્રો, સગા અને સંબંધીઓ માટે રિસેપ્શન (Receipt) રાખેલું. લગ્ન પછી થોડોક સમય બંને જ્ઞાને બેંગલોરમાં કાઢ્યો. મુંબઈ જતાં રસ્તામાં ચંદ્રાનાં બહેન નાગપુરમાં હતાં તેમને મળીને મુંબઈ પહોંચ્યાં. ખરેખર બે મહિનાનો સમય ખૂબ જ ઓછો લાગ્યો. ૧૩ ઓક્ટોબરના રોજ મુંબઈ બંદરથી ઈંગ્લેન્ડ જવા નીકળ્યાં. ચંદ્રાના પિતા પણ ખાસ વાતો કરી શકેલા નહિ. આ વખતે દરિયો શાંત હોઈને લખિતાને ખાસ તકલીફ ન પડી. કેન્ઝિંજ ત૦ ઓક્ટોબર, ૧૯૭૬માં આવી પહોંચ્યાં.

દ્વિનિયો રૂમો ફક્ત એક જ વિદ્યાર્થી માટે હતી અને તમે ચા, પાણી અને સૂપ બનાવી શકો. ટર્નની અંત સુધી ચંદ્રાને તેની રૂમ રાખવાની પરવાનગી આપેલી. બપોરના અને સાંજના જમવા માટે નજીકની નાની કિમ (Whim) તરીકે ઓળખાતી રેસ્ટોરન્ટ નિયમિત જમવાની જગ્યા બની ગઈ. ચંદ્રા કાયમના માટે શાકાહારી જ રવા છે અને તેમને ગમતી રેલ્શ રેરબિટ (Welsh Rabbit) લખિતાને બતાવી, જૂના મિત્રો, અધ્યાપકો વગેરેને મળવામાં સમય જલદીથી પસાર થઈ ગયો. લિવરપુલથી બોસ્ટન જવા માટે ડિસેમ્બર ૫, ૧૯૭૬ના રોજ ઉપડતા જહાજ 'લેકોનિઆ (Laconia)'માં નીકળવા માટે ટિકિટો ખરીદી.

નવી જિંદગી :

એ સમયે ચંદ્રાના પિતા અમેરિકાને આગળ પડતો દેશ ગણતાન ન હતા. તેમણે ચંદ્રાને અમેરિકા જવા માટે ખૂબ વિચારવા જણાવેલું. અમેરિકામાં પરદેશીઓને રહેવા માટે વિસા જોઈએ. અમેરિકા નવા આવનારા પરદેશીઓને આવકારતું, કયા દેશમાંથી પરદેશી આવી શકે તે અગાઉથી અમેરિકાએ નક્કી કરેલું હોય છે. ભારતમાંથી આવનારને વિસા ન મળે. આથી બ્રિટનની અમેરિકાની એચ્યલી ઓફિસે ચંદ્રાને વસવાટ કરવા માટેના વિસા આપવાની ના પાડી એટલું જ નહિ પણ ચંદ્રાનું હડકઠું અપમાન કર્યું. ચંદ્રાએ સ્ટૂવને લખ્યું. જેણે યુનિવર્સિટી ઓફ શિકાગોના કાયદાના સલાહકારનો સંપર્ક સાધ્યો. ઈમિગ્રેશનના કાયદા છડી પ્રમાણે જે દેશોનો ક્વોટા ન હોય તે દેશોના મિશનરીઓને કાયમી રહીશોના વિસા આપી શકાય. કાયદાની રીતે જે માણસે શાળા, કોલેજ કે યુનિવર્સિટીમાં ભણાવ્યું હોય તે મિશનરી ગણાય. આ માહિતી અને એહિનગાટનનો ચંદ્રાએ

કેન્ઝિંજ યુનિવર્સિટીમાં ભણાવ્યું છે તેવો પત્ર લઈને ચંદ્રા અમેરિકન કોન્સુલને (Consul) મળ્યા અને કોન્સુલે વિસા આપવાની તેચારી બતાવી, પણ ચંદ્રાએ સમયસર અરજી કરવાની રહેશે. ભારતમાંથી ચંદ્રા લગ્ન કરીને આવેલા હોઈને લખિતાને પણ વિસા જોઈએ. આના માટે લગ્નનું અને જન્મનું સાર્ટિફિકેટ જોઈએ. આ ઘણો સમય લે. આના બદલે બ્રિટનમાં રહેનાર જવાબદાર વ્યક્તિ લખિતાને બરાબર ઓળખતા હોય તે તેમના ચારિત્ર માટે સાર્ટિફિકેટ લખીને આપે તો ચાલે. નસીબલોજો મદાસના બંનેના પાડોશી ડો. સર્વપલ્તી રાધાકૃષ્ણન બંનેને સરસ રીતે ઓળખતા હતા. તેમણે જરૂરી સાર્ટિફિકેટ લખિતા માટે લખી આપ્યું. આથી બંનેને વિસા મળી ગયા. બોસ્ટન અને હાર્વર્ડમાં મિત્રીને મળીને અને સંશોધનની ચર્ચાઓ કરીને ૨૧ ડિસેમ્બર, ૧૯૭૬ના સૌમયવારના રોજ વિવિયમ્સ બે (Williams Bay) પહોંચ્યા.

વેદશાળાની નજીક ફર્નિચર વગરનું ઘર ચંદ્રા અને લખિતાને રહેવા માટે મળવાનું હતું તે બરાબર (સફ્ટાઈ) તૈયાર ન હોઈને થોડોક વખત તેઓ કુઈપર્સના મહેમાન તરીકે રહ્યા. ૨૮ ડિસેમ્બર, ૧૯૭૬ના તેઓએ તેમના ઘરમાં રહેવાનું શરૂ કર્યું. શિકાગોથી ઓર્ડર કરેલું ફર્નિચર પણ આવી ગયું. વેદશાળામાં ચંદ્રાની સાથે કામ કરનારા સહાધ્યાયી મદદરૂપ હતા. સત્તાવીશ વર્ષ આ ઘરમાં રહ્યાં. વેદશાળાની નજીક વિવિયમ્સ બે નાનું ગામ છે. આ વેદશાળા યુનિવર્સિટી ઓફ શિકાગોની છે. સ્ટેનફર્ડ, હાર્વર્ડ, પ્રિન્સ્ટનની જેમ યુનિવર્સિટી ઓફ શિકાગો અમેરિકાની પ્રાઇવેટ પહેલી દશ યુનિવર્સિટીઓમાંની એક છે. એ સમયે અમેરિકા બ્રિટનની પાછળ ગણતાનું. આથી ચંદ્રાના પિતા આ નોકરી સ્વીકારવાના મતના ન હતા. વિવિયમ્સ બે યુનિવર્સિટી ઓફ શિકાગોથી લગભગ ૮૦ કિલોમીટર દૂર છે. શરૂઆતનાં વર્ષોમાં ખગોળશાસ્ત્ર અને ખગોળ ભૌતિકશાસ્ત્રના વિષયોનો અભ્યાસક્રમ તૈયાર કરવામાં ચંદ્રાએ ખૂબ જ મહેનત કરી. કદાચ તે સમયે દુનિયામાં આવો અનોઝો અભ્યાસક્રમ ચંદ્રા જ ઘડી શકે અને ભણાવી શકે.

તેઓ ભણાવવાનું અને સંશોધનનું કામ મન મૂકીને કરતા. તેઓ ખૂબ જ સારા શિક્ષક હતા. તેનો મને પોતાને અનુભવ થયો છે. જૂન-જુલાઈ ૧૯૭૬ પમાં અમેરિકન મેથેમેટિકલ સોસાયટીએ સાપેક્ષવાદ અને ગુરુત્વાકર્ષણની સમરસ્કૂલ સંશોધન કરનારા, થીસિસ લખનારા અને નવા શીખનારા માટે યોજેલી દુનિયાભરના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ભાગ લીધેલો. આ સમરસ્કૂલ કોર્નેલ (cornell)

યુનિવર્સિટીના ઇથેકા, ન્યૂયૉર્કના કેમ્પસ ઉપર હતી. હું અને રમેશ ૧૮૬૫ની સમરસ્કુલમાં ભાગ લેવા બર્કલીથી ગયેલા. ચંદ્રાએ બે અઠવાડિયાં સવારના સમયમાં જનરલ રીલેટીવીટી શીખવેલી. તેમના હસ્તાક્ષર સરસ હોઈને બોર્ડ ઉપર વ્યવસ્થિત વાંચી શકાતું. શાંતિથી બોલે જતા અને લખે જતા. લખવામાં કોઈ પણ ભૂલ ન થતી, કારણ કે તેમણે ખૂબ જ સરસ તૈયારી કરેલી જ હોય. શિક્ષક તરીકે આથી વધારે સારા શિક્ષક મેળવવા અધિરા છે. પહેલા જ વર્ષે તેમણે પ્રશિષ્ટ પુસ્તક, “An introduction to the theory of stellar structure” લખ્યું, જે યુનિવર્સિટી ઓફ શિકાગો પ્રેસે ૧૮૮૮માં પ્રસિદ્ધ કર્યું.

વિલિયમ્સ બે ૧૮૬૪ સુધી તેમનું ઘર હતું, દર ગુરુવારે ભજાવવા માટે યુનિવર્સિટી ઓફ શિકાગોના કેમ્પસે પહોંચતા. કોઈ કોઈ વખત જરૂર પડે તો રાતના ઇન્ટરનેશનલ હાઉસમાં રોકાતા. તેની કિમત તે સમયે \$ ૩.૦૦ હતી. પગાર પણ પ્રમાણમાં ઓછો હશે. થીર્કિસથી શિકાગો અને શિકાગોથી થીર્કિસ વિદ્યાર્થીઓ, સંશોધનકારો અને મુલાકાતીઓને તેમની ગાડીમાં લઈ જતા. ગુરુવારે શિકાગો કેમ્પસમાં ભજાવતા. સવારે ૬ વાગે, ગમે તેવું ઝતુમાન હોય તોપણ નીકળે. એક જ રસ્તો લેતા. એક જ પેટ્રોલાંપે પેટ્રોલ પુરાવતા અને હાવર્ડ જોનસન (Howard Johnson)ની રેસ્ટોરન્ટમાં નાસ્તો કરતા અને યુનિવર્સિટી ઓફ શિકાગોના કેમ્પસે ૮.૩૦ પહોંચતા. તેઓ ગાડી ઝડપથી ચલાવતા અને કોઈ કોઈ વખત વધારે ઝડપથી ગાડી ચલાવવા માટે ઊભા રાખેલા છે.

આ ઉપરાંત દર અઠવાડિયે વાર્તાલાપ (colloquim) તેમણે શરૂ કરેલો. દર ૧૦૦માં વાર્તાલાપે ચંદ્રા ખાસ વાર્તાલાપ આપતા અને લખિતા ખાસ ડિઝાઇન બનાવતાં. સહાધ્યાધીઓ, વિદ્યાર્થીઓ માટે ઘણી વખત બપોરની ચા માટે તેમનું ઘર ખુલ્લું રહેતું. ૧૮૮૮માં બંને જગ્યા અમેરિકાનાં નાગરિકો બન્યાં. ચંદ્રાના પિતા માટે આ પચાવવું ખૂબ જ અધારું હતું.

વિશ્વચુદ્ધ II :

અમેરિકાના ઘણાબધા વૈજ્ઞાનિકો લડાઈમાં મદદ કરવા થનગાની રહેલા. લખિતા અને ચંદ્રા ઓક્ટોબરથી ડિસેમ્બર, ૧૮૪૧ ઇન્સ્ટિટ્યુટ ફોર એડવાન્સ્ડ સ્ટીઝ, (Institute for Advanced Studies) પ્રિન્સટનમાં હતા. વોન નોયમેન (Von Newmann) ચંદ્રાના કેમ્પિંગના જૂના મિત્ર છે. ડિસેમ્બર ૭, ૧૮૮૪ ના રોજ જાપાનીઝોએ પર્વ હાર્બર ઉપર હુમલો કર્યો અને અમેરિકા લડાઈમાં

જોડાયું. ચંદ્રાની ઇચ્છા લડાઈમાં વૈજ્ઞાનિક તરીકે જોડાવવાની ઘણી હતી, પણ ચંદ્રા અમેરિકાના નાગરિક ન હોઈને મોટા ભાગનાં અગત્યનાં કામ માટે પરવાનગીની જરૂરિયાત ખરી. વોન નોયમેન લડાઈને લગતાં કાખોમાં સંડોલાયેલા હતા. મેરીલેન્ડ રાજ્યમાં એબર્ડિન પ્રોવિંગ્સ ગ્રાઉન્ડ (Aberdeen Proving Grounds)માં આવેલી બેલેસ્ટિક રિસર્ચ લેબ (Ballistic Research Lab)માં કન્સલ્ટન્ટ હતા. તેમને લાગ્યું કે તારાઓની અંદરના ઉષ્ણતામાનની અને તોપની અંદરના ઉષ્ણતામાનની અંદર કંઈક સામાન્ય હોવું જોઈએ. ચંદ્રા આ પ્રોજેક્ટમાં ઉપયોગી થશે તે જાતનો પત્ર આ ગ્રૂપના લીડર રોર્બર્ટ એચ. કેન્ટ (Robert H. Kant) લખ્યો. કેન્ટે ચંદ્રાને ગ્રૂપમાં જોડાવવા વિનંતી કરી. આ માટેની મંજૂરી મેળવતાં વર્ષ થઈ ગયું. આખરે સેક્રેટરી ઓફ વોરે (Secretary of War) ૨૭ જાન્યુઆરી, ૧૮૪૪ના રોજ મંજૂર કર્યું. ચંદ્રાએ APGમાં ફેબ્રુઆરી, ૧૮૪૪માં કામ શરૂ કર્યું. પરિશ્રમનું કામ હતું, ચંદ્રા ત્રણ અઠવાડિયાં APCમાં અને ત્રણ અઠવાડિયાં થીર્કિસમાં કાઢતા. APGના ગ્રૂપમાં ખૂબ જ આગળ પડતા વૈજ્ઞાનિકો હતા : વોન નોયમેન, રોનાટ ગુર્ણી, એલ. એચ. થોમસ, ઈડવિન હબલ, રોર્બર્ટ સેચ્સ (બર્કલીમાં હું તેમનો મદદનીશ હતો. તેમના ભારતીય વિદ્યાર્થી કામેસ્વર સી. વાલિએ ચંદ્રાનું જીવનચરિત્ર લખ્યું છે.) ચંદ્રા અને સેચ્સની ઓફિસ એક હતી. અહીંથી બેલિસ્ટિક્સના ટેસ્ટ, શૉકવેલ્સ (Shock Waves)ની વિધારી, મેચ (Mach) effect, ન્યૂટ્રોન ડીફ્યુઝનનો શ્રાન્સપોર્ટ ખુલ્લામાં આ બધાની મિટિગમાં ચર્ચાતું. આની સાથે જુદા જુદા ક્ષેત્રના માણસો જોડે નવા જ પ્રકારના કામ કરવાની ચંદ્રાને મજા પડતી. આની સાથે તેમની ચામડીના રંગના કારણે તેમને હેરાન થવું પડતું. APG ખૂબ જ વિશાળ જગ્યા હોઈને ઘણા બધા દરવાજાથી અંદર બહાર જઈ શકાય. એક વખત ખૂલથી બીજા દરવાજાથી દાખલ થયા. દાખલ થતાં જ, કોઈએ બૂમ પારીને કહ્યું, “Eh blackie there, you just wait until I come!” ચંદ્રાએ એક કલાક તેની રાહ જોવી પડી, એ પછી જ ચંદ્રાને અંદર જવા દીધા. આવા બધા માટે તૈયાર રહેવું પડતું. ૧૮૪૪માં વોન નોયમેને ચંદ્રાને મેનહન (Manhattan) પ્રોજેક્ટમાં લેવા માટે ગંભીરતાપૂર્વક પ્રયત્ન કર્યો, પણ છેવટે ચંદ્રા ના જોડાયા.

વિભાગ છોડવો પડતો :

બેન્ટ સ્ટ્રોમગ્રેન (Bengt stromgren) ૧૮૮૨-

ઉત્તના કોપનહેગનના જુના મિત્ર. લગભગ સાથે જ યુનિવર્સિટી ઓફ શિકાગોના ખગોળશાસ્ત્ર વિભાગમાં જોડાયેલા. ૧૮૫૨માં બેન્જટ ખગોળશાસ્ત્ર અને ખગોળ ભૌતિકશાસ્ત્રના વિભાગના વડા હતા. બેન્જટને ઉનાળો કોપનહેગનમાં ગાળવો હતો. આથી ચંદ્રાને એક્ટિંગ ચેરમેન બનાવેલા. ચંદ્રાએ જે રીતે વિભાગનું કામ થતું જોયું તે તેમની દસ્તિએ બરાબર ન હતું. આ ઉપરાંત ચંદ્રા બેન્જટને ખાસ ગણતા હોઈને બેન્જટને જણાવ્યું કે, “આવું ક્યાં સુધી ચલાવી લેશો? વેધશાળા માટે તમારે રાજીનામું આપવું જોઈએ અને કુઈપરને વેધશાળાના ડિરેક્ટર બનાવવા જોઈએ.” બેન્જટને બિલકુલ ન ગમ્યું. તેમણે વિભાગના બીજા સભ્યોને વાત કરી. અને બધા સભ્યો યુનિવર્સિટીના પ્રેસિડન્ટ કિમ્પટનને (Kimpton) મધ્યા જેમણે બેન્જટને ફરીથી ડિરેક્ટર બનાવ્યા.

આ જ વર્ષે બેન્જટ જે ચંદ્રાએ છેલ્લાં પંદર વર્ષથી ગ્રેજ્યુએટ પ્રોગ્રામના નવા નવા વિષયો દાખલ કરેલા. અને ભાષાવતા તે બધા વિષયોનો કાળજીપૂર્વક અભ્યાસ કરીને જરૂર પડે નવા વિષયોનો નવો અભ્યાસક્રમ શરૂ કરવા માટે કમિટી રહી. ચંદ્રા આ કમિટીમાં ન હતા. ખગોળશાસ્ત્ર બે ભાગમાં વહેંચી શકાય. પહેલો ભાગ તારાઓ કેટલા દૂર છે, તેમનું દ્વય કેટલું છે, કેટલા પ્રકાશિત છે અને સ્પેક્ટ્રોસ્કોપીનો ઉપયોગ કરીને કંપાં કંપાં તત્ત્વો તારામાં આવેલાં છે. વગેરેનો અભ્યાસ કરે. જ્યારે બીજી બાજુ તારાની અંદર શું થઈ રહ્યું છે, તારાની અંદર તેમ જ બહારના વાતાવરણનો અભ્યાસ, ઉષ્ણતામાન, ગરમીનું પ્રસરણ, તારાવિશ્વ અને ક્રેઝાર વગેરેનો અભ્યાસ કરે. ચંદ્રા ખગોળશાસ્ત્રી નથી એટલે કે પહેલા પ્રકારના નથી. તે ભૌતિકશાસ્ત્ર કે રસાયણશાસ્ત્ર કે જે મળે તે શાસ્ત્રનો ઉપયોગ કરીને તારાઓની અંદર શું ચાલી રહ્યું છે તે જીવાવા માગનારા છે. આ ખગોળ ભૌતિકશાસ્ત્રીઓ ખગોળશાસ્ત્રીઓને શું કરવું તેની સલાહ આપે છે. આ નવી રચાયેલી કમિટીનો ફક્ત ખગોળશાસ્ત્રને લગતા વિષયો ભાષાવવાનો નિર્ણય હતો. જે નિર્ણય બહુમતિથી વિભાગ સ્વીકાર્યો. ચંદ્રા જે વિષયો ભાષાવતા હતા તે કાઢી નાખવામાં આવ્યા. ચંદ્રા કોઈ કારણસર વિભાગની મિટિગમાં પૂરો સમય હાજર રહી શકેલા નહિ. ૧૮૮૮-૮૯ સુધી ખગોળશાસ્ત્ર અને ખગોળ ભૌતિકશાસ્ત્રના વિભાગમાં પાયાના વિષયો : ત્રણ કવાર્ટર્સ તારાઓનું ગતિશાસ્ત્ર અને તારાવિશ્વોનાં માળખાં. બીજા વર્ષમાં ત્રણ કવાર્ટર્સ તારાઓનું વાતાવરણ,

ત્રણ કવાર્ટર્સ તારાઓ વચ્ચેનું દ્વય. નવા પ્રોગ્રામમાં આમાંનું કંઈ ન મળો. ચંદ્રાને ખગોળશાસ્ત્રી બનીને ભણાવવું પડે અથવા જે ભૌતિક વિભાગ તેમને સ્વીકારે તો ભૌતિકશાસ્ત્રના વિષયો ભણાવવા પડે.

નસીબજોગ યુનિવર્સિટી ઓફ શિકાગોનું ભૌતિકશાસ્ત્ર વિભાગ મજબૂત હતું અને આ વિભાગમાં ફર્મિ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ (Fermi Research Institute) પણ હતું. ઇરિક ફર્મિ (Eric Fermi) બહુ જ મોટા ભૌતિકશાસ્ત્રી હતા. તેમણે ચંદ્રાને ભૌતિકશાસ્ત્ર વિભાગના અને ફર્મિ ઇન્સ્ટિટ્યુટના સભ્ય બનવા માટે વિનંતી કરી. ભૌતિકશાસ્ત્ર વિભાગમાં ચંદ્રા Mathematical physics, quantum mechanics, electromechanics અને ‘General Theory of Relativity શીખવતા. આ શીખવવાના કારણે તેમણે વિશ્વને ‘The Mathematical Theory of Black holes’ અને ‘Newton’s Principia for the common Reader’ આપ્યાં. તેમણે છેલ્લા ઘણા વર્ષોમાં ખગોળશાસ્ત્ર અને ખગોળ ભૌતિકશાસ્ત્ર વિભાગમાં કોઈ વિષય શીખવ્યો નથી. આટલી હદે માણસો નિર્દ્દય થઈ શકે છે.

ધી એસ્ટ્રોફિઝિકલ જર્નલ (The Astrophysical Journal) :

ચંદ્રા ધી એસ્ટ્રોફિઝિકલ જર્નલ (APJ)ના ૧૮૫૨થી ૧૮૭૩ સુધી (મેનેજિંગ ઇન્ડિટર) વહીવટી તંત્રી હતા. પહેલાં બાર વર્ષ આ જર્નલના સ્થાફમાં ચંદ્રા અને એક પાર્ટ-ટાઇમ સેકેટરી. યેર્કીસ (Yerkes) વેધશાળામાં આની ઓફિસ. પહેલાં વર્ષ (૧૮૫૨)માં છ અંક બહાર પાડેલા અને કુલ્યે ૮૫૦ પાનાં છિપાયેલાં. ૧૮૬૮માં વર્ષના બાર અંક બહાર પાડેલા. જ્યારે જુલાઈ ૧૮૭૦માં ૨૪ અંક અને ૧૨,૦૦૦ (બાર હજાર) પાનાં. દર વર્ષ જર્નલનાં પાનાં વધતાં ગયાં. અગત્યના સમાચાર જલદીથી પહોંચાડવા માટે ૧૮૬૭માં APJ Letters Section શરૂ કરેલું. પહેલા વર્ષ \$ ૭૦૦૦ બાધ હતી. ચંદ્રાએ ૧૮૭૧માં APJનો વહીવટ સોંઘો ત્યારે આ જર્નલના ભવિષ્ય માટે રાખી મૂકેલું ફેડ \$ ૫,૦૦,૦૦૦ (પાંચ લાખ ડોલર) હતું. જર્નલ આર્થિક રીતે યુનિવર્સિટી ઓફ શિકાગો ઉપર આધારિત ન રહે તે માટે જર્નલની પ્રોડક્શન ઓફિસ હતી જે પ્રોડક્શન અને પ્રકાશકના બીજા ખર્ચાઓ પણ યુનિવર્સિટી ઓફ શિકાગો પ્રેસને આપતી.

ચંદ્રા એમની પસંદગીથી વહીવટી તંત્રી બનેલા ન હતા, તે જ્યાં હતા તેના કારણે એમના માથે આ કામ આવી પડ્યું. ખગોળશાસ્ત્રીએ બીજો કોઈ ગંભીરતાથી તેમનાં

સંશોધનનાં પેપરો વાંચશે અને પછી જ યોગ્ય હશે તો સામયિકમાં છાપશે તેનાથી જરાયે ટેવાયેલા નહિ અને છપાવવાનું ખર્ચ તેમની વેદશાળાએ કે યુનિવર્સિટીએ આપવું પડશે તે તો કલ્યાના બહાર જ હતું. તંત્રીની નિમણૂક યુનિવર્સિટી ઓફ શિકાગોના ચાન્સેલરે કરેલી ત્યારે નીચેની શરતો મૂકૃલી.

તંત્રી સામયિકના બજેટ માટે જવાબદાર છે અને નફનુકસાન વગર છાપવાનું રહેશે, જે ખૂબ જ અધરું કામ છે. પહેલા વર્ષ \$ ૭૦૦૦ની ખાદ હતી. આ બધું બદલાઈ ગયું. ચંદ્રાએ બધું કામ સરળ બની જાય તેવા રસ્તા શોધવા માંડ્યા. પત્રોના જવાબો ઝડપથી આપાતા. આની અસર એ પડવા માંડી કે APJ સરસ સામયિક બની રહ્યું છે. આથી સંશોધનનાં પેપરો વધારે આવવા માંડ્યાં અને સામયિકનું કદ વધ્યું અને આવક વધી. પાંચ વર્ષ પછી નફી કરતું થયું.

કેરોલ છ. બોવેન (Carrol G. Bowen) જે યુનિવર્સિટી ઓફ શિકાગોના સામયિક વિભાગના વડા હતા તેમણે કહ્યું,

"you are splendid steward of intellectual assets and your responsible exercise of these duties is demonstrated in every way; greater income, greater circulation, greater volume in page and all with increasing surplus.

You must run a school for other editors, when you retire!

ચંદ્રાએ સામયિકના નીતિમત્તાના નિયમો ગોઠવી દીધા. મધ્યસ્થી (referee) અને તંત્રીપણાની પોલિસી તેમની. ચંદ્રા કર્દ રીતે કામ કરતા તેનો તેમના Hermann Bondiને લખેલા પત્ર ઉપરથી જ્યાલ આવશે.

જ્યારે કોઈ સંશોધનનું પેપર મને મળે ત્યારે પહેલાં જ તપાસ કરી લઉં છું કે સંશોધન પેપર નિખાલસપણે સ્વીકાર્ય છે કે નહિ. પ્રકાશન માટે આવતા બધા પેપરોમાં ૧૦ ટકા આ જાતના છે; મેરિલ (Merrill)નું પરિવર્તનશીલ તારાની વર્ઝિપટ પરની લાક્ષણિકતા અથવા સ્વાર્સચાઇલ્ડ (swarzschild) સ્વૂર્યના નવા મોડલ માટે મધ્યસ્થીની (referee) જરૂર નથી. હું મારી જાતને ૧૦ ટકાથી ૧૫ ટકા સંશોધન પેપરોનો મધ્યસ્થી થઈ શકું તેમ માનું છું. બાકીનાં મારી પસંદગીના બહારના મધ્યસ્થીઓને મોકલું છું. મારે ઉમેરવાની જરૂર નથી કે ઢંગધડા વિનાના સંશોધન પેપરને ઝડપથી ના પાડી દઉં છું.

તમે પૂછેલું કે મધ્યસ્થીને મોકલવાથી સંશોધન પેપરનું પ્રસિદ્ધ થવાનું મોડું થાય. આવું ન બને તે માટે ઘણો પ્રયત્ન કરું છું. હું મધ્યસ્થી પસંદ કરતો હોઈને મને ખબર છે કે કોના ઉપર આધાર રખાય અને કોના ઉપર આધાર ન રખાય. જો કોઈ મધ્યસ્થી લાસરિયો હોય તો તેમને યાદ કરાવતો નમ્ન પણ બરાબર ધ્યાન દોરતો પત્ર લખું છું. જો કોઈ ચાર અઠવાડિયાં સુધી ન મોકલે તો કડક રીતે જગ્યાવી દઉં કે રિપોર્ટ વગર સંશોધન પેપર પાછું મોકલી આપો. ગંભીરતાપૂર્વક જગ્યાવું કે મને મધ્યસ્થીઓ તરફથી ખૂબ જ સહકાર મળ્યો છે.

APJનું કામ તેમના શીખવવાના કે સંશોધનના કામમાં વચ્ચે ન આવે તેની કાળજી રાખતા. APJના કામ માટે ભણવવાનો ભાર ઓછો કરવાની ચંદ્રાએ માગણી કરી નથી. APJની ઓફિસ ક્યાંથી ક્યાં સુધી ખુલ્લી રહેશે તે લખેલું હતું અને તેને ચંદ્રા વળજ્યા રહેતા. સમય બહાર સામયિકનું ન વિચારતા. તેમની ઓફિસમાં હોય ત્યારે કોઈ APJના વગતો સવાલ પૂછે તો જગ્યાવતા કે તે APJની ઓફિસમાં ઓફિસના સમય દરમિયાન ઝીન કરશે તો યોગ્ય જવાબ મળશે. આમાં કોઈ અપવાદ નહિ.

આટાલ લાંબા સમયમાં ઘણા બધાંનાં સંશોધન પેપરો સ્વીકાર્યાં ન હોય, સુધારાવધારા સુચચ્યા હોય તેનાં કારણે ઘણા ચેદ્રા ઉપર ગુસ્સે થતા અને સંપાદકીય મંડળને (Editorial Board) ફરિયાદો પણ કરતા. આખરે APJ દુનિયાભરમાં ખૂબ જ જાણીનું અને ઊંચી કક્ષાના વિદ્વત્તાભર્યા લેખો પ્રસિદ્ધ કરવાની જગ્યા ગણાતી, ગણાય છે અને ગણાતી રહેશે. આ ચંદ્રાની ખગોળશાસ્ત્રીઓ અને ખગોળ ભૌતિકશાસ્ત્રીઓના સમાજને અમૂલ્ય બેટ છે. જ્યાં સુધી તંત્રી રહ્યા ત્યાં સુધી ન્યાયી રહેવાય તે કારણે ખગોળશાસ્ત્રના અને ખગોળ ભૌતિકશાસ્ત્રીઓના સમાજથી દૂર રહ્યા. તેમણે કોન્ફરન્સ અને સીમોસિયાનાં આમંત્રણો પણ ન્યાયી રહેવા માટે ન સ્વીકાર્યાં.

વ્યવસ્થિત સ્વરૂપમાં મૂકવાની ફિલસ્ફૂફી (Philosophy of Systemization) :

આપણે તારાનો અભ્યાસ કરવા માટે બધી જ જીણામાં જીણી બાબતનો અભ્યાસ કરીએ તો તુરત જ જ્યાલ આવશે કે બધું ગૂંચવણભર્યું છે. જેમ કે ઊર્જા ક્યાંથી આવે છે, ઊર્જાની પેદાશ કરી રીતે સતત બને છે. ક્રિએણો અંદરથી બહાર કર્દ રીતે જાય છે. ઘનતા, દબાણ વગેરે જુદા જુદા ભાગમાં સરખાં હશે કે જુદાં જુદાં? તારાની ધરીની આસપાસ ભમતું, બીજા તારાઓની અસર વગેરે.

આ બધું એકસાથે કરવું જરાયે સહેલું નથી.

ચંદ્રાએ નાનો ભાગ લઈને શું થઈ શકે તે વિચાર્યું. એમજો જે તારાઓ સમતુલન (equilibrium) અવસ્થામાં હોય અને સ્થિર (steady) હોય તેવા તારાઓનો વિચાર કર્યો. સમતુલન તારાઓ ગણ પ્રાચલોથી (parameters) દર્શાવી શકાય. તે પ્રાચલો તારાનું દવા M, તારાની ન્િજીવા અને તેજસ્વિતા (Luminosity) L છે. આપણી પાસે ઘણા તારાઓની M, R અને L કિમતો છે. જો તારો સમતુલન અવસ્થામાં હોય તો M, R અને L વચ્ચે શો સંબંધ ? ચંદ્રાએ છીથી સાત વર્ષ આનો અભ્યાસ કર્યો અને સંશોધનોના પેપરના સ્વરૂપમાં પ્રસિદ્ધ કર્યો અને આ અભ્યાસ પૂરો થતો પહેલું પુસ્તક.

(1) An introduction to the study of stellar structures. University of Chicago Press, 1939. Reprinted : Dover Publications, New York, 1967. જાપાનીજ અને રશિયન ભાષામાં ભાષાંતર.

આની સાથે તેમજો શેત વામન તારાઓનો અભ્યાસ કરેલો (1929-1939).

ચંદ્રાના સંશોધનનું મૂળ કારણ વિજ્ઞાનના જુદા જુદા વિષયોની પ્રગતિમાં ભાગ લઈને તેમને વ્યવસ્થિત સ્વરૂપમાં મૂકવાનું. ભૌતિકશાસ્ત્ર અને બગોળા ભૌતિકશાસ્ત્રનાં ઘણાં ક્ષેત્રમાંના એક ક્ષેત્રને લઈને તેના ઉપર પ્રભુત્વ મેળવીને તે ક્ષેત્રમાં ઘણાં સંશોધન પેપરો લખીને તે ક્ષેત્રના મુખ્ય વિચારોને આવરી લેતું પુસ્તક લખીને બીજા નવા ક્ષેત્રમાં જતા. આ નવા ક્ષેત્રમાં પણ તે જ રીતે કરતા. લગભગ સાતથી દસ વર્ષ કામ કરતા. તેમની જિંદગીના લગભગ સાત ભાગ પાડી શકાય. ઉપરનો એક ભાગ

(2) તારાઓનું ગતિશાસ્ત્ર, બાઉનિઅન ગતિ સાથે (1938-1943).

પુસ્તક : Principles of Stellar Dynamics. University of Chicago Press, Chicago 1943. Reprinted Dover Publications, New York, 1960.

(3) ઉષ્ણતાનું કિરણોથી એક જગ્યાએથી બીજ જગ્યાએ જું. જેમાં તારાઓનાં વાતાવરણ પણ આવે વગેરે (1943-1950).

પુસ્તક : Radiative Transfer, Clarendon Press, Oxford, 1950, Reprinted, Dover Publications, New York, 1960, રશિયન ભાષામાં ભાષાંતર

(4) દ્વયગતિકીય અને લોહચુંબકીય દ્વયગતિની સ્થિરતા જેની સાથે ગથ-બેનાર્ડ ઉષ્ણતાનયન (1952-1961)

પુસ્તક : Hydrodynamic and Hydromagnetic Stability. Clarendon Press, Oxford, 1961

Reprinted, Dover Publications, New York, 1981. રશિયન ભાષામાં ભાષાંતર.

(5) ઉપવલયજ આકારની (Ellipsoidal Figures), આકૃતિઓની સંતુલનતા (equilibrium, અને સ્થિરતા (stability) (1961-1968).

પુસ્તક : Ellipsoidal figure of Equilibrium, Yale University Press, New Haven, 1969

Reprinted : Dover Publications, New York, 1987, રશિયન ભાષામાં ભાષાંતર.

(6) વ્યાપક સાપેક્ષવાદ અને સાપેક્ષવાદી ખગોળ ભૌતિકશાસ્ત્ર (1962-1972).

(7) શ્યામ પોલાણોના ગણિતીય સિદ્ધાંત (1974-1983).

પુસ્તક : The Mathematical Theory of Black Holes. Clearendon Press, Oxford, 1983. રશિયન ભાષામાં ભાષાંતર.

સારામાં સારા ભૌતિકશાસ્ત્રી કે ગણિતશાસ્ત્રી તરીકે જાળીતા થવા માટે ગમે તે એક જ ક્ષેત્રમાં ચંદ્રાના જેવું સંશોધન અને તેને લગતું પુસ્તક પૂરતું છે. ન્યૂટનના લખેલા અસામાન્ય ગ્રંથ 'Principia'ને ત્રણસો વર્ષ પૂરાં થતાં, 300 વર્ષમાંથી સંવત્તસી ઊજવવા માટે યુનિવર્સિટી ઓફ રિયાન્ડાલોઝીસ ચંદ્રાને આમંત્રણ આપ્યું. ચંદ્રાએ ઉત્સાહપૂર્વક આમંત્રણ સ્વીકાર્યું. અગાઉ થોડાક જ પ્રમેયોનો અભ્યાસ કરવા વિચાર કર્યો. પણ જેમ જેમ વાંચતા ગયા તેમ તેમ વધારે રસ પડતો ગયો અને આખરે ચંદ્રાએ તેમનું છેલ્લું પુસ્તક, "Newton's Principia for the Common Reader" લખવાનો વિચાર કર્યો. ચંદ્રાના કહેવા પ્રમાણે પ્રિન્સિપિઅના દરેક પાનામાં એમને નવું કંઈક મળ્યું છે. તેમની ઉમર અને તબિયતના કારણે આ કામ પૂરું થઈ શકશે કે કેમ તે શંકાસ્પદ હતું. લખિતાના શર્ધેમાં, "Can one's determination to finish one's undertaking conquer over what fate has determined for you ? I have a feeling that Chandra had that will and succeeded, although he had the constant fear that he was going to die before me."

ચંદ્રાએ સરસ છાપેલું આ પુસ્તક જોયું અને તેમજો લખિતાને અર્પણ કર્યું છે.

ચંદ્રાનું પહેલું સંશોધન પેપર 1928માં Compton

effect વિશે હતું અને છેલ્ખું પેપર 1995માં તેમના નિધન પહેલાં સ્વીકારાયેલું હતું જે non-radial oscillation of starsને લગતું હતું. તેમણે કુલ્યે 380 જેટલાં સંશોધન પેપરો લખ્યા હોય. યુનિવર્સિટી ઓફ શિકાગોએ સાત Volumesમાં Selected Papers પ્રસિદ્ધ કર્યો છે. ચંદ્રશેખરે 45 વિદ્યાર્થીઓને Ph.D. માટે દોરવાળી આપી છે. ચંદ્રશેખરના નિધન પછી લલિતા ચંદ્રશેખર નોબેલ પ્રાઈજના પૈસા યુનિવર્સિટી ઓફ શિકાગોને સુભ્રહ્ષયમું ચંદ્રશેખર મેમોરિયલ ફેલોશિપની સ્થાપના માટે આપ્યા. આ ફેલોશિપ ભૌતિક વિભાગ કે ખગોળશાસ્ત્ર અને ખગોળ ભૌતિકશાસ્ત્ર વિભાગના Ph. D. પ્રોગ્રામના આગળ પડતા (outstanding) વિદ્યાર્થીને દર વર્ષે અપાય છે.

1937ની આસપાસ સ્ટૂટે ચંદ્રાની સાથે મુખ્ય કેમ્પસમાં ખગોળશાસ્ત્રનો વિષય ભાગવવાનું નક્કી કર્યું પણ સાયન્સના ડીન હેઠી ગેલે વીટો વાપરીને ચંદ્રાના રંગના કારણે ચંદ્રાને ભણાવવાની ના પારી. યુનિવર્સિટી ઓફ શિકાગોના પ્રેસિડન્ટ હટ્ટિચન્સ (Hutchins) કહ્યું, "By all means have Mr. Chandrasakhar teach."

યુનિવર્સિટીના પ્રેસિડન્ટ એડવર્ડ લેવિસે (Edward Levi) કહ્યું, "Chandra always symbolized to me at least a kind of humanistic scientist, a


person of enormously high standards, determined, idealistic, brilliant and one who never seemed to deviate from his own ideals, ideals for a great scholar. I always thought of him as the kind of a person for whom and through whom the university existed."

પહેલી કક્ષાના આપણા વૈજ્ઞાનિક અને માનવી આપણી આવતી પેઢીઓને પ્રેરણારૂપ છે. તેમની સતત કામ કરવાની રીતે તો દરેકે શીખવા જેવી છે.

આ લેખ નીચેના પુસ્તકોના આધારે લખ્યો છે

- (1) Wali, Kameshwar C. (1991). Chandra : A biography of S. Chandrasekhar. The University of Chicago Press
- (2) Parameswaran, Uma (2011). C. V. Raman : A biography. Penguin Books.
- (3) Salwi, Dilip M. (2004). S. Chandrasekhar : The Scholar Scientist. Rupa & co
- (4) Ramnath, Radhika, Ed. (2012) S. Chandrasekhar : Man of Science. Harper Collins Publishers India.

વિકૃતભાઈ અં. પટેલ
મો. ૯૪૨૮૦૧૯૦૪૨



Note 1: Chandrasekhara Iyer and Parvati had four more children who haven't been listed here.

ચક્ષુદાન એવે દર્શિદાન

ડૉ. મહિબાઈ અસ. પટેલ

આંખ એ પ્રાણી માત્રને ઈશ્વર તરફથી મળેલો અમૂಲ્ય ખજાનો છે. મૃત્યુ પામેલા મનુષ્યની આંખો આમ તો બિન ઉપયોગી છે; પરંતુ એ જ આંખો બે અંધ મનુષ્યને દર્શિ આપવા સમર્થ છે. બે આંખો બે અંધ વ્યક્તિને નવી દર્શિ આપી તેમના અંધકારમય જીવનને પ્રકાશિત કરે છે. જેણે ઊગતા સૂરજને જોયો નથી, પૂનમની ચાંદનીની શીતળતા નિહાળી નથી, બિલબિલાટ હસતાં નિર્દીષ બાળકના મુખડાને જોયું નથી, બગીચામાં ઊગતા રંગબેંગી પુષ્પોનું સૌંદર્ય માણયું નથી. તેને દ્વિવાં કેવી અપાર વેદના થતી હશે? આપણે કોઈ અંધજનને જોઈએ ત્યારે જ ખ્યાલ આવે કે આંખ કેટલી ઉપયોગી છે.

હેલન કેલરનો જન્મ ૨૭ જૂન, ૧૮૮૦ના રોજ અલાબામા ખાતે થયો હતો. તેમને ૧૮૮૭ માં સ્કારલેટ તાવ આવવાથી તેઓ બહેરાં, મુંગાં અને અંધ બન્યાં હતાં. તેમની માવજતને કારણે તેમનું મુંગાપણું દૂર થયું હતું. તેમણે વિચની સફરો જેડી, “સાઈટ કન્જર્વેશન તથા અંધત્વ નિવારણ” ના કાર્યક્રમ આપવા લાગ્યાં હતાં. આહારો ખાતે ભરાયેલા આંતરરાષ્ટ્રીય અધિવેશનમાં લાયન્સને “નેત્ર સુરક્ષા” ના કાર્યક્રમ તેમજ અંધજનનોની સહાયે આવવા અનુરોધ કર્યો. તેમણે કહ્યું - “હું તમારા માટે એક ઉમદા તક છું. જ્યારે અનેક તકો તમારી રાહ જોતી હોય ત્યારે તમારે જે પ્રિય તક હોય તે અપનાવશો. હું તમને સૌને સેવાની ભાવના માટે ઉસ્કૃષ્ટતા પૂરી પાડિશ.” તેઓના આ શબ્દોએ જાહુ કર્યો અને સર્વ લાયન્સ કલબોએ “સાઈટ કન્જર્વેશન” ને પ્રાથમિકતા આપી હતી અને અંધત્વ નિવારણના કાર્યક્રમો જુદીજુદી કલબો દ્વારા કરવામાં આવે છે.

આંખની રચના : આંખના ડોળામાં વર્ચે જે કાળો ભાગ દેખાય છે અને સામાન્યતઃ કીકી તરીકે ઓળખવામાં આવે છે તેનાં સૌથી ઉપરના ભાગને પારદર્શક પટલ અને કોર્નિયા (Cornea) કહેવામાં આવે છે. પ્રકાશનાં કિરણો કોર્નિયામાંથી પસાર થઈ આંખના અંદરના ભાગમાં પ્રવેશે છે. અને ત્યાં પડદા ઉપર તેનું પ્રતિબિંબ પડતાં વસ્તુ દર્શયમાન થાય છે. આ પારદર્શક પટલ (કોર્નિયા) આંખો પડે છે તો જાંખું દેખાય છે અને તે જો અપારદર્શક બને છે તો પ્રકાશનાં કિરણો આંખમાં પ્રવેશી શકતાં નથી અને વ્યક્તિ અંધ થાય છે/ગણાય છે.

અંધાપાનાં કારણે જુદાં જુદાં હોય છે. મોતિપાથી, નેત્રખીલથી, જામરથી, આંખની ઓફિચિયલ નસ સુકાઈ જવાથી, પડદો ફાટી જવાથી, આંખની અંદર આવેલ વીટ્રીએસ પ્રવાહી બગડી જવાથી અને પારદર્શક પટલ કે કોર્નિયા બગડી જવાથી અંધ થવાય છે. સમયસર કોર્નિયા બદલવાનું ઓપરેશન કરવાથી આવતો અંધાપો અટકાવી શકાય છે. અપારદર્શક કોર્નિયા દૂર કરી પારદર્શક કોર્નિયા બેસાડી દર્શિદાન આપી શકાય છે; પરંતુ આ પ્રકારના ઓપરેશનમાં નવો પારદર્શકપટલ યાને કોર્નિયાની જરૂર પડે છે અને આ કોર્નિયા માનવીનો જ જોઈએ અને તેથી માનવનેત્રની જરૂર પડે છે. માનવનેત્રનું દાન એટલે ચક્ષુદાન.

પારદર્શક પટલ (કોર્નિયા) બગડવા બાબત

સામાન્ય રીતે જેને આપણે કીકી કહીએ છીએ તે, પારદર્શક પટલ ઉપર વાગવાથી ઓફિચિયલ-આલ્કલી જેવા જલદ પદાર્થ પડવાથી, અક્સમાત થવાથી, વગેરે જેવા કારણોસાર પારદર્શકપટલ (કોર્નિયા) અપારદર્શક થાય છે. આ પ્રકારના અંધત્વનો ભોગ મોટા ભાગે જુવાનો-બાળકો થાય છે. જો સમયસરની સારવાર આપવામાં આવે અને જરૂરી ઓપરેશન કરવામાં આવે તો દર્શિદાન આપી શકાય છે.


અપારદર્શક બનેલ પારદર્શકપટલ (કોર્નિયા)ને દૂર કરી તેની જગ્યાએ તંદુરસ્ત પારદર્શકપટલ મૂકવાથી દસ્તિ મળે છે. આ કિયા બે રીતે કરવામાં આવે છે. તેને પેનિટ્રેટિંગ અને લેમેલર ગ્રાફિટિંગ કહેવામાં આવે છે.

પારદર્શકપટલ (કોર્નિયા) ક્યાંથી લાવવો ? ચક્ષુદાન

માનવી માટે માનવલોહી સિવાય બીજો વિકલ્પ નથી. તેવી જ રીતે કોર્નિયા અને બીજા તેવા પદાર્થો માટે માનવનેત્ર સિવાય બીજા કોઈ વિકલ્પ નથી. કૃતિમ રીતે કોર્નિયા બનતો નથી. જ્યારે વ્યક્તિનું અવસાન થાય ત્યારે મૃત વ્યક્તિની આંખો દાનમાં આપવાથી તે આંખનો સ્વચ્છ, તંદુરસ્ત કોર્નિયા કાની લઈ જીવંત અંધ વ્યક્તિનો બગડેલો કોર્નિયા દૂર કરી, ત્યાં બેસાડવાથી જીવંત વ્યક્તિ દસ્તિદાન મેળવે છે.

કોર્નિયાનો અંધાપો દૂર કરવાની રીત

કોર્નિયાનો આખો ભાગ સંપૂર્ણ જાડાઈ સુધી અપારદર્શક બને તો તેવો કોર્નિયા આખો કાઢી તેની જગ્યાએ નવો તંદુરસ્ત પારદર્શક કોર્નિયા મૂકવાથી દસ્તિ મળે છે. તે નીચેના ચિત્રથી સ્પષ્ટ થશે. આ પેનિટ્રેટિંગ ગ્રાફિટ તરીકે ઓળખાય છે.




આંખનો કોર્નિયા
અપારદર્શક થવાથી
મકાશના કિરણ
આંખમાં જતા નથી
આને આંધાપો આવે છે.

આ અપારદર્શક
કોર્નિયા હુર
કરવામાં આવે છે.

તે જગ્યાએ બીજો પાર-
દર્શક તંદુરસ્ત કોર્નિયા
બેસાડવાથી દસ્તિ મળે
છે.

કોર્નિયામાં જુદા જુદા કોષોના જુદાં જુદાં પડ આવેલા હોય છે. હવે જો કોર્નિયામાં પૂર્ણ જાડાઈ સુધી નહીં પરંતુ થોડા પડમાં અપારદર્શકતા હોય તો તેવો ભાગ દૂર કરી તેટલા ભાગમાં પારદર્શક કોર્નિયાનું પડ મૂકી દેવાથી દસ્તિ મળે છે. આને લેમેલર ગ્રાફિટ કહેવામાં આવે છે.




થોડા ભાગ-પડ
અપારદર્શક
થાય છે.

આંખની બગડેલ પડ
હુર કરવામાં આવે છે.

હુર કરેલ બગડેલ પડની
જગ્યાએ પારદર્શક પડ
બેસાડવાથી દસ્તિ મળે છે.

BEFORE

AFTER



કાર્નિયાના પ્રત્યારોપણથી નેત્રજ્યોતની પ્રાપ્તિ



એપ્પેશન અગ્રાઉની સ્થિતિ

કાર્નિયલ આઇડિંગ બાહની સ્થિતિ

ચક્ષુદાન લેવાની પદ્ધતિ

ચક્ષુબેંકને જાળ કરવાથી ડોક્ટર ચક્ષુદાન ત્યાં આવે છે. ચક્ષુદાન જીવંત વ્યક્તિને બેસાડવાના હોવાથી તબીબશાસના તમામ સૂચનો ધ્યાનમાં રાખવામાં આવે છે. આંખો લેવાનાં સાધનો-બોટલ વગેરે તમામ વસ્તુઓ ઓક્ટોક્લેવ-જંતુરહિત કરી રાખવામાં આવે છે અને ત્યાર બાદ તેનો ઉપયોગ કરવામાં આવે છે. આંખો કાઢતાં પહેલાં તેના ઉપર જંતુરહિત કરવા ઓન્ટિબાયોટિક દવા મૂકવામાં આવે છે. આંખના ડોળાને હાથથી સ્પર્શ ન થાય માટે પૂરતી કાળજી રાખવામાં આવે છે. ડોળાને કાળ્યા બાદ તેને કલેમ્પમાં મૂકી બોટલમાં મૂકવામાં આવે છે અને ફરીથી ઓન્ટિબાયોટિક દવા નાખવામાં આવે છે. જેથી આંખ ઉપર ચેપી જંતુરો ન લાગી જાય. આંખો લીધા બાદ તે જગ્યાએ રૂ મૂકીને પોપચાં બંધ કરવામાં આવે છે. જમજા અને ડાબા ડોળાને બે જુદી જુદી બોટલોમાં પેક કરીને તેના પર - અને ઠ નું નિશાન કરવામાં આવે છે. પેક કરેલ બોટલો બરફમાં ૪૦ સેન્ટીગ્રામાં રાખવામાં આવે છે. ત્યાર બાદ ચક્ષુબેંકને મોકલી આપવામાં આવે છે.

ચક્ષુદાનાની વિગત ભરવા માટે ફોર્મ

જેમાં (૧) ઉમર, (૨) મરણનું કારણ (૩) મરણનો સમય (૪) આંખ લેવાનો સમય (૫) ડોક્ટરનું નામ (૬) સંમતિ આપનારનું નામ તેમજ સરનામું (૭) ચક્ષુ પહોંચાડનાર સ્વયંસેવકનું નામ અને સરનામું.

ચક્ષુ મોકલવાની પદ્ધતિ

ચક્ષુદાનમાં મળેલ ચક્ષુઓ બસ, ટ્રેન, વિમાન માર્ગ મોકલવામાં આવે છે. ગુજરાતમાં ટ્રેન કે બસથી મોકલવામાં આવે છે. જેથી જલદી પહોંચાડી શકાય. બહારના રાજ્યમાં વિમાન માર્ગ મોકલવામાં આવે છે. ઠન્ડિયન એર લાઈન્સ વિના મૂલ્યે લઈ જાય છે. ગુજરાતમાં બસ દ્વારા મોકલવામાં આવતા ચક્ષુ વિનામૂલ્યે લઈ જવામાં આવે છે.

ચક્ષુદાન કોણ આપી શકે ?

- (૧) કોઈ પણ ઉમરની વ્યક્તિનું અવસાન થતા તેની આંખો દાનમાં આપી શકાય છે.
- (૨) કોઈ પણ રોગને કારણે કે આંખે મોતિયો હોય કે મોતિયાનું ઓપરેશન કરાવ્યું હોય, ચશમાં હોય, જામર હોય, પડદો ફણી જવાથી કે ડેણાની નસ સુકાઈ જવાથી અંધત્વ હોય પણ જો કોર્નિયા હોય તો ચક્ષુદાન અવશ્ય થઈ શકે છે.
- (૩) આંખો ઉપયોગમાં આવશે કે નહીં તેનો નિર્ણય જાતે ન લેશો. આ કામ ડોક્ટરનું છે. તેથી નિર્ણય તે લેશો. આપણી ફરજ ચક્ષુદાન આપવાની છે.

ચક્ષુદાન આપવા માટે શું કરવું ?

- (૧) સમય એ મહત્વનું અંગ છે. મરણ પછી આંખો સૂક્ષ્મજીવાણું બગાડે તે પહેલાં તેમજ કોર્નિયામાં ખરાબી થાય તે પહેલાં ચક્ષુ દાનમાં આપવા જરૂરી છે. ચક્ષુદાન વહેલામાં વહેલું કરાવો પરંતુ મૃત્યુબાદ ૬ થી ૮ કલાક સુધીમાં ચક્ષુ લઈ શકાય છે. તેને દવા તથા ઠડકમાં રાખવામાં આવે તો ૪૮ થી ૭૨ કલાક સુધી વાપરી શકાય છે.
- (૨) મૃત્યુદેહ હોય તે રૂમમાં પંખો બંધ રાખો. નહિતર આંખની ડીકી સુકાઈ જવા સંભવ છે.
- (૩) મૃત્યુદેહની આંખો બુલ્લી હોય તો બંધ કરો અને આંખ ઉપર ભીનો રૂમાલ કે રૂના પોતા મૂકવા. સ્વચ્છ વસ્તુનો ઉપયોગ કરો.
- (૪) ચક્ષુબંંકનો કે ડોક્ટરનો સંપર્ક જલ્દી કરો.
- (૫) ચક્ષુદાન લેવાની કિયા વખતે કોઈ પાસે ઉભા ન રહે.

ચક્ષુની વહેંચણી પદ્ધતિ


ચક્ષુદાનમાં મળેલ નેત્રોની વહેંચણીમાં ગુજરાતમાંથી આવેલી માંગણીને પ્રથમ પસંદગી આપવામાં આવે છે. ત્યારબાદ પહેલા અને વહેલાના ધોરણે વહેંચણી કરવામાં આવે છે. પરંતુ આંખો જરૂરવાળી હોસ્પિટલમાં મોકલતાં પહેલાં નીચેની હકીકતો ધ્યાનમાં લેવામાં આવે છે :

- (૧) મરણ અને આંખ લેવા દરમિયાન વીતેલો સમય.
- (૨) આંખ લેવાનો સમય અને જે તે સ્થળેથી મુખ્ય કેન્દ્ર ઉપર આવતાં લાગતો સમય.
- (૩) ચક્ષુની જરૂર છે ત્યાં મોકલવા માટે, વિમાન વાહન ક્યારે મળશે ?
- (૪) વાહનને જે તે સ્થળે પહોંચતાં કેટલો સમય લાગશે ?
- (૫) આંખોનું પારસ્પર જ્યાં અને જ્યારે પહોંચે ત્યાં/ત્યારે રવિવાર કે રજાનો દિવસ છે કે કેમ ? તેવા દિવસે આંખનું ઓપરેશન કરવાની સુવિધા છે કે કેમ ?
- (૬) માંગણી કરવામાં આવી છે ત્યાં અન્ય ડોક્ટર હશે કે કેમ ?
- (૭) આંખની સ્થિતિ

- (૮) મરણનું કારણ
 (૯) આંખ પહોંચાડવા સ્વયંસેવકની ઉપલબ્ધિ.

ચક્ષુદાનમાં મળેલ આંખનો વિવિધ ઉપયોગ

ચક્ષુદાન



(૧) જે અંધ વ્યક્તિને પ્રત્યારોપણ કરેલ હોય છે. તેની વિગત આપવામાં આવતી નથી. (૨) ડાયાબિટીસ કે કમળો કાનિયાને ખરાબ કરતા નથી. આંખનું કેન્સર હોય તો જ ચક્ષુદાન નથી લેવામાં આવતું. (૩) અંધ વ્યક્તિએ નજીકના આંખના રોગોના નિષ્ણાંત ડોક્ટરને બતાવીને નક્કી કરશે કે તેને કીસી બદલવાથી દસ્તિ મળશે કે કેમ?

ભારત દેશમાં હાલ ૫૨૪ જેટલી નેત્રબેંકો છે. દરેક નેત્રબેંકના પ્રયત્નોથી દર વર્ષે ૧૭ થી ૨૦ હજાર નેત્રદાન મળે છે. ૨૫ થી ૩૦ હજાર નેત્રદાનની તો દર વર્ષે ૧૫ હજાર જેટલા દસ્તિહીન (અંધ) વ્યક્તિઓનો વધારો થાય છે.

અન્ય માહિતી

- (૧) તમામ ધર્મોએ સેવા પ્રવૃત્તિને અનુમોદન આપેલ છે.
- (૨) ચક્ષુદાતાને કોઈ પણ ખર્ચ થતો નથી. તમામ ખર્ચ ચક્ષુબેંક ભોગવે છે.
- (૩) આખો ડોગનો. ઉપયોગ થતો નથી. પણ આંખમાં જે ભાગની જરૂર હોય તે વપરાય છે.
- (૪) ચક્ષુદાન માટે ત થી ૪ કલાકમાં અપાવતાં સારી દસ્તિ મળે છે. પ્રત્યારોહણ ૭૨ કલાક સુધીમાં થાય તે જરૂરી છે. તેને ૪ સે.માં સાચવવી જરૂરી છે.
- (૫) યોગ્ય સંજોગોમાં સાચી રીતે ઓપરેશન થાય અને દર્દીની શારીરિક સ્થિતિ સારી હોય તો આવા ઓપરેશનનો ૮૦૮૯ સફળ થાય છે.
- (૬) કોનિયા બેસાડવાથી સંપૂર્ણ અંધ વ્યક્તિ ખરેખર દેખતી બને છે.
- (૭) પ્રચાર તંત્ર : ચક્ષુદાતાનું નામ, સહમતિ આપનારનું નામ વગેરે માહિતી લોકલ ન્યૂઝ્લેપરમાં તેમજ સમાચાર પત્રોમાં માહિતી આપવામાં આવે છે. પત્રિકાઓની વહેંચાણી કરવાથી સમાજમાં જાણ થાય છે.

ડૉ. આનંદ પટેલ
 મો. ૮૪૨૬૭૬૨૮૭૫

ડૉ. મહિબાઈ એસ. પટેલ
 મંત્રીશ્રી, સર્વ વિદ્યાલય કેળવણી મંડળ, કડી
 મંત્રીશ્રી, શ્રી કડવા પાટીદાર કેળવણી ઉતેજક મંડળ, કડી
 મો. ૮૪૨૭૫૪૭૬૨૭

ચક્ષુદાન થકી દર્શિદાનજા પુરસ્કર્ત્રો

ડૉ. મહિભાઈ એસ. પટેલ

મહિભાઈ પ્રજાપતિ

વ્યવસાયે ઉનિસ્ટ, પરંતુ પ્રકૃતિએ સેવાપરાયણ જીવ હોઈ ચક્ષુદાન મેળવી દર્શિદાન આપવાની અનોખી પ્રવૃત્તિમાં પોતાની જતને સ્વેચ્છાએ સમર્પિત કરનાર ડૉ. મહિભાઈ એસ. પટેલ અને સવિશેષતઃ કદીનું એક ગૌરવશિખર છે. અલબત્ત, આ ઉમદા સેવાકીય પ્રવૃત્તિમાં તેમના નાનાભાઈ ડૉ. બાબુભાઈ પટેલ (હાલ, અમેરિકા), ઉનિસ્ટ પુત્ર ડૉ. આનંદ પટેલ અને ડૉ. મહિભાઈ પટેલ શ્રીમતી શારદાબહેન પટેલ પોતાની આગામી કોઈસૂઝી સર્જિકલ સાધનોને સ્ટરીલાઇઝ કરવાનું જ્ઞાન સંપાદન કરીને હોશે હોશે સહયોગ પૂરો પાડનારાં તેમનાં ધર્મપત્ની શ્રીમતી શારદાબહેન એમ. પટેલનો પણ સરાહનીય સહયોગ રહ્યો છે. આ ચારેય મૂર્ખી ઊચેરાં વ્યક્તિત્વો માનવીય ફરજના ભાગ તરીકે આપણા આર્થિકથી ‘શ્રીમદ્ભગવદ્ગીતા’ ને અભિપ્રેત એવા ‘નિષ્ઠામ કર્મયોગ’ની ભાવનાથી પ્રેરાઈને સેવાકર્તી બની રહ્યાં છે અને તે પણ પ્રસન્નતા સાથે ‘હું’ કે ‘અમે’ની ગ્રંથિને વિગલિત કરીને. ડૉક્ટરસાહેબને જોતાં જ પેલું સુખ્યાત સુભાષિત માનસપટલ ઉપર તાજું થઈ આવે તેવું તેમનું વ્યક્તિત્વ છે :

વદાં પ્રસાદસદાં સદયં હૃદયં સુધામુચ્યો વાચઃ ।
કરણં પરોપકરણં યેણાં કેણાં ન તે વન્દ્યઃ ॥
(જેમનું મુખ પ્રસન્નતાનું ઘર છે, હૃદય દ્યાથી ભરેલું છે, વાણી અમૃતરસ વરસાવનારી છે અને કાર્ય પરોપકાર કરનારાં છે, તેવા સજજન પુરુષો કોને માટે વંદનીય



ડૉ. બાબુભાઈ પટેલ



ડૉ. આનંદ પટેલ

નથી ?) અર્થાતું સૌ કોઈને માટે વંદનીય બની રહે છે.

માનવજીવન માટે આશીર્વાદત્વમક એવી એક સર્વશ્રેષ્ઠ ચક્ષુદાન થકી દર્શિદાન પ્રવૃત્તિની પ્રેરણા કોના દારા મળી તે સંદર્ભે પૃચ્છા કરતાં તેમણે સ્વયં આ લખનારને જણાવ્યું હતું કે :

‘ગાંધીજીવાદી વિચાર

સરણીજીવાદી શ્રી પ્રહલાદભાઈ ચેલદાસ પટેલની બાજુમાં મારા નાનાભાઈ ડૉ. બાબુભાઈ પટેલ રહેતા હતા. (હાલ અમેરિકા). તેઓ હંમેશાં

અમને કહેતા કે, મારા મૃત્યુ પછી મારાં ચક્ષુઓની રાખ થવી ના જોઈએ. તમારે ચક્ષુદાનની વ્યવસ્થા કરવાની રહેશે. તેમના મૃત્યુ પછી મેં મહેસ્યાજી જેસીસના મારા મિત્રોને ફોન કરીને બોલાવડાવીને તેમનાં ચક્ષુ લેવરાયાં

હતાં. આ પ્રેરણાથી તા. ૨૫-૧૦-૮૫ના રોજ ભાગ્યોદ્ય જનરલ હોસ્પિટલ ખાતે તે સમયના આરોગ્ય મંત્રીશ્રી વલલભભાઈ પટેલના હસ્તે ચક્ષુબેંકનું ઉદ્ઘાટન કરવેલ. હું તેમજ ડૉ. બાબુભાઈ ચક્ષુઓ લેવા જતા. અમદાવાદ ખાતે ચક્ષુઓ પહોંચાડવાની જવાબદારી નિભાવતા હતા. ચક્ષુઓ મેળવ્યાં પછી સર્જિકલ સાધનોને મારાં ધર્મપત્ની શારદાબહેન સ્ટરીલાઇઝ કરવાની જવાબદારી નિભાવી રહેલ છે. તેમણે ચક્ષુદાન પહોંચાડવાની જવાબદારી ઘણી વાર નિભાવી છે. ચક્ષુદાનની સેવાકીય પ્રવૃત્તિ બદલ ડૉ. બાબુભાઈનું હૈદરાબાદ ખાતે સન્માન કરવામાં આવ્યું હતું. અમે ત્રણેય વ્યવસાયે ડૉક્ટર હોવા છિતાં સમય કાઢીને ચક્ષુઓ લેવાં જતાં હવે, મારો પુત્ર

ડૉ. આનંદ પટેલ ચક્ષુઓ લેવાની જવાબદારી નિભાવી રહ્યો છે. અમોએ અત્યાર સુધીમાં લગભગ ૧૫૦ જેટલી ચક્ષુઓની જોડી અમદાવાદ ખાતે મોકલી છે. આ ચક્ષુદાન થકી કરી અને કરી આસપાસનાં ૧૦ જેટલાં વ્યક્તિઓને દસ્તિદાન પ્રાપ્ત થયું છે. ચક્ષુદાનની પ્રેરણાના પ્રખર હિમાયતી શ્રી ગૌતમભાઈ મજુમદારને અમારાં શત્રુ શત્રુ વંદન. ગૌતમભાઈ મજુમદારે જણાવેલ કે, મારી જાણ મુજબ આ પરિવારના ડોક્ટરોએ સ્વયં પોતાનાં માતાપિતાનાં ચક્ષુઓ લીધાં હોય તેવો પ્રથમ કિસ્સો છે.”

શ્રી ગૌતમભાઈ કોણ છે? અને તેમનું આ ક્ષેત્રે શું પ્રદાન છે તે સંબંધી જિલ્લાશાખાવ્યક્ત કરતાં તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “વ્યવસાયે વકીલ એવા શ્રી ગૌતમભાઈએ ચક્ષુદાનના ક્ષેત્રમાં સિંહકાળો કહી શકાય તેવું અદ્ભુત કાર્ય કર્યું છે. તેઓશ્રી છેલ્લા પચાસ વર્ષથી આ કાર્યક્ષેત્ર સાથે જોડાયેલા છે. અને લગભગ ૧ લાખ જેટલી આઈ ડોનેશન પ્રક્રિયામાં પોતે નિમિત્ત બન્યા છે. તેઓશ્રીએ ૧૯૬૫માં અમદાવાદ જિલ્લાના ઘોળકા ખાતેથી ગ્રામ્ય કક્ષાએ ચક્ષુદાનની પ્રવૃત્તિ શરૂ કરી હતી. અને ત્યાર બાદ તેમણે “આઈ બેંક”નું સ્થાપક પદ તેમજ પ્રમુખપદ શોભાવ્યું છે. હાલમાં આ સંસ્થા સાથે સમગ્ર ગુજરાતમાં ૮૬ જેટલા ચક્ષુદાન કેન્દ્રો જોડાયેલાં છે. આઈ બેંકની ઔદ્ઘિક્સ એસ. જી. હાઈવે પર સોલા બિજની બાજુમાં કાર્યરત છે. તેઓને ચક્ષુદાન મળ્યા બાદ તરત જ પત્રથી જાણ કરે છે. તેમજ જરૂરી સલાહ-સૂચન કરે છે. નાનામાં નાની જરૂરી નોંધ પણ મૂકે છે. અમને પ્રોત્સાહિત કરવામાં તેમનો મુખ્ય ફાળો રહ્યો છે.” ડૉ. મણિભાઈ પટેલનો નિખાલસત્તાપૂર્વકનો આ એકરાર હંદ્યસપર્શી બની રહે છે.

અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે ‘જન કલ્યાણ સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ’ (રાજકોટ) દ્વારા તેના વર્ષ ૨૦૨૦-૨૧ના પાંચમા વાર્ષિક અહેવાલમાં ચક્ષુદાન પ્રવૃત્તિ સાથે સંકાળયેલા ગુજરાતના ઉદ્દેશીલોની સાથે જ ડૉ. મણિભાઈ એસ. પટેલનાં કાર્યોની નોંધ લેવામાં આવી છે. આ સાથે જ નોંધ લેવી રહી કે ‘સર્વ વિશ્વવિદ્યાલય વૃત્તના આ અંકના પૃ. નં. ૨૮-૩૨ ઉપર પ્રકાશિત તેમનો લેખ ‘ચક્ષુદાન દ્વારા દસ્તિદાન’ તેમની સ્વાધ્યાયશીલતાનો ધોતક બની રહે છે.

ચક્ષુદાન પ્રવૃત્તિ ઉપરાંત લાયન્સ કલબ, કરી

શાખામાં કલબનો ધ્યેયમંત્ર ‘We Serve’ ને mission “To empower volunteers to serve their communities, meet humanitarian needs, encourage peace and promote international understanding.” ખરાર્થમાં આત્મસાંત કરીને વર્ષ ૧૯૭૧ થી આજપર્યત તેના ચાર્ટડ મેમ્બર તરીકે જોડાયેલા રહીને તેની પરિપૂર્તિ કરવા માટે હાથ ધરવામાં આવેલા પ્રોજેક્ટ્સનું સફળતાપૂર્વક નિર્વહણ કરવામાં સૌસત્યોની સાથે ડૉ. મણિભાઈ પટેલનો ફાળો પણ અસાધારણ રહ્યો છે. આ હેતુ તેઓશ્રી સમયદાન અને આર્થિક સહયોગમાં પણ સદાય અગ્રેસર રહેતા આવ્યા છે. તેમણે આ કલબના સભ્ય ઉપરાંત મંત્રી (૧૯૭૪-૭૫ થી ૧૯૭૫-૭૬), પ્રમુખ (૧૯૮૦-૮૧), ઝેન ચેરમેન (૧૯૮૪-૮૫), ડિસ્ટ્રીક્ટ ચેરમેન : ચાઈલ્ડ એન્ડ ફેમિલી વેલ્ફર (૧૯૮૫-૮૬), હિસરીગ એન્ડ સ્પીઝ થેરાપી એન્ડ વકર્સ વીથ ડેફ (૧૯૮૬-૮૭), લાયન્સ કલબ સંચાલિત ચક્ષુબેંકના ચેરમેન વગેરે હોકાઓ ઉપર પ્રશસ્ય સેવાઓ આપી છે. આ બધા સમયગાળા દરમિયાન શિયાળામાં ગરીબોને ધાબળા ઓફાડવાની પ્રવૃત્તિ, વૃક્ષારોપણ, રોગનિદાન કેમ્પ, કેન્સર કેમ્પ, બાળતંદુરસ્ત હરીકાઈ, મોતિયાબિંદુ આપરેશન, વર્ષ ૧૯૭૮માં અતિવૃષ્ટિના કારણે કરી તાલુકામાં થયેલ ભારે તારાજીના કારણે જરૂરતમંદોને આવશ્યકતાનુસાર આવશ્યક સહાય પહોંચાડવાની કામગીરી, ચક્ષુદાન, ભૂખ્યાજનોને ભોજન વગેરે સેવાકાર્યોમાં તેમનાં હૌવનસહજ ઉત્સાહ અને કાર્યનિષ્ઠા દખ્યા બની રહેતાં પ્રત્યક્ષ સેવાકાર્યો ઉપરાંત કલબ દ્વારા આયોજિત રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સોમાં કંઈક નવું જ્ઞાન મેળવવાની તાલાવેલી સાથે તેમની ઉપસ્થિતિ રહી છે. તાજેતરના વર્ષ ૨૦૧૮-૧૯ માં તેમણે ઇટાલીના મિલાનમાં યોજાયેલ ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં હાજરી આપી હતી. તેમની વિશિષ્ટ કામગીરી અને સક્રિયતાને ધ્યાન લેતાં લાયન ડિસ્ટ્રીક્ટ તરફ/બી/ર દ્વારા કેટલાક અવોડસથી તેમને અલંકૃત કરવામાં આવ્યા છે, જેમ કે ૧૦૦% હાજરી : ૧૯૮૧-૮૮, સેકેટરી મેમ્બરશિપ એચિવમેન્ટ મેડલ, ઓક્ટોબર મેમ્બરશિપ ગ્રોથ અવોર્ડ, શેવરોન અવોર્ડ (૧૦ વર્ષ તથા ૧૫ વર્ષના સભ્યપદ માટે), ઝેન ચેરમેન (૧૯૮૪-૮૫) વગેરે વિશેષ

ઉલ્લેખનીય છે.

આવા ગરવાપુરુષ ડૉ. મણિભાઈ પટેલનું વતનનું ગામ લાણવા (તા ચાણસ્મા, જિ પાટણ) છે, જ્યાં કૃષક પરિવારમાં તેમનો જન્મ તા. ૨૬ સપ્ટેમ્બર, ૧૯૪૭ના રોજ થયો હતો. જોકે તેમના કેટલીક પેઢીઓ પૂર્વના વડવાઓ ચાણસ્મામાંથી સ્થળાંતર કરીને લાણવામાં સ્થાયી થયા છે. માતા : અમથીબા અને પિતા : શીવરામભાઈ અમીંદાસ પટેલ. પિતાશ્રી સરકારી પ્રાથમિક શાળાના શિક્ષક હતા. તેમણે શિક્ષક તરીકેની કારકિર્દી દરમિયાન કુંડળ, મેરાંઆદરજ, મીઠાધરવા, ગોરાદ અને વતન લાણવામાં શિક્ષક / આચાર્ય તરીકે સેવાઓ આપી હતી. તેમનું અવસાન તા. ૩૧ જુલાઈ, ૧૯૮૮ના રોજ થયું હતું. એક કર્મઠ, વિદ્યાર્થીવત્સલ અને શિસ્તના આગ્રહી શિક્ષક તરીકે આજે પણ ત્યાંના ગ્રામજનો તેમના શિક્ષકત્વની વંદના કરતાં સાંભળવા મળે છે. લાણવા ગામના વીર શહીદ ત્રિભોવનદાસ પટેલને ઉચ્ચ કેળવણી માટે પ્રોત્સાહિત કરનારા શિક્ષકો પૈકીના તેઓશ્રી એક હતા. તેમના પરિવારમાં સુપુત્રો સ્વદાહ્યભાઈ (અવસાન ૨૦૨૧), ડૉ. મણિભાઈ (૧૯૪૩), અને ડૉ. બાબુભાઈ (૧૯૪૭) છે. ડૉ. મણિભાઈ પટેલનાં ધર્મપત્ની શ્રીમતી શારદાબહેન કે જેઓશ્રી સર્વ વિદ્યાલય, કડીના એક નીવડેલા શિક્ષક - વ્યાયામ શિક્ષક સ્વચ્છતુરભાઈ પટેલનાં સુપુત્રી છે. તેમના પરિવારમાં બે પુત્રીઓ ૧ શ્રી દિપીબહેન (બી ફાર્મ), ૨ શ્રી મેલાબહેન (બી ઇ સિવિલ) અને પુત્ર ડૉ. આનંદ (બી. ડી. એસ.) છે. તેમના સ્વતંત્ર ક્રિલિનિકનું ઉદ્ઘાટન શ્રી મારોકલાલ અને મ પટેલસાહેબ દ્વારા તા. ૨ માર્ચ, ૧૯૮૮ના રોજ કરવામાં આવ્યું હતું. ડૉ. આનંદનાં પત્ની ડૉ. અલકા પટેલ પણ ડેન્ટિસ્ટ છે અને પોતાના પતિ સાથે કડીમાં વર્ષ ૧૯૮૮ થી. ડેન્ટલ ક્રિલિનિકમાં સહયોગ આપી રહ્યા છે. આ દંપતીની પુત્રી દિયા મનીપાલ યુનિવર્સિટીમાં કમ્પ્યુટર એન્જિનિયરિંગના તૃતીય વર્ષમાં અભ્યાસ કરી રહી છે.

શ્રી મણિભાઈના બાળમિત્રોમાં શ્રી અનિલભાઈ પટેલ (જાણીતા ઉદ્યોગપતિ અને ગણપત યુનિવર્સિટી, જેરવા - મહેસાણાના આર્ટ્ફીએ સ્થાપક પ્રેસિડન્ટ), પ્રો. મણિભાઈ પટેલ વગેરે સમાવિષ્ટ છે. તેમણે વતનમાંથી પ્રાથમિક શિક્ષણ મેળવ્યા બાદ ધીણોજની હાઈસ્ક્લાસમાંથી ધોરણ ૧૦ સુધીનો અભ્યાસ કર્યો હતો. આ અભ્યાસ

દરમિયાન હિન્દી ભાષા-સાહિત્યમાં વિશેષ રસ- રુચિના કારણે 'રાષ્ટ્રભાષા કોવિદ'ની પરીક્ષા પ્રથમ પ્રયત્ને જ પાસ કરી દીધી હતી ત્યાર બાદ ઉત્તર ગુજરાતના જ્યાતિપ્રાપ્ત શિક્ષણધામ સર્વ વિદ્યાલય અને તેના કેળવણીવિદ્ય આચાર્યશ્રી નાથાભાઈ દેસાઈસાહેબ અને મોહનભાઈ પટેલસાહેબ વગેરે પ્રતિભાશીલ શિક્ષકોની કીર્તિથી પ્રભાવિત થતાં અને પિતાશ્રીનું પ્રોત્સાહન સાંપડતાં. સર્વ વિદ્યાલયમાં પ્રવેશ મેળવી મેટ્રિકનો અભ્યાસ સંપન્ન કર્યો વલ્લભવિદ્યાનગરની વી. પી. સાયન્સ કોલેજમાં પ્ર. યુનિવર્સિટી સાયન્સમાં અભ્યાસ દરમિયાન પોતાના મિત્રો શ્રી અનિલભાઈ અને શ્રી ચંદુભાઈ બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલયમાં અભ્યાસ કરતા હોઈ તેમની સાથે વિશેષ નિકટતા સંધાઈ હતી. આ પછી પ્રથમ વર્ષ બી. એસ્સી.નો અભ્યાસ પાટણની પી. કે. કોટાવાળ આર્ટ્સ અને શેઠ એમ. એન. સાયન્સ કોલેજમાંથી પૂર્ણ કર્યા બાદ સરકારી ડેન્ટલ કોલેજ, અમદાવાદમાં પ્રવેશ મેળવી વર્ષ ૧૯૬૭-૬૮ માં બી. ડી. એસ. ની ડિગ્રી મેળવી હતી. ડેન્ટલના અભ્યાસ દરમિયાન કોલેજના ડિન ડૉ. એ એમ મલાવવાળાના પ્રીતિપાત્ર વિદ્યાર્થી બની રહ્યા હતા. આ ગુરુ-શિષ્યના હુંકાળા સંબંધોની સુવાસ ઉદ્ઘાટનસ્વરૂપ બની રહી હતી.

તેમણે : બી. ડી. એસ. ની ડિગ્રી મેળવ્યા બાદ માતૃસંસ્થામાં 'ક્રિલિનિકલ આસિસ્ટન્ટ' તરીકે માસિક રૂ. ૪૦૦/- ના પગારથી વ્યવસાયિક કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો. અહીં ડેન્ટલ અધ્યાપક / ડેન્ટલ ડાફ્ટર તરીકેની પ્રોજેક્શની વિપુલ શક્યતાએ રહી હોવા છતાં સ્વતંત્ર વ્યવસાય કરવાની હોશ તેમજ ડેન્ટલ ડોક્ટર તરીકે પોતાની આગામી ઓળખ ઊભી કરવાની જ્વાહિશાના કારણે ફક્ત ૬ માસ સુધી અમદાવાદની સરકારી ડેન્ટલ કોલેજમાં 'ક્રિલિનિકલ આસિસ્ટન્ટ' તરીકે સેવાઓ આપ્યા બાદ સ્વેચ્છાએ છૂટા થયા. પોતાનું ક્રિલિનિક મહેસાણામાં કે કડીમાં શરૂ કરવું તે અવફવ વચ્ચે શ્રી ચંતુરભાઈ સાહેબ (સર્વ વિદ્યાલયમાં અભ્યાસ દરમિયાના પોતાના શિક્ષક અને સમયાન્તરે શારદાબહેન સાથે લગ્નગ્રંથીથી જોડાતાં શ્વસુરશ્રી)ના કડી સાથેના સુદીધકાલીન સંબંધો તેમજ સાહેબની દીર્ઘાને આત્મસાત કરીને કડીમાં ક્રિલિનિક શરૂ કરવાનો નિર્ણય કરતાં તેમના ક્રિલિનિકનું ઉદ્ઘાટન કડી

નગરપાલિકાના તત્કાલીન પ્રમુખ શ્રી બાબુભાઈ ધનાભાઈ પટેલના વરદહસ્તે અને ડૉ. ગોપાળભાઈ પટેલ (સર્જન, અમદાવાદ), ડૉ. રામભાઈ પટેલ, ડૉ. માણેકલાલ સી. પટેલ, શ્રી નટવરલાલ (ભાજાભાઈ) પટેલ, શ્રી માણેકલાલસાહેબ વગેરેની ઉપસ્થિતિમાં તા. ૨૮ નવેમ્બર, ૧૯૯૮ના રોજ કરવામાં આવ્યું હતું. એક તજશ દંતચિકિત્સક અને ડોક્ટર તરીકેના માનવીય સંવેદનશીલ સ્વભાવના કારણે ખૂબ જ ટૂંકાગળામાં મૂઢી ઊચેરા દંતચિકિત્સક તરીકે ખ્યાતિ પામ્યા. તેમણે પોતાની ફરજની મૂલવણી કદાપિ પૈસા સાથે કરી નથી. જેમાં શિક્ષકપિતાનો સંસ્કારવારસો સ્પષ્ટ દાખિયોચર થાય છે. ગીતાના આપ્તવચન ‘કર્મજીવેવાધિકારસ્તે મા ફ્લેશ્યુ કદાચનન્યાં શ્રદ્ધા રાખીને તેઓશ્રી કર્તવ્યપાલન કરતા રહ્યા છે. પરિણામે, સારાં કાર્યાનું ફળ તેમને પ્રાપ્ત થતું જ રહ્યું છે. આર્થિક રીતે પગભર થવાની સાથે જ ઉદારયેતા હદયે લોકવ્યવહાર પણ કરતા રહ્યા છે. વ્યક્તિત્વાની દર્દીઓ, જરૂરતમંદો ઉપરાંત સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓને વખતોવખત આર્થિક સહયોગ પણ આપતા રહે છે.

નેન્ટલ પ્રેક્ટિસની સાથે જ વ્યવસાયિક અનુબંધ જાળવી રાખવા માટે નેન્ટલ એસોસિએશનનું સભ્યપદ સ્વીકારીને એસોસિએશન દ્વારા આયોજિત વાર્ષિક અધિવેશનોમાં ઉપસ્થિત રહેવાનું મુનાસિબ ગણીને તેમણે ‘ઈન્ડિયન નેન્ટલ એસોસિએશન’ દ્વારા બેંલોર, પુના, દિલ્હી, અમૃતસર, લુધીયાણા, અમદાવાદ વગેરે સ્થળોએ આયોજિત કોન્ફરન્સોમાં હાજરી આપી છે. પરિણામે તેઓશ્રી પોતાના વિષયકેત્રના અદ્યતન સંશોધનોથી અવગત રહ્યા છે. ડૉ. મણિભાઈ પટેલ તેમની વ્યવસાયિક કારકિર્દીના પ્રારંભિક દશકમાં જ મહેસાણા નેન્ટલ એસોસિએશનના પ્રમુખ (૧૯૭૮), ગુજરાત સેટ નેન્ટલ એસોસિએશનના વાઈસ પ્રેસિડેન્ટ (૧૯૭૯) અને ગુજરાત સેટ નેન્ટલ એસોસિએશનના ઓનરરી ટ્રેઝરર (૧૯૮૦) તરીકે યાદગાર સેવાઓ આપી છે. ગુજરાત સેટ નેન્ટલ એસોસિએશનની વાર્ષિક કોન્ફરન્સ મહેસાણા ખાતે તેમના પ્રમુખપદે તા. ત ડિસેમ્બર, ૧૯૭૮ના રોજ આયોજિત કરવામાં આવી હતી, જેનું ઉદ્ઘાટન ગુજરાત વિધાનસભાના તત્કાલીન સ્પીકર શ્રી કુંદનલાલ ધોળકીયા અને મહેસાણા જિલ્લા

પંચાયતના પ્રમુખ અને અગ્રાહી ગાંધીવાદી કાર્યકર શ્રી રીખવદાસ શાહના સંનિધ્યમાં કરવામાં આવ્યું હતું. આ કોન્ફરન્સ તેમાં રજુ થયેલાં સંશોધકીય અભિગમ સાથેનાં અભ્યાસપૂર્ણ શોધપત્રો અને તેના સુનિયોજિત આયોજના કારણે સ્વરાશીય બની રહી છે.

વ્યવસાયિક ફરજોનું પ્રતિબદ્ધતાપૂર્વક પાલન કરવા ઉપરાંત સમાજજીવનની કેટલીક સંસ્થાઓ સાથેનો તેમનો નાતો અસાધારણ રહ્યો છે. આ પૈકી સર્વ વિદ્યાલયના એક ભૂતપૂર્વ તેજસ્વી વિદ્યાર્થી તરીકે માતૃસંસ્થાનું ઝડ્ઝ ચૂકવવાની પ્રપત્તિભાવપૂર્વકની શ્રદ્ધા-ભક્તિથી પ્રેરાઈને વર્ષ ૧૯૮૬-૮૭ થી કડવા પાટીદાર કેળવણી ઉતેજક મંડળ, કડીના મંત્રીશ્રી અને વર્ષ ૨૦૦૭-૦૮થી સર્વ વિદ્યાલય કેળવણી મંડળ, કડીના મંત્રીશ્રી તરીકે અને ખાસ તો માનવજીવનના ઉદ્વિતર વિકાસ માટે ગુણવત્તાશીલ શિક્ષણનું મહત્વ્ય આત્મસાત કરીને પોતાની સક્રિય સેવાઓ આપી રહ્યા છે. આ મંડળના વિકાસ માટે પ્રારંભમાં સ્વ ધનાભાઈ વડીલ, સ્વ માણેકલાલ સાહેબ અને સ્વ ડૉ. રામભાઈ સાહેબ સાથે અને હવે ડૉ. કનુભાઈ પટેલ, શ્રી વલ્લભભાઈ પટેલ વગેરે સાથે મનસા-વાચા-કર્મશાશી જોડાયેલા રહે છે. મંડળ આયોજિત બેદકો કે વિવિધ સંસ્થાઓ દ્વારા આયોજિત કાર્યક્રમોમાં તેમની ઉપસ્થિતિ અને પ્રસંગોપાત્રના ઔપચારિક આભારદર્શનમાં તેમનાં જાગરૂકતા અને અત્યાસ ધ્યાનાર્હ બની રહેતાં અનુભવાય છે. કોરોનાકાળથી વ્યવસાયિક સેવાઓમાંથી નિવૃત્તિ લઈને મંડળને પૂર્ણતઃ સમર્પિત બની રહી પોતાની સેવાઓ આપી રહ્યા છે. આ મંડળ ઉપરાંત કડી સ્થિત ચોર્યાંસી સમાજના સ્થાપક પ્રમુખ, પોલિસી હોલ્ડર કાઉન્સિલ મેમ્બર - અમદાવાદ ડિવિઝન (૧૯૮૬-૮૭), શ્રી કડી નાગરિક સહકારી બેંકના ૧૭ વર્ષ સુધી ડિરેક્ટર વગેરે પછો ઉપર પણ સેવાઓ આપી ચૂક્યા છે. વધુમાં, તેમણે દૂર્દર્શન દ્વારા તા. ૨૫-૮-૨૦૦૭ ના રોજ ‘વિકાસપથ’ અને તા. ૨૭-૨-૨૦૦૮ ના રોજ ‘સામાજિક ન્યાય’ વિષય પર આયોજિત ચર્ચાઓમાં ભાગ લીધો હતો. હવે તો સર્વ વિદ્યાલયનો વિકાસ એ જ તેમનું લક્ષ્ય રહ્યું હોઈ તેને સમર્પિત બની રહ્યા છે. ‘લાયન્સ કલબ ઓફ કડી’ દ્વારા પ્રકાશિત ‘લાયન્સ ન્યૂઝ’ના પ્રથમ અંક ૧૯૮૮-૮૯ માં કલબના પાસ્ટ

પ્રેસિડેન્ટ તરીકે તેમણે આપેલ ઈન્ટરવ્યૂ અંતર્ગત તેમને પૂછ્યામાં આવેલ પાંચેક પ્રશ્નો - એક સફળ વહીવટકર્તા, ડોક્ટર અને કેળવણીકાર, લાયન્સ કલબ અને પોતે, યુવાપેઢી, લાયન્સ કલબ જેવી સામાજિક સંસ્થાને સંદેશ વગેરે સંદર્ભે તેમને આપેલા ટૂંક છ્ટાં પ્રભાવક પ્રત્યુત્તરોમાં તેમનાં વાંચનપીતિ, અભ્યાસનિષ્ઠા અને સમાજજીવનના પ્રશ્નો/પ્રવાહોથી જાગુકતાના ધોતક બની રહે છે. આ અંતર્ગત યુવાપેઢીને આપેલ સંદેશ : “આજની યુવા પેઢીના યુવાનો આવતી કાલના નાગરિકો છે. જેમના હાથમાં સમાજ તેમજ દેશનું સુકાન આવવાનું છે. જો યુવાન ભૌતિક સુખ પાછળ પડી જશે તો તેના જીવનમાં વિકાસ અટકી જશે. તેમનું ભાવિ અંધકારમય બની જશે. દેશને સારા અને જાગૃત નાગરિકોની ખૂબ જરૂર છે. જો યુવાન માનસિક તેમજ શારીરિક રીતે તંદુરસ્ત હશે તો સમાજ પણ તંદુરસ્ત બનશે. યુવાનોમાં દેશપ્રેમ જાગે તે ખૂબ જરૂરી છે. જો દેશ પ્રત્યેની મમતા જાગશે તો યુવાનો સમાજ તેમજ દેશ માટે કંઈક કરશે. હાલમાં જો યુવાન કુટેવોમાં સપાડાઈ જશે તો તેનું ભાવિ નિરાશાજનક બની જશે એટલે

યુવાનોએ વ્યસનો, ઝુંસ તથા માદક દ્વયોથી દૂર રહેવું જોઈએ તેમજ એઠદસ્ત જેવા રોગના શિકાર ના બને તે માટે જાગૃતિ કેળવવી પડશે યુવાનોમાં મને સવિશેષ શ્રદ્ધા છે. યુવાનો ભાવનાશીલ, કર્તવ્યશીલ અને સેવાભાવી હોય છે. પરિણામે યુવાશક્તિનો રચનાત્મક ઉપયોગ કરવા માટે યુવાનોને પ્રોત્સાહિત કરવા પડશે. યુવાનોની ટીકા, ટિપ્પણીથી તેમનામાં નકારાત્મક વલશ કેળવાય છે, પણ તેમનામાં શ્રદ્ધા રાખવાથી તેઓ સવિશેષ શક્તિનો સ્તોત્ર બનીને કામમાં જોડાય છે.” યુવાજગત માટે સુપથ્યકારક બની રહે તેટલો સંતર્પક હોઈ અંકે કરવા જેવો છે.

સર્વ વિદ્યાલયના ભૂતપૂર્વ તેજસ્વી વિદ્યાર્થી અને સર્વ વિદ્યાલય કેળવણી મંડળ, કડી તથા કડવા પાટીદાર કેળવણી ઉત્તેજક મંડળ, કડીના મંત્રીશ્રી એવા ડૉ. મણિભાઈ એસ. પટેલ અને તેમના પરિવાર દ્વારા શરૂ કરવામાં આવેલી ચક્ષુદાન મેળવવાની પ્રવૃત્તિ માટે સર્વ વિદ્યાલય પરિવાર ગર્વની લાગણી અનુભવવાની સાથે હાર્દિક અભિનંદન પાડવે છે.

- મણિભાઈ પ્રજાપતિ

ગ્રંથસૌરભ

મહિનાભાઈ પ્રજાપતિ

મહિષિવિદવ્યાસપ્રણીતાં શ્રીમદ્ભાગવતમહાપુરાણમ્ :
શ્રીધરીટીકા એવં ગુજરાતીવ્યાખ્યાસહિતમ્ /
અનુવાદિકાઃ વૈદેહી પાર્શ્વવક્ષુમાર અધ્યારુ. ગોરખપુરઃ
ગીતાપ્રેભ, વિ સં ૨૦૭૫. ૫ ખંડ (૪૮૪૨ પૃ. + ૪૦
આર્ટ પ્લેટ્સ). ગીતાપ્રેસ પ્રકાશન ક્રમાંક ૨૧૫૬ –
૨૧૬૦. ક્રિ. શ. ૧૭૫૦

આપણાં પુરાણો ભારતીય ધર્મ-દર્શન-ઇતિહાસ-ભૂગોળ-સમાજજીવન-સંરક્ષિત વગેરેની સામગ્રી માટે કાચા સોનાની ખાણ સમાન છે. પુરાણો પાંચમો વેદ (શ્રીમદ્ભાગવત ૧. ૪. ૨૦, છાંદોગ્યોપનિષદ ૭.૧૧ વગેરે) ગણવામાં આવે છે. આ પુરાણો પૈકી ‘શ્રીમદ્ભાગવતમહાપુરાણ’ તો શાન અને ભક્તિનું

મહિમાગાન કરતું મહાકાવ્ય છે, જેનો ભારે મોટો મહિમા ખૂદ ભાગવતપુરાણ ઉપરાંત અન્ય પુરાણો વગેરેમાં કે લોકોક્તિઓમાં ગાવામાં આવ્યો છે, જેમકે ‘નિગમકલ્પતરોગરીલિતં ફલં’ = વેદરૂપી કલ્પવૃક્ષનું પરિપક્વણ (ભા. પુ. ૧. ૧. ૩), ‘વાઙ્મયી મૂતિઃ’ (પદ્મ પુ. ઉત્તરખંડ ૩. ૬૨), ‘વેદોપનિષદાં સારાજ્ઞાતા ભાગવતી કથા’ – શ્રીમદ્ભાગવતની કથા વેદ, ઉપનિષદોના ગૂઢ સારરૂપે પ્રગટ થઈ છે (પદ્મ પુ. ઉત્તરખંડ ૨. ૬૭), ‘સર્વ વેદાન્તસાર’, ‘વિદ્યાવત્તામ્ ભાગવતે પરીક્ષા’ = વિવિધ વિદ્યાઓ જાળનારાઓની પરીક્ષા ભાગવતમાં થઈ જાય છે, ‘વિદ્યા ભાગવતાવધિઃ’ = વિદ્યાની પૂર્ણતાની કસોરી ભાગવતમાં થાય છે, મહાપ્રલુ વલ્લભાચાર્યજી ભાગવતને વ્યાસની ‘સમાધિભાષા’ ગણાવે છે, વગેરે.

આ ઉપરાંત આધુનિકયુગીન વિદ્વાનો કૃષ્ણશંકર શાસ્ત્રી, આચાર્ય બલદેવ ઉપાધ્યાય, ડૉ. જગન્નાથ શાસ્ત્રી તેલંગ, ડૉ. બ્રહ્માનંદ ત્રિપાઠી, વગેરેએ પણ આ પુરાણની સર્વોચ્ચતા ચીધી આપી છે. જેમ કે ડૉ. જગન્નાથ શાસ્ત્રી તેલંગે સ્પષ્ટ શબ્દોમાં પોતાનું મંતવ્ય નોંધ્યું છે કે “ભાગવત અપની દાર્શનિકતા અને વ્યાપક ધાર્મિકતા કે કારણ સચમુચ પુરાણતિલક હૈ... નિશ્ચય હી સમસ્ત પુરાણ એક તરફ ઔર શ્રીમદ્ભાગવત એક તરફ ઐસા કહા જા સકતા હૈ। ઈસલિયે સમ્પૂર્ણ પુરાણ વાડમ્ય મેં ઈસકા સ્થાન સર્વોપરિ હૈ, ઈસમે લેશમાત્ર ભી સન્દેહ નહીં હૈ” જ્યારે તેની આંતરિક સમૃદ્ધિ ઉજાગર કરતાં ડૉ. લક્ષ્મેશ જોશોએ જગ્યાવ્યું છે કે, “ભાગવતનાં પદ્યોમાં અર્થનું ગંભીર્ય કે ઊંડાશ અને વૈવિધ્ય અપાર છે. નિરૂપિત આત્મા વિશેનું ગળન તત્ત્વજ્ઞાન, શાંકરેદાન્તના કેટલાક મહત્વના સિદ્ધાન્તો સાથે ભાગવતનું સુસ્પષ્ટ સામ્ય, જ્ઞાન અને ભક્તિના માહાત્મ્યનું ગંભીર છતાં પ્રસાદગુણપૂર્ણ શૈલીમાં નિરૂપણ વગેરે વિશે વિચારતાં જગ્યાય છે કે ભાગવતનો મહિમા ગાઈએ તેટલો ઓછો છે.” આ મહાપુરાણ નું ૧૨ સ્કન્ધોમાં વિભાજિત છે, જેની શ્લોકસંખ્યા ૧૮૦૦૦ છે.

આવા વિશાળ અને તત્ત્વચિંતનથી સભર-સમૃદ્ધ ‘મહાભાગવતપુરાણ’નો ગુજરાતી અનુવાદ ‘સ્વાત્નઃસુખય તુલસી રખુનાથગાથા’ની ભાવના હેઠે ધરીને શ્રીમતી વૈદેહીબહેન સુલભ કરાવી આપ્યો છે. આ પૂર્વે આ પુરાણના ગુજરાતી અનુવાદો/ભાવાનુવાદો સસ્તુ સાહિત્ય, મહાદેવ રામચન્દ્ર, નવજીવન (ગોપાળદાસ જીવાભાઈ પટેલ) વગેરે દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યા છે, પરંતુ સંશોધકીય અભિગમ અને અધ્યયનનિષ્ઠાથી કરવામાં આવેલો આ શબ્દશ: અનુવાદ તેની કેટલીક આગવી ખાસિયતોના કારણે તેમજ અનુવાદિકાની ઉદાહરણસ્વરૂપ કૃતસંકલ્ય સાતત્યપૂર્ણ સુદીર્ઘકાલીન તપ્યું અનુવાદ માટે અને સાથે સાથે સવિશેષતા: અનુવાદકો માટે માર્ગસૂચક દીપસ્તંબ બની રહે છે

અહીં ભાગવતનો સંસ્કૃત પાઠ અને તેની સાથે તેના ઉપરની શ્રીધરસ્વામી (૧૩૦૦ – ૧૩૫૦)ની ‘ભાવાર્થદીપિકા’ – ‘શ્રીધરીટીકા’નો સંસ્કૃત પાઠ કમશા: પ્રથમ કોલમમાં અને તેની સામે તેનો ગુજરાતી અનુવાદ

આપવામાં આવ્યો છે. ભાગવતનો પાઠ અને તેના ઉપરની ટીકાનો પાઠ તેમજ પ્રચેકનો સંબંધિત ગુજરાતી અનુવાદ અલગ તીપસી આવે તે રીતે ફોન્ટની પસંદગી કરવામાં આવી છે, જે સંબંધી સૂચના પ્રથમ સ્કર્નના પ્રારંભમાં નોંધ સ્વરૂપે આપી છે, જે વિશેષ ધ્યાનાર્હ બની રહે છે. ભાગવત ઉપર અનેક ટીકાઓ રચવામાં આવી છે. શ્રી કૃષ્ણશંકર શાસ્ત્રી (શ્રી ભાગવત વિદ્યાપીઠ, સોલા, અમદાવાદ) દ્વારા સંપાદિત ‘શ્રીમદ્ભાગવત’માં ૧૩૫ વ્યાખ્યાઓ સમાવિષ્ટ છે. આ બધી વ્યાખ્યાઓ વચ્ચે ભાગવતના અનુવાદ સાથે તેના ઉપરની ‘શ્રીધરીટીકા’નો અનુવાદ શા માટે ? શું પ્રાચીનતમ જ્ઞાત ટીકા છે એટલા માટે પસંદગી ? આ સંદર્ભે અનુવાદિકાનું સ્વાધ્યાયપૂર્ત મંતવ્ય: “શ્રીધર સ્વામી ભગવાન વેદવ્યાસજ્ઞની અમોઘ પદબોધશક્તિને આત્મસાત કરી, એને અનુભૂતિનો પુટ આપી ગૂઢ રહેસ્યોને ઉદ્ઘાટિત કરે છે. અપૂર્વ આત્મપ્રબોધ, અદ્ભુત આત્મપ્રસાદ અને અદ્વૈતનો અવબોધ કરાવતી આ ટીકા વિશાદ, ભક્તિસભર વિવેચન ધરાવે છે. પરમનો સ્વર્ણ પામેલી પારાશર્ય વેદવ્યાસજ્ઞની વાડી અવબોધની એવી અવિત્યકા પર વિલસે છે, કે શ્રીધરજ્ઞની વ્યાખ્યાની સરણી શિવાય ત્યાં પહોંચવું અધ્યરું છે.” સુસ્પષ્ટ પ્રત્યુત્તર મળી રહે છે. આ સાથે જ ‘ભાગવત’ અને ‘શ્રીધરી’ના મર્મને પામવા માટે – તેના અંતઃસત્ત્વને ઉજાગર કરવા માટે ‘શ્રીધરી’ ઉપર વંશીધરજ્ઞ કૃત ‘ભાવાર્થદીપિકા-પ્રકાશ’ અર્થાત્ વંશીધરી નો અનુવાદિકાએ ભરપૂર સહારો લેવાની સાથે જ ભાગવત ઉપરની અન્ય નાની-મોટી ૧૮ જેટલી ટીકાઓનો વત્તાઓછા અંશે સહારો લીધો છે. પ્રસ્તુત ગ્રંથના પાંચેય ખંડોનાં ૫૦૦૦ પૃષ્ઠોનું વિહુંગદિષ્ટાએ અવલોકન કરતાં જગ્યાવ્યું છે કે સૌથી વધુ ‘વંશીધરી’ ૪૫૦ વખત (કવચિત્) એક શ્લોકમાં બે વાર ‘વંશીધરી’ કાળા ઘાટા અક્ષરોમાં નોંધ કરી છે (તે સહિત) અને ત્યાર બાદ ‘સુબોધિની’ – ૬૦, ‘બાલપ્રબોધિની’ – ૬૦, ‘અન્નિતાર્થપ્રકાશિકા’ – ૭૦, ‘દીપિની’ – ૫૦ વગેરે ૧૮ ટીકાઓ આશરે કુલ મળીને ૮૫૦ થી અધિક વખત ઉદ્ઘૂત કરીને વેદવ્યાસ અને શ્રીધરને અભિપ્રેત અર્થ પ્રસ્તુત કરવા વિનમ્ર પ્રયાસ કર્યો છે. ભાગવતના ૧૨ સ્કન્ધોના કુલ ૧૮૦૦૦ શ્લોકો ઉપર શ્રીધરસ્વામીએ ટીકા રચી છે કે કેમ તે સંદર્ભે

તપાસ કરતાં જાણવા મળ્યું છે. કુલ ૧૨૫૦ જેટલા શ્લોકો ઉપર શ્રીધર સ્વામીએ શ્રીધરી ટીકા રચી નથી. ૧૨ સ્કન્ધીય પૈકી દ્વિતીય સ્કન્ધના ફક્ત ર શ્લોકો (૨. ૪. ૮, અને ૨. ૭. ૫૮) ઉપર અને સૌથી વધુ ૧૦મા સ્કન્ધના ૪૮૦ જેટલા શ્લોકો ઉપર ‘શ્રીધરી’ જોવા મળી નથી અનુવાદિકાએ ‘વંશીધરીનો’ સૌથી વધુ સહારો તૃતીય સ્કન્ધમાં આશરે ૧૩૦ વખત અને સૌથી ઓછો ૧૨મા સ્કન્ધમાં ફક્ત ત વખત અને દ્વિતીય સ્કન્ધમાં ૮ વખત લીધો છે. એકાદ કિસ્સામાં ‘શ્રીધરી’ (૭. ૩. ૧૭) નથી ત્યાં ‘વંશીધરી’ જોવા મળી છે. અહીં ઉપયોગમાં લેવામાં આવેલી ટીકાઓનું અવલોકન કરતાં જોવા મળે છે કે અનુવાદિકાએ જ્યાં ‘શ્રીધરીટીકા’ નથી ત્યાં કવચિત્ ભાગવતના તે પાઠને સમજાવવા માટે અન્ય ટીકાઓનો સહારો લીધો છે, ઉદા તરીકે જુઓ ૩. ૨૩. ૨, ૭. ૫. ૪૦ વગેરે. આ ઉપરાંત જ્યાં ‘શ્રીધરી’ અને ‘વંશીધરી’ છે ત્યાં અથવા ‘વંશીધરી’ નથી ત્યાં આવશ્યકતા પિણાણીને અન્ય એકથી અધિક ટીકાઓ ઉદ્ઘૃત કરીને પાઠના હાંદને વધુ સ્પષ્ટતા સાથે ઉજાગર કરી આપ્યું છે, ઉદા. તરીકે જુઓ ૩. ૫. ૧૪, ૪. ૭. ૨૭, ૭. ૫. ૩૮, ૮. ૧. ૧૮, ૧૦. ૨૧. ૧૮ વગેરે. આ સાથે જ ક્ષેપક શ્લોકોની-ભાગવતમાં કે કોઈ ટીકામાં અમુક શ્લોક છે કે કોઈ કોઈ પ્રતોમાં તે શ્લોક નથી તેની - કાળજીપૂર્વક નોંધ લીધી છે, ઉદા તરીકે જુઓ ૭. ૪. ૨૩ (“ત્રૈવીસમા શ્લોક પછી આ એક શ્લોક અધિક છે તેમ વીર રાઘવજી અને વિજયધરજી માને છે”), ૧૦. ૨૨. ૩૧ (“આ શ્લોકની ટીકા ૨૪૪ કરતા શ્લોક શ્રીધરી ટીકાના કેટલાક પાઠોમાં નથી”), ૧૦. ૩૦. ૩૧ (“આ પછીનો શ્લોક સર્વત્ર નથી પૂજ્ય સ્વામી ચરણો દ્વારા તેનો સમાવેશ કરવામાં આવ્યો નથી”) વગેરે. ખાસ ધ્યાનાર્હ તો એ બની રહે છે કે અનુવાદિકાએ કવચિત્ શ્રીધરસ્વામીની ટીકા અને અન્ય ટીકાકારોનાં દસ્તિબિદ્ધને તુલનાત્મક પરિચ્યમાં પ્રસ્તુત કરવા પ્રયાસ કર્યો છે, જેમ કે, (“શ્રીધર સ્વામીએ ‘યઘષિ થી ઇત્યવિરોધઃ’” ૧ જે કહ્યું છે તેની સામે અન્ય અભિપ્રાય પડા પં વંશીધરજી, પં ગંગાસહાયજી (અન્તિર્તાર્થ), જીવગોસ્વામીજી (ક્રમસન્દર્ભ), વિશ્વનાથ ચક્રવર્તીજી (સારાર્થદિર્શિની), ગોસ્વામી ગિરિધરલાલ (બાલપ્રબોધિની), ભગવત્પ્રસાદચાર્ય (ભક્ત મનોરંજની) એ વ્યક્ત કર્યો છે

તે વિષયમાં બ્રહ્મવૈવર્ત પુરાણની શ્રીશુકટેવજીની કથા ઉદ્ઘૃત કરી છે ‘૮. ૨૧. ૨૫). આ સાથે એ પણ તાદ્દશ થયું છે કે ‘શ્રીધરી’ સહિતના ટીકાકારો/વ્યાખ્યાકારો દ્વારા પોતપોતાનાં દસ્તિબિદ્ધના સમર્થનમાં શ્રુતિ અને સ્મૃતિના આધારે વિવિધ ઝોતો જેમ કે, વેદો, ઉપનિષદો, શ્રીમદ્ભગવદ્ગીતા, પુરાણો, સ્મૃતિઓ, દાર્શનિક ગ્રંથો વગેરે બહુવિધ ઝોતોનાં ઘણાં મંત્રવ્યો કવચિત્ અપવાદો બાદ કરતાં પ્રાય: મૂળઝોતના નામ-નિર્દેશ સિવાય ઉદ્ઘૃત કર્યા છે. આ પૈકી ૮૦૦ જેટલાં અવતરણોના મૂળઝોતો અનુવાદિકાએ ૧૦૦ થી અધિક કૃતિઓ જેમ કે ‘શ્રીમદ્ભગવત’ – ૨૨૦, ‘અવેતાઅવેતરોપનિષદ’ – ૧૦૦, ‘શ્રીમદ્ભગવદ્ગીતા’ – ૮૦, ‘બૃહદારણ્યક ઉપનિષદ’ – ૫૬, ‘વેદો’ – ૪૦ વગેરેમાંથી શોધીને તેનો ચોક્કસ સ્થાનનિર્દેશ દર્શાવ્યો છે. આ સાથે જ કોઈ ઝોતના નામ-નિર્દેશ સિવાયનાં પડા ઘણાં અવતરણો જોવા મળ્યા છે, જેમ કે ખંડ-૧. ૭૧૧, ૮૮૩, ખંડ-૨. ૫૦૪, ખંડ-૩ ૧૬૪, ૧૮૨, ખંડ-૪. ૮૮૧, ખંડ-૫. ૮૧, ૮૩ વગેરે.

ભાગવતના જે શ્લોકો સૂત્રાત્મક શૈલીમાં છે ત્યાં તેમજ આવશ્યકતાનુસાર અન્ય શ્લોકના અનુવાદમાં ક્રોસમાં પરાપૂર્વનો સંબંધ પ્રસ્થાપિત કરી આપતી પૂર્તિઓનું પ્રસંગોપાત્ત ઉમેરણ કરીને સ્પષ્ટ અર્થબોધ કરી આપવામાં આવ્યો છે, જેમ કે, “જે મનુષ્ય વાનપ્રસ્થાત્રમના ધર્મચયરણમાં બ્રહ્મવિચારમાં” સમર્થ હોય, તે આ પ્રમાણે (પોતાના આત્માનું અદ્વિતીયરૂપે) અનસંધાન કરીને માત્ર દેહ શેષ રહે તેમ (બાકીનું બધું છોડીને) સંન્યાસ ધારણ કરીને (વિષયોથી) અપોક્ષારહિત થઈ (પ્રત્યેક) ગામમાં એક જ રાત્રિ ગાળવાના નિયમથી પૃથ્વી ઉપર વિચરણ કરે ૭. ૧૩. ૧).” આ પ્રકારના ઉમેરણવાળા અનુવાદો અત્રતત્ત્વ દર્શયમાન થાય છે. આ સાથે જ પ્રત્યેક શ્લોકની ‘શ્રીધરીટીકા’ના અનુવાદમાં ટીકાના કેટલાક મહત્વપૂર્ણ શબ્દોને કણા ઘાય અક્ષરોમાં મુદ્રિત કરીને તેની સામે પ્રત્યેકનો અર્થ આપીને અનુવાદ આપવામાં આવ્યો હોવાથી જિજ્ઞાસુઓ સંસ્કૃત ભાષાથી પણ સુપરિચિત થઈ શકે છે. આ અનુવાદ કાર્યની સાથે સાથે જે શ્લોકો કે ટીકામાં પાણિનીય વ્યક્તરણની દસ્તિએ દોષ જોવા મળ્યા છે. અથવા આર્થ પ્રયોગ છે ત્યાં અંગુલિનિર્દેશ કરીને તેનું

સાચું સ્વરૂપ પણ જણાવ્યું છે, ઉદા. તરીકે ૧. ૧. ૧૨ શ્લોકમાં ‘સાત્ત્વ’ શબ્દ લઈને ખ બ વ નું રૂપ ‘સાત્ત્વતામુ’ આપેલું છે, પાણિનીય વ્યક્તરણ પ્રમાણે અહીં ‘સાત્ત્વતાનામુ’ શબ્દ હોવો જોઈએ; ૭. ૮. ૩૩ : “પ્રોત્સર્પત” - પ્ર + ઉત્ + સર્પત અહીં અસર્પત રૂપ થાય. અ નો અભાવ આર્થ છે પ્રોદસર્પત રૂપ થવું જોઈએ; ૩. ૮. ૨૭ : સુશ્વરા રૂપમાં ‘ઉવ’ (આગમ) નો લોપ થયો છે તેથી આર્થ પ્રયોગ છે અહીં ‘સુશ્વરા’ હોવું જોઈએ વગેરે. વધુમાં, ભાગવતના શ્લોકોમાં પ્રયોજયેલ વિવિધ છંદો, જેમ કે વસંતતિલકા, શાર્ડુતવિક્રિદિત, કન્કમંજરી (ઉર્ફ રાજહંસી, ઠંડિરા કે લલિત), નર્કટક, માતિની, શાલિની, અનુષ્ટુપ વગેરે ૧૪૩ જેટલા શ્લોકોમાં ઓળખી બતાવ્યા છે. આ બધા છંદો પૈકી અહીં સૌથી વધુ અર્થાત્ ૫૬ વખત વસંતતિલકા પ્રયોજેલ જોવા મળ્યો છે. આ છંદોની ઓળખ કરાવતાં જ્યાં વ્યક્તરણ દીખને વહોરીને પણ છંદના નિયમનું રખાણ કરવામાં આવ્યું છે તે પણ ઉજાગર કરી આપવામાં આવ્યું છે. ઉદા. તરીકે ૭. ૫. ૫૪માં ‘અનુષ્ટુપ છંદના આઠ અક્ષર રાજવા માટે ‘સોપહૃત્ત’: સંધિ કરી છે, અન્યથા નવ અક્ષર થાય. જો શ્લોકના પાદની પૂર્તિ થતી હોય તો સંના વિસર્ગનો લોપ થઈ જાય છે; ૨. ૭. ૧૦ : ‘સામાન્યતઃ દેવી શબ્દ સંસ્કૃતમાં, સમાસમાં અને સર્વત્ર દીર્ઘ જ હોય છે અહીં વસંતતિલકા છંદને અનુલક્ષીને ‘સુદેવિ’ ઝડ્સ્વ કરેલ છે’ વગેરે.

ભાગવતના કે ટીકાઓના પાઠમાં જોવા મળેલ પાઠભેદ, ભાગવતના શ્લોકોમાં વેદનો પ્રભાવ, પ્રક્ષિપ્ત શ્લોકો, પ્રયોજવામાં આવેલાં કેટલાંક પદોના સ્પષ્ટીકરણ વગેરે હેતુ આ પાંચેય બંડોમાં ૧૧૦ થી અધિક પાદટીપો આપવામાં આવી છે. સ્પષ્ટીકરણ હેતુની નોંધો પણ સાધાર આપવામાં આવી છે. પાઠ નિર્ધારણ માટે આવશ્યકતાનુસાર ડૉ. હરિપ્રસાદ શાસ્ત્રી વગેરે દ્વારા સંપાદિત અને ભો. જે. વિવાભવન દ્વારા પ્રકાશિત ભાગવતની ચિકિત્સક આવૃત્તિ (૧૯૮૬-૨૦૦૨), કૃષ્ણશંકર શાસ્ત્રી દ્વારા સંપાદિત ભાગવત (૧૯૬૫-) વગેરેનો સાધાર ઉલ્લેખ કર્યો છે. આ સંબંધી કેટલાંક ઉદાહરણો જોઈએ : ૮. ૮. ૨૩ : અહીં શ્રીધરજીનો ઉપલબ્ધ પાઠ ‘નિજૈકાશ્રયતા’ છે. વંશીધરજીની ટીકામાં પાઠાંતર ‘નિજૈકાશ્રયતા’ હોવો જોઈએ. જોકે ભાગવત વિવાપીઠ (સોલા)-ની આવૃત્તિમાં અને અન્ય પાઠોમાં પણ ‘નિજૈકાશ્રયતયા’ પાઠ જ પ્રાપ્ત થાય છે; ૮. ૧૮ થી ૪૨ સુધીના શ્લોકોમાં ઝગવેદ અંતર્ગત ઐતરેય આરાધ્યકના મંત્રોનો પ્રભાવ હોવો વગેરે બાબતોના નિર્દેશોમાં અનુવાદિકાનાં સંશોધકીય અભિગમ, સ્વાધ્યાયનિષ્ઠા અને કર્મદ વિવાકીય પુરુષાર્થનાં દર્શન થાય છે અને આ સાથે આ કાર્યમાં મહિલાનાથી સૂત્ર નામૂલં લિખ્યતે કિચિંત નાનોપ્રકાશિતમુચ્ચતોનું પથાર્થમાં પાલન પણ કરતાં જોવા મળ્યાં છે. વિશુદ્ધ અંતરેણા અને સ્વાધ્યાયનિષ્ઠાથી કરવામાં આવેલ આ અનુવાદનો અક્ષરશાઃ પાઠ પંડિતપ્રવર ડૉ. લક્ષ્મેશ જોશોની તાવણીમાંથી પસાર થયેલો હોઈ પરિજ્ઞત અને પ્રવાહી બની રહે તે સ્વાભાવિક છે. અનુવાદિકા દ્વારા અંતિમ બંડ પાંચમાના અંતમાં (પ્ર. ૭૪૧-૮૪૬) ભાગવતના શ્લોકોની અકારાદિકમાં આપવામાં આવેલી સૂચિ સ્તુત્ય બની રહે છે. આમ છતાં, આટલી ગુણરાશિ વચ્ચે નિર્દેશ કરવો રહ્યો કે ભાગવત અને શ્રીધરિટીકાનો તેમજ પ્રસંગોપાત્ત વંશીધરી અને અન્ય ૧૮ જેટલી ટીકાઓ ઉદ્ઘૃત કરવામાં આવી છે. આ તમામ કૃતિઓનો પાઠ કયા સંસ્કરણ / મુદ્રિત ગ્રંથ / હસ્તપ્રતના આધારે લેવામાં આવ્યો છે તેનો ક્યાંય ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. સંશોધકો માટે આ માહિતી બૂબ જ મહત્વપૂર્ણ હોવા છતાં તેનો અભાવ વર્તાય્યે છે. આ ઉપરાંત અહીં વિવિધ વાખ્યાકારો દ્વારા ઉદ્ઘૃત કરવામાં આવેલાં અવતરણોના મૂળભૂતની શાસ્ત્રીય સૂચિ ઉપકારક બની રહેત, તેનો પણ અહીં અભાવ છે, જોકે પાંચમા બંડના પ્રારંભમાં સંકેતાક્ષર સૂચિ આપવામાં આવી છે; પરંતુ અહીં કેટલીક કૃતિઓનાં સંપૂર્ણ શીખકો જે તે સંદર્ભ સાથે નોંધવામાં આવ્યા છે, ઉદા. તરીકે વૈષ્ણવનંહિની’, ‘અમરકોશા’, ‘નિરુક્ત’ વગેરે પરિણામે તે શીર્ષકો સંકેતાક્ષરીમાં સમાવેશ પામી શક્યાં નથી, તેથી આ સંકેતાક્ષરસૂચિ દ્વારા ઉદ્ઘૃત કરેલાં તમામ જ્યોતોનાં નામો મળી શકતાં નથી અને છેલ્લે અનુવાદિકા આ કાર્યને ‘ભગવત્ત્રીત્યર્થે’નું સમજ્યાં હોઈ પોતાના સંપર્કસૂત્રનો નિર્દેશ કરવામાં પણ અનાસકત રહ્યાં છે.

પ્રસ્તુત ગ્રંથના પદેપદનો અનુવાદ તપાસનાર વંશીધરજીનું પાઠાંતર જોતાં મૂળપાઠ ‘નિજૈકાશ્રયતા’ હોવો જોઈએ. જોકે ભાગવત વિવાપીઠ (સોલા)-ની આવૃત્તિમાં અને અન્ય પાઠોમાં પણ ‘નિજૈકાશ્રયતયા’ પાઠ જ પ્રાપ્ત થાય છે; ૮. ૧૮ થી ૪૨ સુધીના શ્લોકોમાં ઝગવેદ અંતર્ગત ઐતરેય આરાધ્યકના મંત્રોનો પ્રભાવ હોવો વગેરે બાબતોના નિર્દેશોમાં અનુવાદિકાનાં સંશોધકીય અભિગમ, સ્વાધ્યાયનિષ્ઠા અને કર્મદ વિવાકીય પુરુષાર્થનાં દર્શન થાય છે અને આ સાથે આ કાર્યમાં મહિલાનાથી સૂત્ર નામૂલં લિખ્યતે કિચિંત નાનોપ્રકાશિતમુચ્ચતોનું પથાર્થમાં પાલન પણ કરતાં જોવા મળ્યાં છે. વિશુદ્ધ અંતરેણા અને સ્વાધ્યાયનિષ્ઠાથી કરવામાં આવેલ આ અનુવાદનો અક્ષરશાઃ પાઠ પંડિતપ્રવર ડૉ. લક્ષ્મેશ જોશોની તાવણીમાંથી પસાર થયેલો હોઈ પરિજ્ઞત અને પ્રવાહી બની રહે તે સ્વાભાવિક છે. અનુવાદિકા દ્વારા અંતિમ બંડ પાંચમાના અંતમાં (પ્ર. ૭૪૧-૮૪૬) ભાગવતના શ્લોકોની અકારાદિકમાં આપવામાં આવેલી સૂચિ સ્તુત્ય બની રહે છે. આમ છતાં, આટલી ગુણરાશિ વચ્ચે નિર્દેશ કરવો રહ્યો કે ભાગવત અને શ્રીધરિટીકાનો તેમજ પ્રસંગોપાત્ત વંશીધરી અને અન્ય ૧૮ જેટલી ટીકાઓ ઉદ્ઘૃત કરવામાં આવી છે. આ તમામ કૃતિઓનો પાઠ કયા સંસ્કરણ / મુદ્રિત ગ્રંથ / હસ્તપ્રતના આધારે લેવામાં આવ્યો છે તેનો ક્યાંય ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. સંશોધકો માટે આ માહિતી બૂબ જ મહત્વપૂર્ણ હોવા છતાં તેનો અભાવ વર્તાય્યે છે. આ ઉપરાંત અહીં વિવિધ વાખ્યાકારો દ્વારા ઉદ્ઘૃત કરવામાં આવેલાં અવતરણોના મૂળભૂતની શાસ્ત્રીય સૂચિ ઉપકારક બની રહેત, તેનો પણ અહીં અભાવ છે, જોકે પાંચમા બંડના પ્રારંભમાં સંકેતાક્ષર સૂચિ આપવામાં આવી છે; પરંતુ અહીં કેટલીક કૃતિઓનાં સંપૂર્ણ શીખકો જે તે સંદર્ભ સાથે નોંધવામાં આવ્યા છે, ઉદા. તરીકે વૈષ્ણવનંહિની’, ‘અમરકોશા’, ‘નિરુક્ત’ વગેરે પરિણામે તે શીર્ષકો સંકેતાક્ષરીમાં સમાવેશ પામી શક્યાં નથી, તેથી આ સંકેતાક્ષરસૂચિ દ્વારા ઉદ્ઘૃત કરેલાં તમામ જ્યોતોનાં નામો મળી શકતાં નથી અને છેલ્લે અનુવાદિકા આ કાર્યને ‘ભગવત્ત્રીત્યર્થે’નું સમજ્યાં હોઈ પોતાના સંપર્કસૂત્રનો નિર્દેશ કરવામાં પણ અનાસકત રહ્યાં છે.

પ્રસ્તુત ગ્રંથના પદેપદનો અનુવાદ તપાસનાર

અનુવાદિકાના ગુરુ ડૉ. લક્ષ્મેશ જોશી એ આ અનુવાદને આવકારતાં ‘પ્રસ્તાવના’માં નોંધીલ શબ્દો : “શ્રીમદ્ભાગવતનો અને ભારતમાં સર્વપથમ કરવામાં આવેલો શ્રીધરીટીકાનો સરળ અને સુભોધ આ અનુવાદ ગુજરાતના ભાગવતના મર્મજિજ્ઞાસુઓને તથા પાઠશાળાઓમાં, કોલેજોમાં અને યુનિવર્સિટીઓમાં પુરાણશાસ્ત્ર ભજાતા વિદ્યાર્થીઓને અત્યંત ઉપયોગી થરો એવી અમને શ્રદ્ધા છે. માત્ર આ અનુવાદ જ નથી; પરંતુ અનુવાદની સાથે ભાગવતના અને શ્રીધરીટીકાના શુદ્ધ પાઠનું સંપાદન, વ્યાકરણ, અલંકાર, છન્દો વગેરે વિશેની નોંધો, સંશોધનાત્મક પાઠીપો વગેરે પણ હોવાને કારણે આ અનુવાદ યુનિવર્સિટીઓમાં થતા સંશોધનની કક્ષાનું કાર્ય બની રહે છે.” અનુવાદની ઉચ્ચતમ ગુણવત્તાના પરિચાયક બની રહે છે

સંસ્કૃત સાહિત્યમાં ગૂર્જર મહિલાઓના પ્રદાન સંદર્ભે વિવિધ ઝોતોનું અવલોકન કરતાં માલૂમ પડ્યું છે કે જે ગૂર્જર મહિલાઓ જેમ કે એસ્તર સોલોમન, હંસાબહેન ડિડોચા, નીલાંજના શાહ, ભારતી શૈલત, જશવંતી દેવ વગેરે સંસ્કૃત અધ્યાપન ક્ષેત્રે કાર્યરત રહી છે તેમનું સંસ્કૃત અધ્યાપન-સંશોધન-પ્રકાશન અને પ્રચાર-પ્રસાર ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન રહ્યું છે; પરંતુ જે ગૂર્જર મહિલાઓનો સંસ્કૃત અધ્યાપન સાથે સંબંધ રહ્યો નથી કે જેમણે સંસ્કૃતનો ઔપચારિક અભ્યાસ પણ કર્યો નથી, છતાંય સંસ્કૃત ક્ષેત્રે સીમાચિહ્નનુંપ્ર પ્રદાન કર્યું હોય તે વર્ગની અર્થાત્ બિનઅધ્યાપકીય પરંપરાની ગૂર્જર મહિલાઓમાં શ્રીમતી વૈદેહીબહેનનું સ્થાન ‘પુરા કવિનાં ગણનાપ્રસંગે અનામિકા સાર્વત્રી બ્લેન્ચ’ સમાન જણાયું છે. આ સંદર્ભે નોંધવું રહ્યું કે વૈદેહીબહેન (૧૯૮૮) અર્થશાસ્ત્ર વિશ્યમાં સ્નાતક સુધીનું શિક્ષણ મેળવીને પોતાની ગૃહસ્થી સંભાળી રહ્યાં છે. આ દરમ્યાન કોઈ દેવયોગે અંતરેશાસ્ત્રાથી કે શ્રીમદ્ ભગવદ્ગીતાને અભિપ્રેત એવો પોતાનો ‘યોગબ્રજીજી’ જાગ્રત થતાં શ્રીમદ્ભાગવતનો અભ્યાસ કરવા પ્રેરાયો. ઘરગૃહસ્થી સંભાળવાની સાથે જ તેમણે દર્શનશાસ્ત્રી પંડિત શ્રી નર્મદાશંકર કૃષ્ણરામ વ્યાસ પાસે ૧૯૮૬થી સતત ૧૨ વર્ષ સુધી ‘ભાગવત’ અને તેની ‘શ્રીધરીટીકા’નું સધન અને સર્વાંગી અધ્યયન કર્યું. અધ્યાપન પૂર્ણ કરતાં

અનુવાદનું કાર્ય આરંભ્યું, પરંતુ પંડિતજીનું ૧૯૯૮માં અવસાન થતાં અવરોધ ઊભો થયો; પરંતુ આ દરમ્યાન ગુરુ મળ્યા સંસ્કૃત ભાષા-સાહિત્ય અને દર્શનશાસ્ત્રના પ્રકંડ પંડિત એવા ગુજરાત યુનિવર્સિટીના સંસ્કૃત વિભાગના સેવાનિવૃત્ત પ્રોફેસર અને અધ્યક્ષ ડૉ. લક્ષ્મેશ જોશી. પોતે પણ ભાગવત-સ્વાધ્યાય-પ્રીતિ ધરાવતા હોઈ વૈદેહીબહેનનું કાર્ય સુચારુ રીતે સંપન્ન થઈ શક્યું, અલબટ ૨૦ વર્ષની તપસ્યા બાદ, આમ પ્રાય: તર વર્ષની કઠોર વિદ્યાસાધના બાદ ગીતાપ્રેસ (ગોરખપુર)ના માધ્યમથી વિ. સં ૨૦૭માં આ અનુવાદ આપણને સુલભ થયો છે. આ અનુવાદકાર્ય દરમિયાન અનુવાદિકાનું ભાગવત સાથે સધારેલું નિર્બાજ ભક્તિભાવપૂર્ણ તાદાત્મ્ય : “આ વર્ષોપર્યેત ભગવાન વેદવ્યાસજીની સમાવિભાષામાં નિઃસૃત થયેલા શબ્દબ્રથને પતીન્દ્રકુલતિલક પૂજયપાદ શ્રીશ્રીધર સ્વામીની સર્વત્રેષ્ઠ ટીકાની સરણી દ્વારા માણવાનું જે પરમ સૌભાગ્ય પ્રાપ્ત થયું, તે જીવનનો એક અદ્ભુત, આઙ્ગલાદ્યક લહાવો બની રહ્યો. મૂળ શ્લોક અને તેની ટીકા વાંચતાં કોઈ વાર નેત્રોમાંથી નીર વહી જાય, હૃદયવીષાના તાર જંકૃત થઈ ઉંડે, અલૌકિક સંદાનો જાગી ઉંડે, અગાધ ઊડા અંતરતમને કંઈક એવું સ્પર્શી જાય કે રોમેરોમમાં આનંદ વ્યાપી જાય, પરમાત્માના ગાન અને શ્રવણથી તેનું ચિંતન થવા લાગે, મનમાં પરમાત્માની એક કલ્યાણમૂર્તિ ઘડાય, પરમ ચેતનાની વિરાટ રમણ્યમાં ચિત્ત પ્રવાણ થઈ જાય, પરમાત્માની એક ઝલક પામવાનો અભરખો જાગી ઉંડે અને શબ્દબ્રથના સથવારે જ શબ્દાતીતને પામવાની અંતરયાત્રાનો અભિક્ષમ મંડાય. આ જ તો આ ગ્રંથના અનુશીલનની ફળશુતિ છે” – પૂર્વજન્મના સંસ્કારનું દોતક બની રહેવાની સાથે જ કોઈ પણ જિજ્ઞાસુનો આદર્શ બની રહે તેટલું ભાવપ્રવાણ છે. આવી પ્રપત્તિભાવપૂર્વકની કાર્યભક્તિ જ શ્રેષ્ઠકાર્ય નિર્ણયન કરવી શકે અને તેથી જ આ અનુવાદએ તેમની સાધનાનું પરિપક્વ ફળ બની શક્યું છે. આ સાથે જ આ મહાયજના પ્રારંભથી પૂર્ણાંહુતિ સુધી અસાધારણ હુંહ પૂરી પાડનાર શ્રીમતી વૈદેહીબહેનના પતિ શ્રી પાર્થિવકુમાર અધ્યારુ પણ અભિનંદનના અવિકારી બની રહે છે

સમગ્રતયા ફક્ત આ એક સાદો-સરળ-કોરો

અનુવાદ નથી, પરંતુ સંશોધકીય અભિગમથી શબ્દશાસ્ત્રીય તૈયાર કરેલો એક શાસ્ત્રીય અનુવાદ છે. શાસ્ત્રીય એટલા માટે કે અહીં સ્વીકૃત પાઠના અનુવાદ ઉપર ધ્યાન આપવાની સાથે જ મૂળપાઠ અને ટીકાના કેટલાક પાઠભેદો દર્શાવવા અને તેને સંશોધિત કરવા, મૂળપાઠને અભિપ્રેત અર્થને વળગી રહેવું, નોંધપાત્ર પદોની સમજૂતી આપતી નોંધો, કવચિત્ત ટીકાઓનું તુલનાત્મક અધ્યયન, પાણિનીય વ્યાકરણની દસ્તિ જોવા મળતી ભૂલો અને આર્થપ્રયોગો ચીધાને તેનું સાચું સ્વરૂપ દર્શાવવું, કવચિત્ત છંદોની ઓળખ કરાવવી વગેરે ગુણરાશિના કારણે. આ ઉપરાંત ભાગવતના કથાવસ્તુ આધારિત આર્ટ પેપર ઉપરના ૪૦ બહુરંગી કલાત્મક ફીટોગ્રાફિસ અને દસ્તિપૂત્ર મુદ્રણ પણ ધ્યાનાર્કર્ષક બની રહે છે. આચાર્ય દીનાની આર્થવાણી “શ્રુતેન યત્નેન ચ વાગુપાસિતા ધ્રુવં કરોત્યેવ કમણુનગ્રહમ्”(કાચાર્દ્દી ૧.૧૦૪) = શાસ્ત્રાધ્યયનપૂર્વક અને અભ્યાસપૂર્વક વાણીની ઉપાસના કરવામાં આવે તો તે ચોક્કસ અનુગ્રહ કરે જ – અહીં ખરા અર્થમાં ચરિતાર્થ થઈ છે.

સંસ્કૃત વિદ્યાજગતના ગૌરવપુરુષ ડૉ. ગૌતમ પટેલ વૈદેહીબહેનના આ કાર્યની સમુચ્ચિત પ્રશસ્તિ કરી છે :
“શ્રીમદ્ભાગવતં પુરાણતિલકં લોકે પ્રસિદ્ધં ગતં

વ્યાખ્યા યેન કૃતા વિશેષજુચિરા વિદ્વજ્જનૈમનિતા ।

વैદેહી મનસા સ્વયં વૃત્તવતી શ્રીશ્રીધાર સ્વામિન

ભક્તિજ્ઞાનપ્રસન્તતાપરિગતં કાર્ય કૃતં ચાદ્ભુતમ् ॥”
જે દ્વારા બની રહી છે.

આવાં ગરવાં શ્રીમતી વैદેહીબહેન અધ્યારુ (મો. ૮૮૭૯૮૬૦૨૬૪૮) વિદ્યાજગતનાં શત્ર શત્ર અભિનંદનનાં અધિકારિણી બની રહ્યાં છે.

- ભાણિભાઈ પ્રજાપતિ
અણાઈઠેલી ભોમ / કિશોરસિંહ સોલંકી. અમદાવાદ
: પાર્શ્વ પ્રકાશન, ૨૦૨૧, પૃ. ૧૭૬, ISBN : 978-
93-84748-31-9 ક્રિ. રૂ. ૨૨૦

જાણીતા સર્જક અને પૃથ્વીની મોટા ભાગની પ્રદક્ષિણા [કરનાર], વિશ્વપ્રવાસી કિશોરસિંહ સોલંકી કૃત અણાઈઠેલી ભોમનાં પ્રવાસ/યાત્રા- વર્ણનો વાચક-ભાવકને ‘ઘેર બેઠાં ગંગાસ્નાન’ની અનુભૂતિ કરાવે તેવાં

અથવા કહીશું કે અણાઈઠેલી ભોમને દીઠેલી/માણેલી ભોમમાં પરિવર્તિત કરી દે – ચાક્ષુષ કરી દે તેવાં તેમજ પ્રત્યક્ષ જોવા માટે ઉત્કઠિત કરી મૂકે તેવાં સંતર્પક છે. અહીં સમાવિષ્ટ ૨૦ ભામણવુત્તો પેકી ૧૧ વિદેશ અને ૮ સ્વદેશ સંબંધી છે. જેમાં નોર્બના ઓસ્લો, ચીનની દીવાલ, શ્રીલંકા, પોર્ટુગલ, પોર્ટો, સ્પેનની રાજ્યાની મેડિઝ, ચેરાપુંજી, મેઘાલય, દાવકી, અમરકંટક, કાન્દા, મહેશ્વર, ઓમકારેશ્વર, સુંધા માતા અને હસ્તચિરિ સમાવિષ્ટ છે. આ બધાં પ્રવાસન સ્થળોની મુલાકાત વર્ષ ૨૦૧૧થી ૨૦૧૮ના સમયગાળા દરમિયાન લેવામાં આવી હતી

ગ્રંથારંભે સર્જકે ‘પ્રવાસનિબંધ’ એટલે શીર્ષક હેઠળની પ્રસ્તાવનામાં પ્રવાસનિબંધની વિભાવના સ-રસ રીતે વ્યાખ્યાપિત કરી આપી છે : ‘પ્રવાસનિબંધ એટલે જે તે સ્થળવિશેષને તથાપરક બરડતામાંથી બહાર કાઢીને રસ્તીકમનોહર જીવંતતા અર્પવાની કળા’, તેમજ ‘પ્રવાસલેખનનો આશય જ પોતીકા વિશિષ્ટ અનુભવ અને દર્શનનું આસ્વાદમૂલક નિરૂપણ કરવું એ છે.’ વધુમાં પ્રવાસ લેખક માટે અપેક્ષિત ગુણરાશિ, જેમકે, ઉચ્ચપ્રકારની સૌદર્યદસ્તિ, સમૃદ્ધ ચિત્કોષ, અર્થઘટનની સર્જતા, શબ્દચિત્ર દ્વારા દર્શયરૂપ સર્જવાની ક્ષમતા, ઐતિહાસિક અને ભૌગોલિક જ્ઞાન, ગુણગ્રાહી દસ્તિકાણ, ‘હું’ પદમાંથી બહાર નીકળવું વગેરે તારવી આપી છે અને આ સાથે જ પોતાના પ્રવાસશોખના ઘડતર સંબંધી આત્મનિવેદનમાં પોતાનો ઉછેર પ્રાકૃતિક સંપદાથી સમૃદ્ધ અરવલ્લીના ખોળામાં થવો વગેરે વિશે મન મૂકીને વાતો કરીને પોતાને મન પ્રવાસ એટલે શું અને પોતાના પ્રવાસ લેખનની ખાસિયતો ઉજાગર કરી આપતું નિખાલસતા સાથેનું નિવેદન : ‘મારે મન પ્રવાસ એટલે સ્વનો સુંદરતમ વિલાસ. હું મારી હ્યાતીને વિરાટના જૂલે જૂલતી જોઉ છું. પંચેન્દ્રિય પર્વ હોય છે પ્રવાસ મારે મને... હું પ્રવાસ લેખનમાં સ્થળ વિગતો આપું છું, પરિયાત્મક નિરૂપણ કરું છું, પરંતુ એક પ્રવાસી તરીકે આવી સ્થળના મારો ઉદેશ નથી. મારી મર્યાદા કહો કે વિશેષતા, પરંતુ જે તે પ્રવાસના સ્થળે પહોંચતાં સ્થળ પરિવેશ મારા માટે ગૌણ બની જાય છે. મારે મન જે તે સ્થળ એક ચેતનાપુંજ બની જાય છે. વળી, સ્થળની આસપાસનો પરિસર, પશ્ચાદભૂ લોકો એ બધું પણ મારા દર્શનનો છિસ્સો બની જાય છે.’

સુચિત્તનીય બની રહેવાની સાથે જ લેખકના પ્રવાસ નિબંધોની મુલવણી માટે પણ નિકષ બની રહે છે

લેખક પોતાને મન પ્રવાસને ‘ંચેન્દ્રિયનું પર્વ’ ગજાવતા હોઈ તેનું આલેખન પણ વાયકો માટે સ્વાભાવિક રીતે જ પંચેન્દ્રિયના પર્વ સમાન બની રહે તેટલું ભાવપ્રવાણ અને સ-રસ જોવા મળ્યું છે. ભલે લેખક નોંધ્યું છે કે ‘હું પ્રવાસમાં સ્થળ વિગતો આપું છું. મર્યાદા કહો કે વિશેષતા’, પરંતુ આ પ્રવાસનિબંધોમાં જોવા મળતી આવશ્યક સ્થળ વિગતો હકીકતમાં સ્થળ ન બની રહેતાં તેનો અનિવાર્ય અંગભૂત હિસ્સો બની રહે છે. ‘શરીરમદ્ય: ખલુ ધર્મ સાધનમ્બની જેમ પ્રવાસન-સ્થળના આંતર-સત્ત્વને ઉજાગર કરવા માટે પ્રમુખ આધારસ્તોત બની રહે છે અને આ સાથે જ જે તે સ્થળની ઈતિહાસિક, સાંસ્કૃતિક, ભૌગોલિક તથા પ્રવર્તમાન વિગતો અને તેની સાથે પૌરાણિક કે લોકમુખે પ્રચલિત ડિવદન્તીઓની ગુંથણી લેખકની અધ્યયનશીલતાની ધોતક બની રહે છે ઉદા. તરીકે જોઈએ તો ‘ઓસ્લોનાં શિલ્પો’, ‘પોર્ટુગલ’ માટે ફાળવેલ સ્વતંત્ર પ્રકરણ, ‘મહેશ્વર’, ‘ઓમકારેશ્વર’, ‘સોગન્ધિક પર્વતઃ સ્નૂંધા માતા’, ‘હસ્તગિરિ’ વગેરે વિશેનાં વર્ણનોમાં લેખકની સ્વાધ્યાયનિષ્ઠા ધ્યાનાર્હ બની રહે છે. આ બધી અર્થસભર વિગતોની સાથે જ જે તે સ્થળવિશેષનું સૌદર્યદર્શન-પ્રકૃતિદર્શન, લોકજીવન, ઈતિહાસભોધ વગેરેનો પણ પરિચય કરાવતા રહે છે. આ બધાં સૌદર્યલુભ્ય પ્રવાસનકેન્દ્રો અને તેના પર્યાવરણનાં વર્ણનો ચાક્ષુષ બની રહેતાં હોઈ વાયકને સાચંત જકડી રાખે તેવાં થઈ પડ્યાં છે. લેખક શ્રીલંકાના નુવારા ઈવિયા પ્રદેશનું વર્ણન કરતાં નોંધેલ શબ્દો : ‘એનાં રમણીય અને મનોહર ચિત્રો આંઝો સામેથી પસાર થઈ રહ્યાં હતાં. ગમે તેવો જડ કે બુદ્ધિલીન અથવા બુદ્ધિશાળી અને સૌમ્ય પ્રકૃતિનો માણસ હોય એને પણ આ વહેતી હવા અને પર્વતોના ઢોળાવો ઉપર છવાયેલી લીલોતરી તરબતર કરતી રહે છે. આપણું મન આ બધું જોતાં પૂનમના ચાંદની જેમ ખીલી ઉંઠે છે.’ શબ્દાન્તરે લેખકની અભિવ્યક્તિ કલાને લાગુ પડે છે

પ્રવાસનો પ્રથમ પડાવ નોર્બેના ઓસ્લો નગરમાં કર્યો છે. વિશ્વનું અને સવિશેષતઃ નોર્બેનું ગૌરવ એવા ફોર્ગનર પાર્કમાં સ્થિત ‘વિગેલેન્ડ સ્ક્લયર પાર્ક’નો

સૌદર્યનેણી ધારાપ્રવાહી પરિચય વાયકને સ્પર્શી જાય તેવો છે. અહી નોર્બેના શિલ્પકાર વિગેલેન્ડ (૧૮૬૮ - ૧૮૪૩) કૃત ૨૧૨ બ્રોન્જ અને બ્રેનાઇટમાં કંડારેલાં નનશિલ્પોનો પરિચય કરાવતાં લેખક માઈકેલઅન્જેલો, ઓશોની વિચારધારા અને ખજૂરાહોનાં શિલ્પોની સ્મૃતિ તાજ કરીને નનશિલ્પોનું રહસ્યોદ્ઘાટન કરતાં નોંધેલ શબ્દો : ‘આ શિલ્પો એ.... માનવજીવનની શારીરિક-માનસિક જરૂરિયાતોને વાસ્તવિક રીતે ઉજાગર કરી છે. આપણાં ખજૂરાહોનાં શિલ્પોનાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષની ગતિ તરફ નિર્દેશ છે, ઓશોએ સંભોગથી સમાવિની વાત કરી છે, એમ અહી આ શિલ્પોમાં જે માનવનો ગોપિત અંચળો છે એને દુનિયાના ચોકમાં ખુલ્લો મૂકી દીધો છે. એમાં કશ્યુ જ અનુચ્ચિત લાગતું નથી. આ શિલ્પો અથેતિ જોવા પછી આપણા મનના વિકારનો વિરામ મળે છે, એ કલાકારની મહાન સ્ત્રી છે.’ સુચિત્તનીય બની રહે છે. પરંતુ આ સાથે જ શ્રીલંકાના નુવારા-ઈવિયાના સૌદર્યખચિત પ્રદેશો અને તેના સાંનિધ્યમાં સ્થિત ચાના બગીચામાં કામ કરતી તમિલ મહિલાઓ સંદર્ભોનું અવલોકન ‘એમને તો આ કાયમી થઈ ગયું છે. જો એ આ ઝરણાં અને ધોધને જોવા રોકાય તો પોતાના રોટલાનું શું ? એમને તો સૌદર્યનું સૌદર્ય કહો કે જીવતર કહો, માત્ર આ ચાની પતીઓ ચૂંટવાનું જ નસીબમાં લખેલું છે. ઉપર આકાશ અને નીચે પર્વતોનું પડખું સેવવાનું, વાંસના ઢુંગા ઊભા કરીને અંદર રાતવાસો કરવાનો, સવારે સૂરજદેવનાં દર્શન સાથે શરૂ થતો નવો ટિવિસ ચાના બગીચામાં પસાર થઈ જાય’ – ઘણું બધું કહી જાય છે. અર્થાત્ અંતતઃ વિશ્વ સાંસ્કૃતિક ધરોહર કોના ઉપભોગ માટે ? લેખકની આ સંવેદનશીલતા – ચિંતા અને ચિંતન – વાયકના ચિંતને પણ હલાવી જાય છે. નવા નવા દરિયાઈ માર્ગો શોધવા માટે ખ્યાત તેમજ ગ્રાયાં : આખી દુનિયા ઉપર રાજ કરનાર એક નાનકડા દેશ પોર્ટુગલ ઉપર લેખક આફરીન છે. તેનો વિગતે ઈતિહાસ, તેનાં સ્મારકો અને આ પૈકી ‘મોન્યુમેન્ટ ટુ ધ ડિસ્કવરીઝ’ સ્મારકને ‘પોર્ટુગલના નાગરિકોનું સાહસ અને બહાદુરીનું પ્રતીક’ ગજાવીને આ સ્મારકમાં સમાવિષ્ટ મુખ્ય નાવિકો-સાગરભેડુઓ વગેરેની સ્ત્રીઓને ઉજાગર કરી આપવાની સાથે જ આ ભવ્ય

અને દુર્દેશિતાશીલ સ્મારકની સામે બેસીને લેખક વિચારે છે કે ‘આપણે શું કરી શકીએ એમ છીએ?’ આ વિચાર આપણી ચેતનાને હંકોળવા માટે ચિનગારી સમ બની રહે છે. આ સાથે જ પોર્ટ, મેડ્રિડ અને વિલેનાનાં વર્ષનો પણ ધ્યાનકર્ષક બની રહે છે. વિદેશમાં પર્યટન દરમિયાન અનુભવેલ કેટલીક સુખદ બાબતો સંદર્ભે ભારતમાં તે વિશે સેવવામાં આવતી ભારે ઉપેક્ષાની લેખક આકોશ સાથે નોંધ લેતા રહ્યા છે. આ સંબંધી લેખકનું મંતવ્ય : ‘સંવેદના અને નાગરિક ચેતના સંદર્ભે પરદેશમાંથી ઘણું બધું નવું શીખવા જેવું છે.’ ચિંતનીય બની રહે છે નોંધવું રહ્યું કે લેખક મુલાકાત લીધેલ વિદેશનાં પ્રવાસન-કન્દ્રો પૈકી મોટા ભાગનાં કન્દ્રો યુનેસ્કો દ્વારા વિશ્વ સાંસ્કૃતિક વિચારસત જાહેર કરવામાં આવેલા છે

આપણા દેશનાં પર્યટનસ્થળો પૈકી પ્રાકૃતિક સૌદર્યથી હર્યાભર્યા એવાં ચેરાપુંજી, મેઘાલય, દાવકી-ભારત-બાંગલાદેશ સરહદનો પ્રદેશ અને કાન્દા આપણાં હોવાં છતાંય તેનાથી આપણે અલ્યપરિચિત છીએ એવાં આ સ્થળોનાં વૈવિધ્યપૂર્ણ વનગાજિથી ખચિત જંગલો, પક્ષીઓ, લોકજીવન વગેરેનો હૃદયંગમ પરિચય કરાવવાની સાથે જ ઔદ્યોગિકરણના કારણે પ્રદૂષણે કબજો જમાવેલો છે તેથી પ્રકૃતિ ચોધાર અંસુએ રડી રહી છે’ તેની અને ‘રોડ ઉપર હરતી ફરતી ગરીબી’ની નોંધ લેવાનું લેખક ચૂક્યા નથી. મેઘાલયમાં પ્રચલિત માતૃવંશીય સાંસ્કૃતિકની પ્રથા અને પુરુષો આંસુ પ્રકૃતિ હોવાનું પણ નોંધું છે આ ઉપરાંત સાહિત્ય અકાદમી, દ્વારા નેહુમાં આયોજિત ‘અભિલ ભારતીય કવિતા મહોત્સવ’માં કવિ/લેખકની ભાગીદારી અને ત્યાર બાદ મેઘાલયની દક્ષિણે દાવકી પ્રદેશમાં ભારત-બાંગલાદેશની સરહદ-રેખા ઉમંગોટ નદી વચ્ચેથી પસાર થાય છે તે સ્થળની મુલાકાત અને આ સ્થળના નિવાસીઓની સ્થિતિનો અહેવાલ અને સરહદ વિભાજન આશ્ર્ય પમાડે તેવાં છે.

પ્રકૃતિધારોની સાથે સાથે આપણી આસ્થાનાં વિખ્યાત તીર્થધારો કે જે નિસર્ગલીલાથી પણ સંપન્ન છે, જેમ કે, અમરકંટક, મહેશ્વર, ઓમકારેશ્વર, સુંધામાતા અને હસ્તગિરિની મુલાકાતોનાં ભક્તિભાવ અને પૌરાણિક કથાઓ સાથેનાં વર્ષનો પ્રવાસ અને યાત્રાની આહુલાદક અનુભૂતિ કરાવે તેવાં છે. અલબત્ત, લેખક

પોતાને ‘દર્શનાર્થી કરતાં વધારે તો જિજ્ઞાસાર્થી’ ગણાવે છે. આમ છતાં તીર્થસ્થાનો પ્રતિ લેખકની પ્રપત્તિભાવપૂર્વકની આસ્થાનાં દર્શન આ વર્જનોમાં ડેર ડેર જોવા મળે છે. આ સંબંધી એક ઉદાહરણ જોઈએ : “પર્વતો આપણાં પ્રાચીન તીર્થસ્થાનો છે. એ હિમાલય હોય, ગિરનાર હોય, અરવલ્લી કે શત્રુંજ્ય હોય. એ નામ સાંભળતાંથી સાથે જ આપણામાં એક નવી ચેતનાનો સંચાર થતો હોય છે. ઈશ્વર સાથે અનુસંધાન સાધવા માટેનું ઉત્તમ ક્ષેત્ર એ તીર્થસ્થાન છે જ્યાં મહાન પુરુષોની ચરણરજ પડેલી છે, જ્યાં એમની તપોભૂમિમાં છે એવી તીર્થભૂમિમાં આપણા મનની મલિનતાનો નાશ થાય છે અને પવિત્ર વિચારોનું જરણાં વહેવા માંડે છે. પ્રકૃતિના સાનિધ્યમાં આપણા અહુમ્ની બર્જાણી શિલાઓ ઓગણી જાય છે આપણામાં જ આપણી શ્રદ્ધાની જ્યોતિ પ્રગટી હોય છે, એ જ છે આપણી સંસ્કૃતિનો આત્મા. તેથી કોઈ પણ તીર્થક્ષેત્રનું નામ સાંભળતાંની સાથે જ ત્યાં જવા માટે આપણા ઘટમાં ઘોડા થનગનતા હોય છે.”

અહીં અત્ર-તત્ત્વ કેટલાક તળપદા શબ્દો, જેમકે, ‘ઘાસલ’, ‘અટિયાં’, ‘જળુબુંવું’, ‘ઢબૂરાયેલ’, ‘બૈરાં’, ‘ભૂરાંટો’, ‘રાડારાડ’, ‘વરાપ’, ‘હડીઓ’, ‘હકોટીને’ વગેરેના પ્રયોગો ભાષામિયાંક્રિત ધારણાર બનાવતા હોઈ ધ્યાનાર્થ બની રહે છે. વધુમાં, વિદેશી સ્થળો / વ્યક્તિઓનાં નામો ગુજરાતીમાં નોંધવાની સાથે જ તેનાં રોમન લિપ્યંતરો ક્રોસમાં આય્યાં છે, જેમ કે, અહુલ્લા (Badulla), ડોરો (Douro), ડેરિયસ (Durius) કી (Qui), ફેલ્ડ (Fjeld) વગેરે, જેમાં લેખકની દુર્દેશિતાનાં દર્શન થાય છે. આ ઉપરાંત મુલાકાત લીધેલ સ્થળોનાં વર્તમાનમાં પ્રચલિત નામ ઉપરાંત પ્રાચીન કે મધ્યકાલીન સમયમાં કે લોકવ્યવહારમાં પ્રચલિત નામો પણ કણજીથી દર્શાવ્યાં છે, જેમ કે મેડ્રિડ - મેત્રાર્ગતા, ઉર્સરિયા, મેરિટસ વિસ્બન પાર્ટુઝીઝમાં લિસબોયા કેન્દી સેકડાગલા, કાતુબુલુનુવારા; સુંધામાતા સુંધાનો ભાંખરો, સૌગંધિકગિરિસ ચેરાપુંજી સોહરા, ચુરા, પુંજી વગેરે, તેમ જ પ્રવાસન સ્થળોના ૪૧ ફોટોગ્રાફિસ મૂકવાથી ગ્રંથનું દસ્તાવેજ મૂલ્ય અદકેનું સોહી રહ્યું છે, પરંતુ આટલી કણજ વચ્ચે આ ફોટોગ્રાફિસની ઓળખ માટેનાં captions નોંધવા પ્રતિ ઉદાહરિતા પણ જોવા મળે છે.

મણિભાઈ પ્રજાપતિ

સંરથી સમાચાર

યુનિવર્સિટી / કોલેજ વિભાગ

એલ ડી આર પી નું ગૌરવ

● એલ ડી આર પી આઈ ટી એન્ડ આર ની વિદ્યાર્થીની કૃષ્ણા ટાંકે બી ઈ (કમ્પ્યુટર એન્જિનિયરિંગ) ની ડિગ્રી CPI 8.08 સાથે વર્ષ 2017માં મેળવ્યા બાદ યુએસએનો કેલિફોર્નિઅસ સ્ટેટ યુનિવર્સિટીમાંથી એમ. ઈ. (કમ્પ્યુટર સાયન્સ)ની ડિગ્રી ઉચ્ચ ગુણાંક સાથે મેળવવા ઉપરાંત એમ્બેન્ડ કંપનીના 'સ્ટુડન્ટ્સ એમ્બેસેડ' તરીકેની પરીક્ષા ઉત્તીર્ણ કરતાં આ કંપનીએ તેને સોફ્ટવેર તેવલપર એન્જિનિયર તરીકેની નિમણ્ણક વાર્ષિક ૧૪૪૦૦ થી આપી છે. આ કંપનીમાં જોડાતાંની સાથે જ કંપનીએ તેને \$ ૮૬૦૦૦ ના શેર પણ આપ્યા. ઉલ્લેખ કરવો રહ્યો કે કૃષ્ણા અભ્યાસમાં તેજસ્વી રહી હોવાની સાથે વિવિધ કાર્યશાબ્દિ, પરિસંવાદોમાં તેની સક્રિય ઉપસ્થિતિ ઘણાઈ બની રહી હતી તેણે બી. ઈ. ના અંતિમ વર્ષમાં 'Spam email filtering using saikit learning using machine learning' અને Human activity recognition using deep learning' વિશેના બે તેમજ એમ. ઈ.માં 'First person video activity recognition system' વિશે પ્રોજેક્ટ રજૂ કર્યા હતા, જેમાં તેમની કાર્યાલાય અને સંશોધકીય અભિગમ ઘણાઈ બની રહે છે. એલ.ડી.આર.પી.નાં એમ્બેસેડ કૃષ્ણા ટાંકેને ઉચ્ચાસિદ્ધ માટે હાઇક અભિનંદન.

ઔદ્યોગિક મુલાકાત

● બી. પી. કોલેજ ઓફ બિજુનેસ એડમિનિસ્ટ્રેશન (બી.બી.એ.)ના વિદ્યાર્થીઓ માટે ગ્રેનીટો LLP (ભોરબી)ની તા. ૨૦ જુલાઈ, કિએટિવ ફોર્જ પ્રા લિ. (શાપર, વેરાવળ), જિ. રાજકોટ)ની તા. ૨૩ જુલાઈ અને વસાઇ પોલિમર્ પ્રા લિ.ની તા. ૨૪ જુલાઈના ડિવસોમાં ઓનલાઈન ઔદ્યોગિક મુલાકાતોનું આયોજન કરવામાં આવ્યું હતું આ મુલાકાતો દરમિયાન સંબંધિત કંપનીઓના અધિકારીશ્રીઓ દ્વારા કંપનીના વ્યવસ્થાતંત્ર, ઉત્પાદન, વેચાણ, વગેરે સંબંધી વિગતે માહિતી આપવામાં આવી

હતી તેમજ પ્લાન્ટ્સની વર્ચ્યુલ મુલાકાત કરાવડાવવામાં આવી હતી.

કાર્યશાબ્દિ

● બી. પી. કોલેજ ઓફ બિજુનેસ એડમિનિસ્ટ્રેશન (બી.બી.એ.) દ્વારા વિદ્યાર્થીઓ માટે નીચે દર્શાવ્યા મુજબબની કાર્યશાબ્દિઓનું આયોજન કરવામાં આવ્યું : 'Career in Insurance Sector' વિષય પર તા. ૬ જુલાઈ ના રોજ ગાંધીનગર જિલ્લાના LICના વિકાસ અધિકારી શ્રી મનોજ પાત્રાએ દુનિયાની સૌથી મોટી વીમા કંપનીઓમાં સમાવિષ્ટ LIC વિશે પરિચય કરાવતાં જગ્યાવ્યું હતું કે ભારત સરકારના સહયોગથી ચાલતી આ કંપનીમાં કારકિર્દી ઘડતર માટે ખૂબ ઉજવળ તકો છે, ખાસ તો પ વર્ષ સુધી કંપની સાથે એડવાઈઝર તરીકે સફળ રહો તો કંપનીમાં વિકાસ અધિકારી બનવા માટેની, તેમજ IFDAની પરીક્ષા થકી પણ કારકિર્દી કંડારી શકાય છે. તા. ૧૬ જુલાઈના રોજ Learning Challenges in Team.' વિષય પર યુનિવર્સિટીના કમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટનાં શ્રી શુભા ગૌતમે સફળ કારકિર્દીના ઘડતર માટે સ્કિલ તેવલપ કરવા વિશે માર્ગદર્શન પૂરું પાડવાની સાથે સ્વાનુભવ આધારિત ટીપ્સ આપીને રીમનું મહત્વ, રીમમાં આવતી વિવિધ સમસ્યાઓના ઉકેલ વગેરે સંબંધી મહત્વપૂર્ણ સૂચનો પણ કર્યા હતાં તા. ૮ જુલાઈના રોજ 'Lawful and Legal Insights to Become Entrepreneur' વિશે શ્રી જ્યાક્શન ફેફરે કંપનીનો અર્થ અને તેના વિવિધ પ્રકારો તેમજ કંપનીની સ્થાપનાથી લઈ તેના વિવિધ કાર્યો તથા સંભવિત પ્રશ્નો બાબતે સમજ આપતાં તેને અસરકર્ત્ત્વ વ્યવસાયલક્ષી તેમજ આર્થિક પરિબળો, કાનૂની બાબતો, ટેકનોલોજીકલ તેમજ ફાયનાન્સિયલ એનાલિસિસની માહિતી આપી હતી. તા. ૧૪/૭/૨૦૨૧ ના રોજ 'Learing Problem, Solving with Critical Thinking.' વિશે શ્રી સ્વસ્તિ મેડ્ચે ડિક્લાની આવશ્યકતા અને તેના વિકાસ માટે કોઈ સમસ્યાના ઉકેલ પૂર્વે તેનાં લક્ષણો સમજીને તેનું નિદાન

કરી તેનો ઉપચાર કરવા બાબતે સમજણ આપી હતી. તા ૧૫ જુલાઈ ના રોજ ‘Document Desing and Its Advantages’ વિષય પર ડૉ. નેહા ત્રિવેદીએ કારકિર્દિના ઘડતર માટે વિદ્યાર્થીઓને સ્કિલ ડેવલપ કરવા માટે જરૂરી બાબતો જ્ઞાવવા ઉપરાંત તેમાં કેવા પ્રકારના શબ્દોનો ઉપયોગ થઈ શકે તેમજ યોગ્ય ફોર્મેટિંગ વિશે સમજણ પૂરી પાડી હતી. અભ્યુની વિદ્યાર્થીઓ માટે ‘Being Vigilant Pays off’ વિષય પર વર્કશોપનું આયોજન તા ૨૭ જુલાઈના રોજ કરવામાં આવતાં કરી સર્વ વિશ્વવિદ્યાલયના મેનેજમેન્ટ ફેફલ્ટીના ડીન તેમજ એસ. વી. ઇનોવેશન ફાઉન્ડેશનના CEO ડૉ. ભાવિન પંડ્યાએ સફળ કારકિર્દિના ઘડતર માટે વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસનું મહત્વ, અભ્યાસમાં વિકલ્પની પસંદગી, અભ્યાસ દરમ્યાનના પડકારો અને ત્યાર બાદ યોગ્ય પ્લેસમેન્ટ કરી રીતે મેળવવું તે બાબતે માર્ગદર્શન આય્યું હતું. આ સાથે MBA જેવા કોર્સની પસંદગી કરવામાં આવે તો ગુજરાતમાં આવનાર ડિવસોમાં અનેક મલ્ટીનેશનલ કંપનીઓનાં રોકાણ આવવાનાં હોઈ ગુજરાતમાં જ ઉચ્ચ અભ્યાસ તેમજ સફળ કારકિર્દી માટે યોગ્ય વિકલ્પ ગણાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે આ તમામ કાર્યક્રમિબિરોના પ્રારંભમાં આચાર્યશ્રી ડૉ. રમાકાન્ત પૃષ્ઠી દ્વારા પ્રસંગોચિત ઉદ્ઘોધનમાં કાર્યક્રમિબિરોનું મહત્વ, ઉપાચાર્ય ડૉ. જ્યેશ તના દ્વારા સંબંધિત વિષયની માહિતી અને પ્રસંગોચિત ભૂમિકા તથા પ્રા આશિષ ભુવા દ્વારા અતિથિ વક્તાશ્રીઓને આવકારવામાં આવ્યા હતા.

કોરોના અને સ.વિ.કે. મંડળ

● કોરોના મહામારીના સમયમાં ‘કોરાના યોદ્ધા’- ‘Covid Warrior’ તરીકે માનવતાસભર બહુઅધ્યાત્મી ઉત્કૃષ્ટ સેવાઓ જેમકે, સુખ-સંગવડયુક્ત કોરોનાઈન સેન્ટર, અસરગ્રસ્ટોને અનાજ કીટ તથા સવાર-સાંજ ભોજન પૂરું પાડવું વગેરે બદલ મહેસાણા જિત્તા વહીવટી અને આરોગ્ય તંત્ર દ્વારા રાખ્ણના ઉપમા સ્વાતંત્ર્યાદિનની ઉજવણી પ્રસંગે સર્વ વિદ્યાલય કેળવણી મંડળ, કરીને ગુજરાત રાજ્યના માનનીય મંત્રીશ્રી કુંવરજી બાવળિયાના વરદ્ધહસ્તે સન્માનપત્ર અર્પણ કરીને સન્માનિત કરવામાં આય્યું. આ ઉપરાંત કરી તાલુકા સ્તરની ઉજવણી પ્રસંગે પણ સર્વ વિદ્યાલય કેળવણી મંડળ, કરીને આ બધી સેવાઓના ઉપલક્ષ્યમાં સન્માનપત્ર એનાયત કરીને

સન્માનિત કરવામાં આય્યું છે.

ગુરુપૂર્ણિમા

● આર એચ પેટેલ ઈન્જિનિયરિંગ બી એડ. કોલેજમાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી અંતર્ગત તાલીમાર્થીઓએ સમાજમાં ગુરુનું મહત્વ વિશે પોતાના વિચારો વ્યક્ત કરી ગુરુની વિશેષતાઓ ધ્યાનમાં લઈ પ્રાર્થના, દુષ્ટ, નૃત્ય, રજૂ કર્યા હતાં. જ્યારે એસ. એસ. પેટેલ કોલેજ ઓફ એજ્યુકેશનમાં ‘ગુરુ વિના શાન નહીં, તેમજ ગુરુ આફૂતિ નથી, આત્મીય છે.’ વિષય પર વક્તૃત્વ સ્વર્ધિનું આયોજન કરવામાં આય્યું હતું.

● બી. પી. કોલેજ ઓફ બિજનેસ એડમિનિસ્ટ્રેશન (બી.બી.એ) દ્વારા ઔનલાઈન માધ્યમથી ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવતાં ૨૦ વિદ્યાર્થીઓ જોડાયા હતા. પ્રારંભમાં આચાર્ય ડૉ. રમાકાન્ત પૃષ્ઠી એ સમય પાલન તેમજ મન રૂપી ગુરુનું મહત્વ સમજાવીને વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવી હતી. વિદ્યાર્થીઓએ ગુરુમહિમા વિશે પોતાના વિચારો રજૂ કર્યા હતા.

પીએચ ડી

● કરી સર્વ વિશ્વવિદ્યાલય, ગાંધીનગર દ્વારા નીચે દર્શાવેલા વિદ્યાર્થીઓને તેમના નામ સામે જણાવેલ શોધપ્રબંધ ઓંગસ્ટ, ૨૦૨૦ થી જાન્યુઆરી, ૨૦૨૧ દરમિયાન સ્વીકારીને તેમને Ph.D. ની ડિગ્રી એનાયત કરવામાં આવી.

Biotechnology :

1. Tripathi, Archana Durgashankar : ‘Studies on Tannase Producing Microbes from Tannin Rich Substrates and their Applications’ / Subject : Biotechnology/ Guide : Dr. Lakshmi. B. Ref. N0. Ph.D. / 453/ 2021. 11/06/2021.

Chemistry :

2. Parmar, Tejasvi Harilal : ‘Studies on Biological Evaluation of Some Heterocyclic Compounds’ / Subject : Chemistry / Guide Dr. Chetankumar B. Sangani. Ref. N0. Ph.D. / 454/ 2021. 08/07/2021.

English :

3. Dube, Pratima Vidyanand : ‘Towards A Curriculum Design to Bridge the Dispar-

ity Between Existing Communicative Proficiency of Law Students of National Law Universities of India and Skill Expectations of the Legal Profession' / Subject : English / Guide : Dr. Manish A. Vyas. Ref. N0. Ph.D. / 456/ 2021. 16/07/2021.

Management :

4. Acharya, Vishal Arvindkumar : 'A Study on Impact of Demographic, Socio-Economic and Attitudinal Factors on Financial Risk Tolerance of the Investors' / Subject : Management / Guide : Dr. S. O. Junare. Ref. N0. Ph.D. / 451/ 2021. 26/05/ 2021.
5. Jain, Dipika Padamchand : 'A Study of Corporate Governance Practices In Indian Banking Sector' /Subject : Management / Guide : Dr. Priyanka B. Pathak. Ref. N0. Ph.D. / 447/ 2021. 04/02/2021.

Pharmaceutical Science :

6. Gangil, Jeetu : 'An Investigation of Efficacy, Safety and Tolerability of Antimalarial Drug Regimens: A Meta-Analysis Approach' / Subject : Pharmaceutical Science / Guide : Dr. Bhaswat Chakraborty. Ref. N0. Ph.D. / 454/ 2021. 08/07/2021.
7. Vegad, Kunjal Labhubhai : 'Development of Herbal Formulation for Osteoporosis by Target Based Approach' / Subject : Pharmaceutical Science / Guide : Dr. Niranjan S. Kanaki. Ref. N0. Ph.D. / 452/ 2021. 09/06/2021.

વ्याख्यान

- એસ એસ પટેલ કોલેજ ઓફ એજ્યુકેશન અને આર એચ પટેલ ઈલિલશ મિડિયમ બી એડ કોલેજમાં તાલીમાર્થીઓ માટે પ્રો વીણાબેન પટેલના માર્ગદર્શન હેઠળ તા. ૨૧ જુલાઈના રોજ સર્વ

વિશ્વવિદ્યાલયના કોમ્પ્યુનિકેશન સ્કિલ ટેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ અને ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ટરનેશનલ રિલેશન વિભાગ દ્વારા એક્સપર્ટ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તજ્જી તરીકે સદર વિભાગનાં તજ્જી ડૉ. નેહા પટેલ, પ્રા શુભા ગૌતમ, અને પ્રા સ્વસ્તિ રેનાએ કોમ્પ્યુનિકેશન સ્કીલ, સોફ્ટ સ્કિલ ટેવલપમેન્ટના ઉદ્દેશો, પ્લેસમેન્ટ, સફળતા મેળવવાની ચાવી, સ્પોકન ઈલિલશ મોડયુલ, રીડિગ મોડયુલ, ઈન્ટરનેશનલ ફેકલ્ટી ટેવલપમેન્ટ પ્રોગ્રામ, સ્ટુડન્ટ ઈમ્પ્રોવમેન્ટ પ્રોગ્રામ અને ચિદ્ધન ટેવલપમેન્ટ પ્રોગ્રામ વિશે જાણકારી આપી હતી તા ૨૭ જુલાઈ ના રોજ ડૉ. શિવાની ત્રિવેદીએ WECના ઉદ્દેશો, માનસશાસ્ત્રીય કસોટી, ઈન્ટરવ્યૂ જુદા જુદા પ્રકારની મુલાકાતો, સમૂહ પ્રવૃત્તિઓ, ડિજિટલ માર્કેટિંગ વગેરે વિશે સમજાણ પૂરી પારી હતી. તા. ત. ઓગસ્ટના રોજ આયોજિત વાખ્યાનમાં ડૉ. રણાંધોડ રથવી અને પ્રા નોરીન મેડમે ફિલ્મિક્લ એજ્યુકેશન અને લક્ષ્ય ડિપાર્ટમેન્ટના હેતુઓ, ઉદ્દેશો વિવિધ રમતો વગેરે વિશેની માહિતી આપી હતી. જ્યારે તા. ૧૩ ઓગસ્ટના રોજ ડૉ. ધર્મન્દ્ર પટેલ સર્વ નેતૃત્વ કાર્યક્રમ વિશે સમજ આપી હતી. આ વાખ્યાનોમાં બંને કોલેજના એચ. ઓ. ડી. અનુકૂમે ડૉ. જિજાસાબેન જોશી અને ડૉ. કુસુમબેન યાદવ, અદ્યાપકો તેમજ વિદ્યાર્થીઓ જોડાયા હતા અને પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા.

સ્વાતંત્ર્ય પર્વ

● તા. ૧૫ ઓગસ્ટ, ૨૦૨૧ના રોજ રાજીના ઉપમા સ્વાતંત્ર્યદિનની ઉજવણી નિમિત્તે સર્વ વિદ્યાલય, કરીમાં સર્વ વિદ્યાલય કેળવણી મંડળ અને કડવા પારીદાર કેળવણી ઉતેજક મંડળના મંત્રીશ્રી ડૉ. મહિબાઈ એસ. પટેલ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સર્વ વિદ્યાલય કેળવણી મંડળ અને કડવા પારીદાર કેળવણી ઉતેજક મંડળના ચેરમેનશ્રી અને કરી સર્વ વિશ્વવિદ્યાલય, ગાંધીનગરના પ્રેસિડેન્ટ શ્રી વલભભાઈ પટેલ પ્રાસંગિક ઉદ્ઘોધનમાં સ્વાતંત્ર્ય પર્વ પ્રસંગે શુભકામનાઓ પાઠવીને રાજ્ય માટે નાગરિક ધર્મનું પાવન કરવા તેમજ કોરોના મહામારીમાંથી બચવા માટે સરકારશ્રીની ગાઇડલાઇન્સનું ચુસ્ત પાલન કરવા આપીલ કરી હતી. આ સાથે જ સર્વ વિદ્યાલયના ગાંધીનગર કેમ્પસ, સેક્ટર-૨ રૂમાં કેમ્પસ ડાયરેક્ટર ડૉ. સોમભાઈ પટેલના હસ્તો ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.

શાળા વિભાગ

કલાત્મક પ્રવૃત્તિઓ

● શ્રીમતી આર. એન. પ્રાથમિક શાળામાં ફૂલદાની ચિત્રસ્થધી તથા આસોપાલવ સહિતનાં વિવિધ પાંડડા, ફૂલો, શાકભાજુ અને પૂંઠામાંથી વિવિધ આકારો બનાવવાની તથા હસ્તકલાની પ્રવૃત્તિઓ, એસ. જી અને એસ. વી. ઈંગ્લિશ મીડિયમ પ્રાયમરી સ્કૂલમાં રંગીન કાગળમાંથી બુકમાર્ક તથા ચિત્રો અને રેતીની ડિઝાઇન, માર્ક તથા પેપર કાફિટ બનાવવાની; એમ. બી. પટેલ કન્યા પ્રાથમિક શાળામાં કાગળમાંથી પક્ષીઓ તથા સિલાઈ વગર માર્ક બનાવવાની અને શ્રી જે. બી. પ્રાથમિક શાળામાં વિવિધ પાંડડા, ફૂલો, શાકભાજુ અને પૂંઠામાંથી વિવિધ આકારો, માર્ક બનાવવાની, અનાજ-કઠોળમાંથી રાજ્યધંજ તેમજ વિવિધ ડિઝાઇનો બનાવવાની પ્રવૃત્તિઓનું ઓનલાઈન આયોજન કરવામાં આવ્યું.

ગુરુપૂર્ણિમા

● શ્રીમતી આર એન પટેલ પ્રાયમરી સ્કૂલ, શ્રીમતી એમ. બી. પટેલ કન્યા પ્રાથમિક શાળા, શ્રીમતી એસ. જી. અને શ્રી એસ. વી. ઈંગ્લિશ મીડિયમ પ્રાયમરી સ્કૂલ તથા વી. એમ. પટેલ કુમાર અને શ્રીમતી એચ. વી. પટેલ કન્યા બાલમંદિરમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી ઓનલાઈનથી કરવામાં આવી. સંબંધિત શાળાના આચાર્યશ્રીઓ, શિક્ષકો દ્વારા ગુરુનું મહત્વ સમજાવીને વિદ્યાર્થીઓને પોતાનાં ગુરુતુલ્ય માતા-પિતા અને દાદા-દાદીનું પૂજન કરવા શીખ આપી હતી.

પ્રવેશોત્સવ

● શ્રી વી. એમ. પટેલ કુમાર અને શ્રીમતી એચ. વી. પટેલ કન્યા બાલમંદિરના બાળકોનો તા. ૭/૬/૨૦૨૧ના રોજ ઓનલાઈન પ્રવેશોત્સવ ઉજવાયો. આ અન્વયે ડાયરેક્ટર શ્રી ડિરણબેન પટેલ તથા પ્રિન્સિપાલ

શ્રી મીનાક્ષીબેન અને સ્ટોફ દ્વારા માતા સરસ્વતીની વંદના-સ્તવન કરીને બાળકોને આવકારવામાં આવ્યાં હતાં.

વિશ્વયોગદિન

● વિશ્વભરમાં તા. ૨૧ જૂન 'વિશ્વયોગદિન'ની શ્રીમતી આર. એન. પટેલ પ્રાયમરી સ્કૂલ, શ્રીમતી એમ. બી. પટેલ ગર્ભ્ય પ્રાયમરી સ્કૂલ, શ્રીમતી એસ. જી. અને એસ. વી. ઈંગ્લિશ મીડિયમ પ્રાયમરી સ્કૂલ, કરી નાગરિક સહકારી બેંક પ્રાથમિક શાળા અને શ્રી જે. બી. પ્રાથમિક શાળા દ્વારા ઔનલાઈન ઉજવણી કરવામાં આવી. આ અન્વયે આ બધી શાળાઓ દ્વારા પોતપોતાના વિદ્યાર્થીઓને ઔનલાઈનથી જીવનમાં યોગનું મહત્વ સમજાવીને નિયમિતપણે યોગ કરવા શીખ આપવામાં આવી હતી.

વૃક્ષારોપણ

● 'કોવીડ-૧૯' મહામારી સામેની લડતમાં સમર્પિત બની રહી જીવન જોખમે સેવાઓ આપનારાં વિવિધ વ્યક્તિઓ અને સંસ્થાઓની સેવાઓને બિરદાવીને આભારદર્શનની લાગણી વ્યક્ત કરવા તેમજ કેમ્પસમાં પ્રદૂષણ મુક્ત નૈસર્જિક વાતાવરણ મળી રહે તેમજ ઓક્સિજનના પ્રમાણમાં વધારો થાય તે હેતુ સર્વ વિદ્યાલય કેમ્પસ, કરીમાં ૨૦૦૧ જેટલા છોડવાઓ કેમ્પસમાં ફરજ બજાવતાં ૮૨૫ (૫૫૨ પુરુષ અને ૩૭૨ મહિલા) કર્મચારીઓ દ્વારા રોપવામાં આવ્યા. ઉલ્લેખનીય છે કે આ કેમ્પસ બૂબ મોટા પ્રમાણમાં વનરાજી ધરાવતું હરિયાળું કેમ્પસ છે. આ પ્રસંગે મંડળના ચોરમેનશ્રી અને કરી સર્વ વિશ્વવિદ્યાલયના પ્રેસિડેન્ટશ્રી વલ્લભભાઈ પટેલ, મંત્રીશ્રીઓ સર્વશ્રી ડૉ. મહિલાભાઈ પટેલ અને શ્રી સંજયભાઈ પટેલ, ભગીની સંસ્થાઓના આચાર્યશ્રીઓ, કર્મચારીઓ વગેરે ઉપરિથિત રહ્યા હતાં.

સર્વ વિશ્વવિદ્યાલય વૃત્ત : કરી સર્વ વિશ્વવિદ્યાલય, ગાંધીનગરનું દ્વિમાસિક વૃત્તપત્ર


વર્ષ : ૧૧, અંક : ૪, જુલાઈ-ઓગસ્ટ, ૨૦૨૧, સંખ્યા અંક : ૬૪

સંપાદક : મહિલાભાઈ પ્રજાપતિ

પ્રકાશક : કુલસચિવ, કરી સર્વ વિશ્વવિદ્યાલય, સેક્ટર-૧૫, ગાંધીનગર-૨૮૨૦૧૬ ફોન : ૦૭૯-૨૭૨૪ ૪૬૮૦ ટાઈપસ્ટ્રિંગ અને મુદ્રક : શારદા મુદ્રણાલય, ૨૦૧, તિલકગાંધી, પંચવટી પહેલી લેન, આંબાવાડી,

અમદાવાદ-૩૮૦૦૦૬ ફોન : ૨૬૫૬ ૪૨૭૮

રાષ્ટ્રનું ગૌરવ : નોબેલ અવોર્ડથી વિભૂષિત ડૉ. સુભાષણ્યમ ચંદ્રશેખર : ફોટો ગોલેરી



Chandra receiving the Nobel Prize in physics from king Carl XVI Gustav of Sweden, Stockholm, 1983. Photograph by Jan Collsioo.



Chandra receiving the National Medal of Science from President Lyndon B Johnson, Washington, DC, 1967



Professor Chandrasekhar with his uncle C. V. Raman, 1951



With Prime Minister Indira Gandhi, New Delhi, 13 November 1968



Chandra Vilas, the Ayyars' home in Madras where Chandra lived before going to England.



Chandra and Lalitha after their marriage, Madras, 1936

Sarva Vishwavidyalaya Vṛtta : Bimonthly News Letter of Kadi Sarva Vishwavidyalaya, Gandhinagar

Year 11, Issue No. 3 JulyAugust 2021

Editor : Manibhai Prajapati

Published by Registrar, Kadi Sarva Vishwavidyalaya, Sector-15,

L.D.R.P. Engineering College Campus, Gandhinagar-382016

Printed by : Sharda Mudranalay, 201, Tilakraj, Panchwati 1st lane, Ambawadi, Ahmedabad-6



તા. ૧૫ ઓગસ્ટ, ૨૦૨૧ ના રોજ રાખ્ણના અપમા સ્વાતંત્ર્યદિનની ઉજવણી નિમિત્તે

સર્વ વિદ્યાલયના ગાંધીનગર કેમ્પસ, સેક્ટર-૨૪માં કેમ્પસ ડાયરેક્ટર

ડૉ. સોમભાઈ પટેલ ધ્વજવંદન કરાવી રહ્યા છે તે પ્રસંગનું દર્શય.

